

માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૪(ખ) હેઠળ નકકી કરવામાં આવેલ ૧૭ મુદ્દાઓને

લગતી ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, ગાંધીનગરની માહિતી

(તા:૩૧-૦૫-૨૦૨૫ સુધી અદ્યતન કર્યા મુજબની)

અનુક્રમણિકા

અનુ નં	માહિતી અધિનિયમ-૨૦૦૫ની કલમ-૪ હેઠળ નિયમ સંગ્રહ નંબર	વિગત	પાના નંબર
૧	-	પ્રસ્તાવના	૨
૨	૧	સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો	૪
૪	૨	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો	૯
૫	૩	નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ	૧૬
૬	૪	કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો	૧૭
૭	૫	કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમ સંગ્રહ અને દફતરો	૧૮
૮	૬	આયોગ અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોના વર્ગોનું પત્રક	૭૬
૯	૭	નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગતો	૭૭
૧૦	૮	આયોગના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક	૮૨
૧૧	૯	અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી	૮૭
૧૨	૧૦	વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું	૮૯
૧૩	૧૧	તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને ચૂકવેલા નાણા પરના અહેવાલોની વિગતો, દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્રો	૯૧
૧૪	૧૨	સહાયકી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને લાભાર્થીઓની વિગતો	૯૨
૧૫	૧૩	આયોગે આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિઓ મેળવનારની વિગતો	૯૩
૧૬	૧૪	વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી	૯૪
૧૭	૧૫	માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો	૯૫
૧૮	૧૬	જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દા અને અન્ય વિગતો	૯૬
૧૯	૧૭	અન્ય ઉપયોગી માહિતી	૯૭

પ્રસ્તાવના

પ્રત્યેક જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહાર તંત્રની રચના કરવા, કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગની રચના અને તેની સાથે સંકળાયેલ અથવા તેની આનુસંગિક બાબતોની જોગવાઈ કરવા બાબતનો માહિતીનો અધિકાર અધિનિયમ-2005 નો અમલ રાજ્યમાં તા.12-10-2005થી શરૂ થઈ ગયેલ છે. આ અધિનિયમ અમલમાં આવતાં માહિતી સ્વાતંત્ર અધિનિયમ-2002 રદ કરવામાં આવેલ છે. માહિતી અધિકાર અધિનિયમ-2005નો ઉદ્દેશ લોકતંત્રમાં નાગરિકોને માહિતગાર રાખવા અને જાહેરતંત્રની કામગીરીમાં પારદર્શિતા લાવવા અને તે દ્વારા ભ્રષ્ટાચારને કાબુમાં રાખવા તેમજ સરકાર અને તેના માધ્યમો પ્રજાને જવાબદાર રહે અને પ્રજા તેની હિસાબ માગી શકે તે રહેલો છે. તેથી હવે જે નાગરિકો માહિતી મેળવવા માગતા હોય તેમને અધિનિયમમાં અપવાદ કર્યો છે તે સિવાય તમામ માહિતી પૂરી પાડવા માહિતીના અધિકાર બાબતના અધિનિયમથી વિસ્તૃત કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ છે.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગને સ્પર્શતી માહિતી સુગમતાથી નાગરિકોને મળી રહે તે માટે માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ-4ની જોગવાઈ મુજબ આ માહિતી પુસ્તિકામાં નીચે જણાવેલ વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે. તેમજ આયોગની વેબસાઇટ www.gercin.org ઉપર પણ આ માહિતી ઉપલબ્ધ છે.

- ૧ સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
- ૨ અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
- ૩ નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ
- ૪ કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો
- ૫ આયોગે કાર્યો કરવા માટેના અધિનિયમો, નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહ અને દફતરો
- ૬ જાહેરતંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોના વર્ગોનું પત્રક
- ૭ નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહપરામર્શ- અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની વ્યવસ્થા હોય તો તેની વિગત
- ૮ જાહેરતંત્રના ભાગ તરીકે રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક
- ૯ અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી
- ૧૦ વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું
- ૧૧ તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને ચુકવેલા નાણા પરના અહેવાલોની વિગતો, દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્રો
- ૧૨ સબસીડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને લાભાર્થીઓની વિગતો
- ૧૩ આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિઓ મેળવનારની વિગતો
- ૧૪ વિજાણુરૂપે ઉપલબ્ધ માહિતી
- ૧૫ માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગત
- ૧૬ જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દો અને અન્ય વિગતો
- ૧૭ અન્ય ઉપયોગી માહિતી

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગને સંબંધિત ઘણી ખરી માહિતી આ પુસ્તિકામાં જાહેર જનતાને સામેથી જ પૂરી પાડી લોકતંત્રની કામગીરીમાં પારદર્શિતા લાવવા એક સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવેલ છે. આમ છતાં આ પુસ્તિકા આખરી નથી અને જાહેર જનતાના પ્રતિભાવો, સૂચનો જાણ્યા બાદ દર વર્ષે આ પ્રકારની પુસ્તિકા આયોગ દ્વારા અદ્યતન કરવામાં આવનાર છે. આશા છે જાહેર જનતા આ પુસ્તિકાનો મહત્તમ લાભ લેશે તેમજ જાહેર જનતા તરફથી માહિતી પુસ્તિકા સંબંધી કોઇ સૂચનો હોય તો તે સહર્ષ આવકાર્ય છે.

આ માહિતી પુસ્તિકા સિવાયની વિભાગને સંબંધિત કોઇ માહિતી કોઇ વ્યક્તિને વિભાગ પાસેથી મેળવવી હોય તો તેઓ અવશ્યપણે આયોગના અધિકારીનો સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી શકે છે.

રંજીથકુમાર, આઈએએસ
સચિવ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,
ગાંધીનગર

નિયમ સંગ્રહ-૧

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો: ટૂંકો ઇતિહાસ અને આયોગની રચના

ભારતમાં ઇલેક્ટ્રીક સપ્લાય ઉદ્યોગ માટેનું મૂળભૂત માળખું ભારત વીજળી અધિનિયમ, 1910 અન્વયે ઉભું કરેલ. વિદ્યુત (પુરવઠા) અધિનિયમ, 1948 દ્વારા રાજ્યોમાં વિદ્યુત બોર્ડની રચના કરવામાં આવેલ. રાજ્ય વિદ્યુત બોર્ડ દ્વારા રાજ્યમાં વીજળી પૂરી પાડવાની જવાબદારી ઉપાડી અને તે અનુસાર સક્ષમ પંચવર્ષીય યોજના મારફતે રાજ્ય વિદ્યુત બોર્ડ પ્લાનફંડનો ઉપયોગ કરીને ઝડપી વિસ્તૃતીકરણ હાથ ધરેલ. કાળક્રમે રાજ્ય વિદ્યુત બોર્ડની કામગીરી વિવિધ પરિબલોને કારણે કથળેલ, જેમકે, રાજ્ય વિદ્યુત બોર્ડને પ્રશુલ્કતા દર(ટેરીફ) નક્કી કરવાની સત્તા નિયત કરવામાં આવેલ હોવા છતાં તેઓ વ્યવસાયિક અને સ્વતંત્ર રીતે ટેરીફ અંગેના નિર્ણય લઈ શકતા નહીં અને વ્યવહારમાં ટેરીફનો નિર્ણય રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતા. ફળ સ્વરૂપ કોસ સબસીડી ટકી ન શકે તેવા સ્તરે પહોંચી. આ મુદ્દાનો ઉકેલ લાવવા અને ટેરીફના નિર્ણય કરવાથી સરકારને દૂર રાખવા માટે વર્ષ 1998માં કેન્દ્ર સરકાર દ્વારા વીજળી નિયંત્રક આયોગ અધિનિયમ, 1998 ઘડવામાં આવેલ. સદર અધિનિયમ દ્વારા કેન્દ્રિય નિયંત્રક આયોગની રચના કરવામાં આવેલ અને તેની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારો દ્વારા રાજ્ય વિદ્યુત નિયંત્રક આયોગની રચના કરવામાં આવેલ.

વીજળી નિયંત્રક આયોગ અધિનિયમ, 1998ની કલમ-17 અન્વયે ગુજરાત સરકાર દ્વારા તા.12 નવેમ્બર, 1998ના રોજ જાહેરનામા દ્વારા ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની રચના કરવામાં આવેલ. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે તારીખ:19 એપ્રિલ, 1999ના રોજથી તેની કાર્યવાહી શરૂ કરેલ. ગુજરાતમાં વિજ ક્ષેત્રે સુધારણાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા 12મી મે, 2003ના રોજ ગુજરાત વીજળી ઉદ્યોગ(પુનર્ગઠન અને વિનિયમન) અધિનિયમ, 2003 રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ. ગુજરાત વીજળી ઉદ્યોગ(પુનર્ગઠન અને વિનિયમન) અધિનિયમ, 2003ની કલમ (3) (1) અને (3) (3) (a) અન્વયે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગને પ્રથમ આયોગ તરીકે ગણી લેવામાં આવેલ. આયોગ અધ્યક્ષ અને બે સભ્યોનું બનેલું વૈદ્યાનિક મંડળ છે. આયોગની કચેરી ગાંધીનગર, ગિફ્ટ-૧, ગિફ્ટ સીટી ખાતે પોતાની માલિકીની છે.

વિજ ઉત્પાદન, પ્રવહન, વિતરણમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને ઉત્તેજન આપવાની નીતિ અનુસાર અને રાજ્ય સરકારોને વિજ નિયંત્રક જવાબદારીમાંથી દૂર કરી રાજ્ય વિદ્યુત નિયંત્રક આયોગને વિજ નિયંત્રણ જવાબદારી સોંપવના ઉદ્દેશથી ભારત વીજળી અધિનિયમ, 1910, વીજળી પુરવઠા અધિનિયમ, 1948 અને વીજળી નિયંત્રક આયોગ અધિનિયમ, 1998માંની જોગવાઈઓને નવીન સર્વગ્રાહી કાયદા દ્વારા સુસંવાદીત અને બુદ્ધિગમ્ય કરવાની જરૂરિયાત ઉભી થઈ. તે અનુસાર રાજ્ય સરકારો અને સંબંધિત નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ કરી કેન્દ્ર સરકાર દ્વારા વીજળી અધિનિયમ, 2003 જાહેર કરવામાં આવેલ, જે ૧૦ જૂન, ૨૦૦૩થી અમલમાં આવેલ છે.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની કાર્યવાહી :

૨.૧ વીજળી અધિનિયમ-2003ની કલમ-86 મુજબ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ નીચે પ્રમાણે કાર્યો બજાવશે.

(૧) ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (રાજ્ય કમિશન) નીચેનાં કાર્યો બજાવશે:-

(એ) ઇલેક્ટ્રીસીટીના જનરેશન, સપ્લાય, ટ્રાન્સમીશન અને વ્હીલીંગ માટે, રાજ્યની અંદર જથ્થાબંધ, વેચાણ,

જથ્થાબંધ અથવા યથાપ્રસંગ છૂટક ટેરીફ નક્કી કરવાનું.

પરંતુ, કલમ 42 હેઠળ ગ્રાહકોના વર્ગને ખુલ્લા પ્રવેશની પરવાનગી આપી હોય ત્યારે, રાજ્ય કમિશન, સદરહુ વર્ગના ગ્રાહક માટે ફક્ત વ્હીલીંગ ચાર્જીસ અને તેની ઉપરનો જો કોઇ સરચાર્જ હોય તો તે નક્કી કરશે.

- (બી) રાજ્યની અંદર વહેંચણી અને પુરવઠા માટે વીજળી શક્તિ ખરીદવા માટેના કરાર મારફતે, જનરેટીંગ કંપની અથવા લાઇસન્સદાર પાસેથી અથવા બીજા સાધનો પાસેથી જે કિંમતે ઇલેક્ટ્રીસિટી પ્રાપ્ત કરી શકાય તે કિંમત અથવા ડીસ્ટ્રીબ્યુશન લાઇસન્સદારની ઇલેક્ટ્રીસિટી ખરીદી અને પ્રાપ્તિ પ્રક્રિયાનું નિયમન કરવાનું
- (સી) આંતરરાજ્ય ટ્રાન્સમીશન અને ઇલેક્ટ્રીસિટીનું વ્હીલીંગની સગવડની સરળતા કરી આપવી.
- (ડી) રાજ્યની અંદર ટ્રાન્સમીશન લાઇસન્સદાર, ડીસ્ટ્રીબ્યુશન લાઇસન્સદાર અને ઇલેક્ટ્રીસિટી વેપારી તરીકે કામ કરવા માંગતી વ્યક્તિઓને લાઇસન્સ આપવાનું;
- (ઇ) ગ્રીડ જોડાણ માટે અને કોઇપણ વ્યક્તિને ઇલેક્ટ્રીસિટીના વેચાણ સાથે જોડવા માટેના યોગ્ય પગલાંની જોગવાઈ કરીને, ઊર્જાના સાધનો તાજા કરવામાંથી ઇલેક્ટ્રીસિટીના કો-જનરેશન અને જનરેશનની વૃદ્ધિ અને આવા સાધનમાંથી ઇલેક્ટ્રીસિટી ખરીદવા માટે ડીસ્ટ્રીબ્યુશન લાઇસન્સદારના ક્ષેત્રમાં ઇલેક્ટ્રીસિટીના કુલ વપરાશના ટકાવારી નિર્દિષ્ટ કરવાનું;
- (એફ) લાઇસન્સદારો અને જનરેટીંગ કંપનીઓ વચ્ચેની તકરાર અંગે ન્યાયનિર્ણય કરવાનું અને લવાઈ માટે તકરાર મોકલવાનું.
- (જી) આ અધિનિયમ હેતુ માટે ફી લેવાનું.
- (એચ) કલમ 79-ની પેટા-કલમ(1) ના ખંડ (એચ) હેઠળ નિર્દિષ્ટ કરેલ ગ્રીડ કોડ સાથે સુસંગત રાજ્ય ગ્રીડ કોડ નિર્દિષ્ટ કરવાનું
- (આઇ) લાઇસન્સદારોએ કરેલી સર્વિસની ગુણવત્તા, સાતત્યતા અને વિશ્વસનીયતાના સંબંધમાં ધોરણો નિર્દિષ્ટ કરવાનું અથવા તેનો અમલ કરવાનું
- (જે) આંતર-રાજ્ય ઇલેક્ટ્રીસિટી વેપારમાં, જરૂરી ગણે તો ટ્રેડીંગ માર્જિન નક્કી કરવાનું
- (કે) આ અધિનિયમ હેઠળ તેને સોંપવામા આવે તેવા બીજા કાર્યો અદા કરવાનું
- (ર) રાજ્ય કમિશન, રાજ્ય સરકારને, નીચેની તમામ અથવા કોઇપણ બાબતો અંગે સલાહ આપશે,
 - i. ઇલેક્ટ્રીસિટી ઉદ્યોગની પ્રવૃત્તિઓમાં હરિફાઇ, કાર્યક્ષમતા અને કરકસરને ઉત્તેજન આપવાની બાબત
 - ii. ઇલેક્ટ્રીસિટી ઉદ્યોગમાં રોકાણની વૃદ્ધિની
 - iii. રાજ્યમાં ઇલેક્ટ્રીસિટી ઉદ્યોગની પુનર્રચના અને પુનર્ગઠન;
 - iv. ઇલેક્ટ્રીસિટી જનરેશન, ટ્રાન્સમીશન, ડીસ્ટ્રીબ્યુશન અને ટ્રેડીંગને લગતી બાબતો અથવા સરકારે રાજ્ય કમિશનને મોકલેલી બીજી કોઇપણ બાબતો
- (3) રાજ્ય કમિશન પોતાની સત્તા વાપરતી વખતે અને પોતાનાં કાર્યો બજાવતી વખતે પારદર્શકતાની ખાતરી આપવી જોઇશે.
- (4) પોતાના કાર્યો અદા કરતી વખતે, રાજ્ય કમિશન, કલમ-3ની હેઠળ પ્રસિધ્ધ કરેલ નેશનલ ઇલેક્ટ્રીસિટી નીતિ, નેશનલ ઇલેક્ટ્રીસિટી આયોજન અને ટેરીફ નીતિ દ્વારા માર્ગદર્શન મેળવશે.

- ૨.૨ વધુમાં ગુજરાત વીજળી ઉદ્યોગ (પુર્નગઠન અને વિનિયમન) અધિનિયમ, ૨૦૦૩ની કલમ-૧૭ પ્રમાણે નીચેના કાર્યો બજાવશે.
- (એ) વિદ્યુતની ખરીદી, પ્રવહન, વિતરણ, પુરવઠા અને વિદ્યુતના ઉપયોગ, સેવાની ગુણવત્તાનું નિયમન કરવું અને ગ્રાહક અને સેવાનો ઉપયોગિતાનો લાભ લેનાર બીજી વ્યક્તિઓ તથા યુટીલીટીઝ, બંનેના હિતને ધ્યાનમાં લઈને વીજળીના વહન, વિતરણ અથવા પુરવઠા માટે ચૂકવવાના ટેરિફ અને ચાર્જનું નિયમન કરવા બાબત
- (બી) (૧) રાજ્યમાં વહન, વેચાણ, વિતરણ અને પુરવઠો પૂરો પાડવા માટે કોઇપણ સ્ત્રોતમાંથી વીજળી ખરીદવા અને તે પ્રાપ્ત કરવા બાબત;
- (૨) આવી ખરીદી અથવા પ્રાપ્તિ માટેની કિંમત નક્કી કરવા બાબત;
- (સી) રાજ્યમાં વીજળી વપરાશમાં કાર્યદક્ષતા, કરકસર અને સલામતીને ઉત્તેજન આપવા બાબત;
- (ડી) આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર જથ્થાબંધ, મોટા પ્રમાણમાં, ગ્રીડથી અથવા છૂટક વીજળી માટેની ટેરિફ નક્કી કરવા બાબત;
- (ઇ) આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર રાજ્યની અંદર પ્રવહન સવલતના ઉપયોગ માટે ચૂકવવાની ટેરિફ નક્કી કરવા બાબત;
- (એફ) આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર પરવાનો કાઢી આપવા બાબત અને પરવાનામાં સમાવિષ્ટ કરવાની શરતો નક્કી કરવા બાબત;
- (જી) આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર ફી, ચાર્જ અને દંડ લેવા અને પોતાના ખર્ચ માટે તે પોતાની પાસે રાખવા બાબત;
- (એચ) લાઇસન્સદારો કામકાજનું નિયમન કરવા બાબત અને લાઇસન્સદારોનું કામકાજ, કાર્યક્ષમ, કરકસરયુક્ત અને વાજબી કરવા બાબત;
- (આઇ) વીજળીના ઉત્પાદન, પ્રવહન, વિતરણ, પુરવઠા અને વપરાશને ઉત્તેજન આપવા માટે અન્ય વ્યક્તિઓ સાથે સંકલન કરીને ભાવિ પ્લાન અને યોજનાઓ ઘડવા માટે લાઇસન્સદારોને ફરમાવવા બાબત..
- (જે) માહિતી એકત્ર કરવા અને વીજળી વપરાશની માગનો અંદાજ કાઢવા લાઇસન્સદારોને ફરમાવવા બાબત
- (કે) સેવાની સલામતી, ગુણવત્તા, સાતત્ય અને વિશ્વસનીયતાને લગતા ધોરણો સહિત રાજ્યમાં વિદ્યુત ઉદ્યોગ માટે ધોરણો સ્થાપવા અને અમલમાં લાવવા બાબત;
- (એલ) રાજ્યમાંના વિદ્યુત ઉદ્યોગમાં સ્પર્ધાત્મકતાને ઉત્તેજન આપવા બાબત
- (એમ) રાજ્ય ગ્રીડ અને વીજ તંત્રના સંચાલન માટે ધોરણો દ્વારા ધારા અને પ્રથાઓ ઘડી કાઢવા બાબત;
- (એન) વીજળીના કાર્યક્ષમ ઉપયોગ અને સંરક્ષણ, વિદ્યુતના વપરાશમાં બગાડ અને ઘટ ઓછી કરવા માટે ઉત્તેજન આપવા બાબત
- (ઓ) રાજ્યમાં વીજળીના ઉત્પાદન, વહન, વિતરણ, પુરવઠો અને ઉપયોગને લગતી બાબતો અંગે પંચે પોતે યોગ્ય ગણે તે રીતે રાજ્ય સરકારને આવી સલાહ આપવા બાબત
- (પી) આયોગ પોતે યોગ્ય ગણે તો, ગ્રાહકોની તકરારો નિયંત્રિત અને ગેરવાજબી વેપારપ્રથા અને લાઇસન્સદારોની બાબતના સંચાલન અને વહીવટને લગતી બાબતોની તજવીજ કરતી બીજી એજન્સીઓને અને મંડળોને બાબતો લખી જણાવવા બાબત
- (ક્યુ) લાઇસન્સદારો વચ્ચેની તકરારો અને મતભેદોનો ન્યાયનિર્ણય કરવા અને આ અધિનિયમની જોગવાઈઓ

અનુસાર જરૂરી જણાય તો તે બાબતોને લવાદી માટે લખી મોકલવા બાબત; અને
(આર) આયોગ પોતે યોગ્ય ગણે તેવા તમામ આનુષંગિક અથવા પારિણામિક કાર્યો હાથ ધરવા બાબત.

૩ આયોગની સત્તાઓ :

૩.૧ વીજળી અધિનિયમ-૨૦૦૩ હેઠળ સત્તાઓ :

વીજળી અધિનિયમ-૨૦૦૩ની કલમ-૯૪ અન્વયે આયોગની સત્તાઓ નીચે મુજબ છે :

(૧) આ અધિનિયમ હેઠળની કોઇપણ તપાસ અથવા કાર્યવાહીના હેતુઓ માટે, દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ (સન ૧૯૦૮ના ૫મા) હેઠળ નીચેની બાબતોના સંબંધમાં દીવાની કોર્ટમાં નિહિત થાય છે. તેવી જ સત્તા રહેશે.

(અ) કોઇપણ વ્યક્તિને બોલાવવાની અને હાજર રહેવાની ફરજ પાડવાની અને સોગંદ ઉપર જુબાની લેવાની;

(બી) પુરાવા તરીકે રજૂ કરી શકાય તેવા કોઇપણ દસ્તાવેજ અથવા બીજી મહત્વની બાબતો શોધવાની અને રજૂ કરવાની;

(સી) એફીડેવીટ(સોગંદનામા) ઉપર પુરાવા સ્વીકારવાની,

(ડી) કોઇપણ જાહેર રેકર્ડ હંગામી રીતે પ્રાપ્ત કરવાની;

(ઈ) સાક્ષીઓની જુબાની માટે કમિશન કાઢવાની;

(એફ) પોતાના નિર્ણયો, આદેશો અને હુકમોની પુનર્વિચારણા કરવાની

(જી) ઠરાવવામાં આવે તેવી બીજી કોઇપણ બાબત.

(૨) યોગ્ય કમિશનની કોઇપણ કાર્યવાહીમાં, સુનાવણીમાં અથવા તેની સમક્ષની બાબતમાં, તે કમિશન યોગ્ય ગણે તેવા વચગાળાના હુકમો કરવાની યોગ્ય કમિશનને સત્તા રહેશે.

યોગ્ય કમિશન, પોતાની સમક્ષની કાર્યવાહીમાં ગ્રાહકોના હિતનું પ્રતિનિધિત્વ કરવા પોતે યોગ્ય ગણે તેવી કોઇપણ વ્યક્તિને અધિકૃત કરી શકશે વધુમાં, વીજળી અધિનિયમ-૨૦૦૩ની કલમ-૧૮૧માં દર્શાવ્યા મુજબ વિનિયમો ઘડવાની સત્તાઓ રહેશે.

૩.૨ ગુજરાત વીજળી ઉદ્યોગ(પુનર્ગઠન અને વિનિયમન) અધિનિયમ, ૨૦૦૩ની કલમ-૧૮ હેઠળ આયોગની સત્તાઓ:

(૧) આયોગને આ અધિનિયમ હેઠળની કોઇપણ તપાસના હેતુઓ માટે નીચેની બાબતોના સંબંધમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ (સને ૧૯૦૮નો ૫મો) હેઠળ દાવાની ઇન્સાફી કાર્યવાહી કરતી વખતે દિવાની કોર્ટની સત્તા રહેશે.

(અ) કોઇપણ સાક્ષીને બોલાવવાની અને હાજર રખાવવાની અને તેની સોગંદ ઉપર જુબાની લેવાની,

(બી) કોઇપણ દસ્તાવેજ અથવા પુરાવા તરીકે રજૂ કરી શકાય એવી બીજી કોઇપણ મહત્વની વસ્તુ શોધવાનું અને રજૂ કરવાનું ફરમાવવા બાબત,

(સી) સોગંદનામા પર પુરાવા મેળવવાની,

(ડી) કોઇપણ કોર્ટ અથવા કચેરીમાંથી કોઇપણ જાહેર રેકોર્ડ અથવા તેની નકલ મંગાવવાની,

(ઈ) સાક્ષીઓ અથવા દસ્તાવેજો તપાસવા માટે કમિશનો કાઢવાની,

(એફ) પોતાના નિર્ણયો, આદેશો અને હુકમોનું પુર્નવિચારણા કરવાની, અને

(જી) આયોગ વિનિયમોથી ઠરાવે તેવી બીજી કોઇપણ બાબત,

આયોગને, પોતાની સમક્ષની કોઇપણ બાબતમાં પોતે યોગ્ય ગણે તેવો વચગાળાનો હુકમ કરવાની સત્તા રહેશે.

આયોગનો એવો અભિપ્રાય હોય કે આ અધિનિયમના હેતુઓ માટે તેમ કરવું જરૂરી છે, ત્યારે કોઇપણ વ્યક્તિને લેખિતમાં હુકમ કરીને નીચે પ્રમાણે ફરમાવી શકશે.

(એ) સદરહુ હુકમમાં નિર્દિષ્ટ કરેલા અધિકારી સમક્ષ, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી વિજળીના વહન, વિતરણ, પુરવઠા અથવા વપરાશને લગતી કોઇપણ બાબતના સંબંધમાં તે વ્યક્તિની કસ્ટડી અથવા નિયંત્રણમાં હોય તેવા ચોપડા, હિસાબો અથવા દસ્તાવેજો રજૂ કરવાનું અથવા તેને તપાસવા દેવાનું, અને (બી) હુકમમાં નિર્દિષ્ટ કરેલ અધિકારીને, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી પોતાના કબજા, સત્તા અથવા નિયંત્રણમાંની માહિતી પૂરી પાડવાનું.

આ અધિનિયમ હેઠળની કોઇપણ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન, આયોગને એવું માનવાને કારણ હોય કે જેના સંબંધમાં આવી તપાસ કરવામાં આવી હોય અથવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવા વીજળીના વહન, વિતરણ અને પુરવઠા અથવા વપરાશમાં રોકાયેલ કોઇપણ વ્યક્તિના અથવા તેને લગતા કોઇપણ ચોપડા અથવા હિસાબો અથવા દસ્તાવેજો નાશ કરવામાં, ફાડવામાં, ફેરફાર કરવામાં, ખોટા તૈયાર કરવામાં અથવા છૂપાવવામાં આવી રહ્યા છે અથવા તેમ કરી શકાય, ત્યારે આયોગ, આયોગના કોઇપણ અધિકારીને લેખિત હુકમથી, વ્યક્તિના ધંધાના કોઇપણ સ્થળમાં અથવા આયોગને એમ માનવાને કારણ હોય કે, વ્યક્તિ, ચોપડા, અથવા હિસાબો અથવા દસ્તાવેજો જ્યાં રાખ્યા છે અથવા તત્સમય પૂરતા રાખી રહી છે તેવા બીજા કોઇપણ સ્થળમાં પ્રવેશવા અને ઝડપી લેવા અને તે જપ્ત કરવા માટે, અધિકૃત કરી શકશે અને તેની પહોંચ આપ્યા પછી અને આવી તપાસના સંબંધમાં જરૂરી જણાય તેટલી મુદત સુધી રાખી શકશે. ઝડપીને લગતી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની જોગવાઈઓ શક્ય હોય તેટલે સુધી, પેટા-કલમ (૪) હેઠળ કરેલી ઝડપીને લાગુ પડશે. પંચ, સામાન્ય અથવા ખાસ હુકમથી, કોઇપણ વ્યક્તિને, સમયાંતરે અથવા જેમ અને જ્યારે જરૂરી હોય ત્યારે અથવા વીજળીના ઉત્પાદન, પ્રવહન, વિતરણ અને પુરવઠા અથવા તેના વપરાશને લગતી તેની પ્રવૃત્તિ સંબંધી કોઇપણ માહિતી, આયોગને પૂરી પાડવાનું ફરમાવી શકશે.

આયોગ અને તેની કચેરી :

સરનામું : ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ
છઠ્ઠો માળ, ગીફ્ટ-૧, રોડ-૫ સી, ઝોન-૫,
ગીફ્ટ સીટી, ગાંધીનગર,
ગુજરાત-૩૮૨૦૫૦
ફોન નં- ૦૭૯-૨૩૬૦૨૦૦૦
ફેક્સ નં-૦૭૯-૨૩૬૦૨૦૫૪-૨૩૬૦૨૦૫૫
સમય : સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક

નિયમ સંગ્રહ-૨

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો : સત્તાઓ:

ક્રમ	સત્તા નો પ્રકાર	હિસાબી અધિકારી	વિદ્યુત લોકપાલ	સંયુક્ત સચિવ	સચિવ	અધ્યક્ષ	આયોગ
૧	સલાહકાર અને વકીલ નું નિમણુંક અંગે						
	અ) સલાહકારની નિમણુંક અને તેની ફી અંગે	-	-	-	સંપૂર્ણ સત્તા	સંપૂર્ણ સત્તા	-
	બ) સિનિયર એડવોકેટ/એડવોકેટ ની ફી અંગે	-	-	-	સંપૂર્ણ સત્તા	સંપૂર્ણ સત્તા	-
	ક) અન્ય લિગલ /કાયદાકીય ખર્ચાઓ અંગે	-	-	દરેક કિસ્સામાં ૧ લાખ સુધી	સંપૂર્ણ સત્તા	સંપૂર્ણ સત્તા	-
૨	ટેન્ડર્સ						
	અ) જાહેરાત ટેન્ડર	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	બ) મર્યાદિત ટેન્ડર	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સામાં ૨.૫૦ લાખ સુધી	દરેક કિસ્સામાં ૧૦ લાખ સુધી	સંપૂર્ણ સત્તા
	ક) ટેન્ડર ખોલવા અંગે	સમિતિની નિમણૂક કરવામાં આવશે	સમિતિની નિમણૂક કરવામાં આવશે	સમિતિની નિમણૂક કરવામાં આવશે	સમિતિની નિમણૂક કરવામાં આવશે	સમિતિની નિમણૂક કરવામાં આવશે	સમિતિની નિમણૂક કરવામાં આવશે
૩	બજેટ/હિસાબો						
	અ) બજેટ	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	બ) વાર્ષિક હિસાબો	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
૪	બિલ્ડીંગ, બાંધકામ અને સિવિલ કામ						
	અ) સિવિલ કામ ની મંજૂરી	-	-	-	દરેક કિસ્સા માં દીઠ રૂપિયા ૨૫ લાખ સુધી	દરેક કેસ દીઠ રૂપિયા ૧ કરોડ સુધી	સંપૂર્ણ સત્તા
	બ) ઓફિસ બિલ્ડીંગ માટે જમીન ખરીદી અને બિલ્ડીંગ ખરીદી અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	ક) ઇન્ટરિયર ડિઝાઇન અને ઓફિસ ફર્નિશીંગ અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	ડ) ઓફિસ બિલ્ડીંગ ભાડે લેવા બાબત	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા

૫		ભાડા કરાર						
	અ)	ઓફિસ માટે સાધનો ભાડેથી અને સેવાઓ અંગે	-	-	-	સંપૂર્ણ સત્તા	-	-
	બ)	ફેસિલીટી મેનેજમેન્ટ ની સેવાઓ/માનવબળ સેવાઓ ભાડે લેવા અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	ક)	વાહનો ભાડા સેવાઓ અંગે	-	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
૬		ખરીદી						
	અ)	ન્યુઝ પેપર્સ/મેગેઝિન	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	સંપૂર્ણ સત્તા	-	-	-
	બ)	કચેરી સાધનો ખરીદી અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૨,૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા
	ક)	કચેરી ફર્નિચર ખરીદી અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૨,૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા
	ડ)	બૂક્સ ખરીદી, સામયિક, સરકારી પ્રકાશન અને અહેવાલ અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૨,૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-
	ઇ)	સ્ટેશનરી ખરીદી, રબર સ્ટેમ્પ અને સત્તાવાર કચેરી સ્ટેમ્પ અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	એફ)	વાહન ખરીદી	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	જી)	મોબાઇલ ફોન ખરીદી	-	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	એચ)	અન્ય ઉપલોકતા વસ્તુઓની ખરીદી અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
૭		રોકાણ						
	અ)	બેંક ખાતું ખોલવા અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	બ)	સરપ્લસ ભંડોળ રોકાણ	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા

૮		બેઠક/પરિસંવાદ/તાલીમ						
	અ)	લંચ/સત્તાવાર બેઠક માં નાસ્તો/પરિસંવાદ	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	બ)	નામાંકન અને સ્ટાફ ની તાલીમ માટેની મંજૂરી/વર્કશોપ/પરિસંવાદો અંગે	-	-	-	સંપૂર્ણ સત્તા	-	-
	ક)	સ્ટાફ તાલીમ/વર્કશોપ/પરિસંવાદ ખર્ચ અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા		
	ડ)	વાર્ષિક સભ્યપદ ફી અંગે	-	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
૯		સમારકામ અને મરામત અંગે						
	અ)	કચેરી સાધનો માટે વાર્ષિક જાળવણી કરાર અંગે	-	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	બ)	આઇટી માટે વાર્ષિક જાળવણી કરાર અંગે	-	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	ક)	મકાન મરામત સેવાઓ અંગે	-	-	-	સંપૂર્ણ સત્તા	-	-
	ડ)	કચેરી સમારકામ/કચેરી સાધનો/કચેરી ફર્નિચર સમારકામ અને મરામત	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	ઇ)	વાહનો મરામત અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કેસ માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
૧૦		સ્ટાફ						
	અ)	સ્ટાફ ભરતી/બદલી/ઉચ્ચત્તર પગાર/એબ્સોર્પ્શન અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	બ)	પગાર પ્રક્રિયા	સંપૂર્ણ સત્તા	-	સંપૂર્ણ સત્તા	-	-	-
	ક)	સ્ટાફને Incentive મંજૂર કરવા અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	ડ)	બાકી રકમ ચુકવવા અંગે	-	-	સંપૂર્ણ સત્તા	-	-	-
	ઇ)	ટેલિફોન ખર્ચ , ઇન્ટરનેટ ખર્ચ, મોબાઇલ બિલ્સ અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	સંપૂર્ણ સત્તા	-	-	-
	એફ)	તબીબી ખર્ચ ના વળતર અંગે	-	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	જી)	લોકલ પ્રવાસ ખર્ચ અંગે	-	-	સંપૂર્ણ સત્તા (વિષયોક્ત પ્રવાસ આયોજન ની મંજૂરી મળેથી)	-	-	-

	એચ)	વિદેશ પ્રવાસ ખર્ચ અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	આઇ)	રજા રોકડ/રજા રાહત પ્રવાસ/ગ્રેજ્યુઇટી અંગે	-	-	-	સંપૂર્ણ સત્તા	-	-
	જે)	HBAA/સ્કુટર/કાર પેશગીની મંજૂરી અંગે	-	-	-	સંપૂર્ણ સત્તા	-	-
	કે)	સ્ટાફ વેલફેર	-	-	-	સંપૂર્ણ સત્તા	-	-
૧૧		પરચુરણ						
	અ)	પ્રિન્ટીંગ અને બાઇન્ડીંગ	-	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	બ)	જાહેરાત	-	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-	-
	ક)	વીજળી/ગેસ/પાણી ખર્ચ/પોસ્ટેજ એન્ડ ટેલિગ્રાફ/ટેલિફોન અને ઇન્ટરનેટ ખર્ચ અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	સંપૂર્ણ સત્તા	-	-	-
	ડ)	મ્યુનિસિપલ વેરો	-	-	સંપૂર્ણ સત્તા	-	-	-
	ઇ)	વાહન વિમા અંગે	-	-	સંપૂર્ણ સત્તા	-	-	-
	એફ)	આકસ્મિક ખર્ચ અંગે						
		અનિશ્ચિત પુનરાવર્તિત વસ્તુઓ અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૨,૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-
		અનિશ્ચિત અનાવર્તિક વસ્તુઓ અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૨,૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-
૧૨		વિદ્યુત લોકપાલ કચેરી ખર્ચ અંગે	-	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૨,૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-
૧૩		માંડી વાળવા અંગે						
	અ)	નિકાલ/વાહનો ની રદ કરવા અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	બ)	નિકાલ/આઇટી આર્ટિકલ નિકાલ/રદ/કચેરી સાધનો નિકાલ/રદ કરવા અંગે	-	-	-	-	-	સંપૂર્ણ સત્તા
	ક)	નિકાલ/વધારા ની વસ્તુઓ નો નિકાલ કરવા અંગે	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૫૦,૦૦૦/- સુધી	દરેક કિસ્સા માં રૂપિયા ૨,૫૦,૦૦૦/- સુધી	સંપૂર્ણ સત્તા	-

	S)	રાઇટ ઓફ રિસિવેબલ	-	-	5000 p.a.	૧૦,૦૦૦/- પ્રતિ વર્ષ	-	૨૦,૦૦૦/- પ્રતિ વર્ષ
૧૪		ચેક સાઇન કરવા અંગે	હિસાબી અધિકારી સાથે સંયુક્ત સચિવ	સ્ટાફ ઓફિસર સાથે વિદ્યુત લોકપાલ	હિસાબી અધિકારી સાથે સંયુક્ત સચિવ	-	-	-

ફરજો : આ સાથેના પરિશિષ્ટ-૧ મુજબ

સંસ્થાના અધિકારી/ કર્મચારીઓની ફરજો

(૧) નિયામક : (ટેરિફ, વહિવટ અને હિસાબ): નિયામક, નાયબ નિયામક, સંયુક્ત સચિવ, હિસાબી અધિકારી, એકઝીક્યુટીવ, જૂની આસીટન્ટ.

પ્રશુલ્ક, વહિવટી અને હિસાબી શાખાના કાર્ય પર દેખરેખ રાખશે, આયોગ દ્વારા સોંપવામાં આવે તેવી બીજી કોઇપણ ફરજો

ટેરિફ: બહુવર્ષિય પ્રશુલ્ક ના અધિનિયમો, એકંદર મહેસૂલ જરૂરિયાત.ટેરીફ પીટીશન, ટેરિફ ઓર્ડરનું પાલન, વીજ પ્રાપ્તિ માર્ગદર્શિકા, સબસિડી પીટીશન.બળતણ ભાવ અને વીજ ખરીદી સમાયોજન ની સંચાર અને તપાસ, RIMS નું વિશ્લેષણ, રાજ્ય સલાહકાર સમિતિ, નિયમનકારી બાબતો – LAQ, LSQ, RSQ, MoP, EPD, FoR, CERC, CEA અન્ય SERCs વગેરે નું સંચાર/સંકલન.. આયોગ દ્વારા સોંપવામાં આવે તેવી બીજી કોઇપણ ફરજો,

(૨) વહીવટી અને હિસાબી શાખા: નિયામક, સંયુક્ત સચિવ, હિસાબી અધિકારી, એકઝીક્યુટીવ, જૂની આસીટન્ટ

વહીવટી શાખા દ્વારા થતી કામગીરી

- કર્મચારીઓના પગારઘોરણ અને ભથ્થાઓને લગતી બાબતો
- કચેરીની જાળવણી
- કચેરીની વહીવટી તથા સંચાલનની કામગીરી તથા કર્મચારીઓની સર્વિસને લગતી બાબતોની સંપૂર્ણ કામગીરી વહીવટી શાખા દ્વારા કરવામાં આવે છે.

હિસાબી શાખા દ્વારા થતી કામગીરી

- હિસાબી શાખા દ્વારા આવક-જાવક, હિસાબોની તૈયારી અને ચકાસણી, આનુસંગિક દસ્તાવેજો તથા રેકૉર્ડની જાળવણી કરવામાં આવે છે. તેમજ અંદાજપત્રની તૈયારી, કર્મચારીના પગાર તેમજ ભથ્થાની ચુકવણી પણ કરવામાં આવે છે.

(૩) લિગલ શાખા : કાનુની સલાહકાર, નાયબ નિયામક, મદદનીશ નિયામક, એકઝીક્યુટીવ:

પીટીશનો/અરજીઓ ની પ્રક્રિયા કરવી વગેરે, કોર્ટ રૂમ/સુનાવણીના સમયપત્રક અને સંબંધિત ગોઠવણો, લોક અધિનિયમ નું પ્રતિનિધિત્વ ના નિર્ણય અને અનુપાલન, નવીનીકરણ સ્ત્રોતો-ટેરીફ નક્કી કરવું અને અન્ય મુદ્દાઓ બિડ દસ્તાવેજ ની મંજૂરી/બિડ પ્રક્રિયા, પાવર ખરીદી કરાર ને લગતા વિવાદો, ઉચ્ચ અદાલત/એપેલ/સર્વોચ્ચ અદાલત ને લગતી બાબતો, આ સિવાય આયોગ, સચિવ અને ઉચ્ચ અધિકારી દ્વારા સોંપવામાં આવે તે બીજી કોઇપણ ફરજો.

(૪) ટેકનિકલ શાખા-૧ : સંયુક્ત નિયામક, નાયબ નિયામક, મદદનીશ નિયામક, એકઝીક્યુટીવ

ગ્રિડ સંહિતા, વિતરણ કોડ, અર્થ ટર્મિનલ અને વિજ સુરક્ષા, ખુલ્લા પ્રવેશ ના અધિનિયમો, અધિક કર નો નિર્ણય પ્રાખ્યાતા આધારિત પ્રશુલ્ક/વિચલન સમાધાન ના અધિનિયમો, માંગ તરફનું વ્યવસ્થાપન/સ્માર્ટ ગ્રિડના અધિનિયમો, રાજ્ય સંકલન ફોરમ, આ સિવાય આયોગ, સચિવ અને ઉચ્ચ અધિકારી દ્વારા સોંપવામાં આવે તે બીજી કોઇપણ ફરજો.

(૫) ટેકનિકલ શાખા-૨ : સંયુક્ત નિયામક, નાયબ નિયામક, મદદનીશ નિયામક, એકઝીક્યુટીવ

પરવાના અધિનિયમો, વાર્ષિક પરવાના ફી, કેપ્ટીવ વીજ પ્લાન્ટ/જૂથ કેપ્ટીવ દેખરેખ, સમાંતર કાર્યદર નો નિર્ણય, સ્પલાય કોડ, ખર્ચ ની વસુલાત, સુરક્ષા થાપણ, વગેરે, ગ્રાહક ફરિયાદ, CGRF/ઓમ્બ્ડ્સમેન- અધિનિયમો, દેખરેખ પદ્ધતિ, પ્રમાણભૂત કામગીરી પ્રક્રિયા ના અધિનિયમો/પાલન, જનરેશન સંબંધિત પીટીશન અને ટેકનિકલ બાબતો, આ સિવાય આયોગ, સચિવ અને ઉચ્ચ અધિકારી દ્વારા સોંપવામાં આવે તે બીજી કોઇપણ ફરજો.

(૬) આઇટી મેનેજર : (માહિતી ટેકનોલોજી/આઇ.ટી) :

કચેરી કમ્પ્યુટર સિસ્ટમ વિકાસ અને જાળવણી(કમ્પ્યુટરો, પ્રિન્ટરો અને સર્વરો), ઓફીસ નેટવર્ક જાળવણી (LAN, ઇન્ટરનેટ અને કાર્યજૂથ), મેઇલ સર્વર કામ હાથ ધરવું (ગ્રાહક/સર્વર અધિકૃતિ), ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની વેબસાઇટ પર કામ હાથ ધરવું (વેબસાઇટ પર અનલોડ/ અપલોડ અને દરરોજ અદ્યતન માહિતી રાખવી), ફાઇલ, રજીસ્ટર ફાઇલ ગતિવિધિ રજીસ્ટર, કાર્યપત્રક વગેરેની જાળવણી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ સિસ્ટમ- ફરિયાદ લોગબુક, સિસ્ટમ વિકાસ પહેલા પગલાં અને નવી યોજનાઓ તૈયાર કરવી, AMC કરાર- (AMC માંથી નવીકરણ, સર્વિસ અહેવાલ અને સિસ્ટમ લોગબુક) કોપીયર/પ્રોજેક્ટર/માઇક્રોફોન સિસ્ટમ-જેવાં વીજળી સાધનો-જેવી કચેરી સાધન સામગ્રી પર દેખરેખ વીજળી ક્ષેત્રે સમાચાર એકત્રિકરણ/ આ સિવાય આયોગ, સચિવ અને ઉચ્ચ અધિકારી દ્વારા સોંપવામાં આવે તે બીજી કોઇપણ ફરજો.

(૭) ગ્રંથપાલ :

દસ્તાવેજોનું વર્ગીકરણ અને સૂચિકરણ, વર્ણનાત્મક સૂચિપત્ર તૈયાર કરવું, પ્રોજેક્ટોનું નવેસર વર્ગીકરણ અને નવેસર સૂચિકરણ, સંદર્ભ ગ્રંથો, અભ્યાસ માર્ગદર્શિકાઓ અને સંબંધિત સામગ્રીનું સંકલન, પુસ્તકો, સામયિકો, પત્રિકાઓ વગેરેની પસંદગીમાં મદદ કરવી અને ભલામણ કરવી, સંદર્ભ અને સંશોધન એસાઇનમેન્ટ હાથ ધરવા, ગ્રંથાલયનાં પુસ્તકો, સામગ્રી, માહિતી વગેરે શોધવામાં વપરાશકર્તાઓને મદદ કરવી, ટેકનિકલ/ વહીવટી કામમાં સહાય કરવી, આંતર-ગ્રંથાલય લોન પ્રવૃત્તિઓ જેવી અન્ય વપરાશકર્તા સેવાઓ પૂરી પાડવી, સોંપવામાં આવે તે મુજબ અન્ય, સંબંધિત ફરજો બજાવવી, ગ્રંથાલય સોફ્ટવેર અને તેની રોજ-બ-રોજની નોંધ હાથ ધરવી/ આ સિવાય આયોગ, સચિવ અને ઉચ્ચ અધિકારી દ્વારા સોંપવામાં આવે તે બીજી કોઇપણ ફરજો.

નિયમ સંગ્રહ-૩

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ :

જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે વીજળી અધિનિયમ-૨૦૦૩ની કલમ-૧૮૧ અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનઃગઠન અને વિનિયમ) ૨૦૦૩ ની કલમ ૧૨ અન્વયે મળેલી સત્તા અને તેના દ્વારા તેને શક્તિમાન બનાવતી તમામ સત્તાની રૂએ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે કારોબારીનું સંચાલન વિનિયમો ઘડ્યા છે. આ વિનિયમોને આધારે અને નિયત કરેલી કાર્યપદ્ધતિ હેઠળ કેસોના નિકાલ માટે સુપ્રત કરવામાં આવેલ સત્તા અનુસાર નિર્ણય કરવામાં આવે છે.

આયોગ સમક્ષ કેસની સુનાવણી પુરી થતા, આયોગ તે ચુકાદો જાહેર કરશે/આયોગે કાઢેલ તમામ આદેશો અને નિર્ણયો સચિવ અથવા અધ્યક્ષે તેમના વતી સત્તા આપેલ કોઈ અધિકારીની સહીથી પ્રમાણિત કરવામાં આવશે અને તેના પર આયોગનો સત્તાવાર સિક્કો લગાવવામાં આવશે.

અધિનિયમો અને આ વિનિયમોની જોગવાઈને આધીન રહીને, વિનિયમોના અમલ પાલન કરવાની કાર્યરીતી અને જુદી જુદી બાબતો કે જેનો નિર્દેશ કે ફરમાન કરવા આ નિયમનો દ્વારા આયોગને અધિકૃત કરવામાં આવ્યું છે. તેના સંદર્ભમાં આયોગ વખતો-વખત હુકમો અને સુચનાઓ બહાર પાડી શકે છે.

અપીલ માટેની જોગવાઈ :

વિજ અધિનિયમ (૨૦૦૩)ની કલમ-૧૧૧ની જોગવાઈ અનુસાર ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના હુકમથી અરજદારને અસંતોષ હોય તો તે માટે અરજદાર એપેલેટ ટ્રીબ્યુનલને અપીલ કરી શકશે.

નિયમ સંગ્રહ-૪

કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો :

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ અધ્યક્ષ અને બે સભ્યોનું બનેલું વૈદ્યાનિક મંડળ છે. આયોગ કાર્યોના ધોરણો અધિનિયમોને આધીન અને તેના હેઠળ પ્રસિધ્ધ થયેલ નેશનલ ઇલેક્ટ્રીસીટી નીતિ, નેશનલ ઇલેક્ટ્રીસીટી આયોજન અને ટેરીફ નીતિ દ્વારા માર્ગદર્શન મેળવશે. આયોગ પોતાના નીતિ-વિષયક જાહેરનામા બહાર પાડી અધિનિયમ હેઠળ વિનિયમો દ્વારા રાજ્યમાં વિદ્યુત ઉદ્યોગ માટે ધોરણો સ્થાપવા અને અમલમાં લાવવા સહીત સેવામાં સલામતી, ગુણવત્તા, સાતત્ય અને વિશ્વસનીયતાને લગતા ધોરણો ધડશે.

હાલ અમલમાં નીચે મુજબનું ધોરણ છે.

કાર્ય	ધોરણ
પરવાનેદારના વાર્ષિક આવક જરૂરિયાતોની દાદ અરજી માટે પ્રશુલ્કનો આદેશ.	આયોગે ૧૨૦ દિવસમાં આદેશ આપવો.

નિયમ સંગ્રહ-૫

કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ નિયમ સંગ્રહ અને દફતરો : જાહેરનામાનું લીસ્ટ:
(તા.૩૧-૦૫-૨૦૨૫ સુધીના)

હુકમોનું સંગ્રહ (તા.૩૧-૦૫-૨૦૨૫ સુધી)

અનુ નં	હુકમ નં	હુકમોનું સંગ્રહની વિગત	વર્ષ
૧	વોલ્યુમ-૧	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે વર્ષ ૧૯૯૯-૨૦૦૦ તથા ૨૦૦૦-૨૦૦૧ માં બહાર પાડેલ હુકમોનો સંગ્રહ-જુલાઈ-૨૦૦૧	૧૯૯૯-૨૦૦૦
૨	વોલ્યુમ-૨	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં બહાર પાડેલ હુકમોનો સંગ્રહ-જુલાઈ-૨૦૦૧	૨૦૦૦-૨૦૦૧
૩	વોલ્યુમ-૩	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં બહાર પાડેલ હુકમોનો સંગ્રહ-ઓગષ્ટ-૨૦૦૧	૨૦૦૧-૨૦૦૨
૪	વોલ્યુમ-૪	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે વર્ષ ૨૦૦૨-૦૩-૦૪ માં બહાર પાડેલ હુકમોનો સંગ્રહ-માર્ચ-૨૦૦૪	૨૦૦૨-૨૦૦૩ તથા ૨૦૦૪
૫	વોલ્યુમ-૫	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે વર્ષ ૨૦૦૪ માં બહાર પાડેલ હુકમોનો સંગ્રહ- ટેરીફ ઓર્ડર-૨૫ જૂન-૨૦૦૪ કેસ ૨૯૨/૦૩ (જીઈબી)	૨૦૦૪
૬	વોલ્યુમ-૬	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે વર્ષ ૨૦૦૪માં બહાર પાડેલ હુકમોનો સંગ્રહ-બળતણ, ખર્ચ અને વીજ ખરીદી અંગેના સરભર સંબંધી હુકમ-૨૫ જૂન-૨૦૦૪ કેસ ૨૫૨/૦૩(જીઈબી)	૨૦૦૪
૭	વોલ્યુમ-૭	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે વર્ષ ૨૦૦૪ માં બહાર પાડેલ હુકમોનો સંગ્રહ જીઈબી ગ્રિડની સમાંતર ચાલતા કેપ્ટીવ પાવર પ્લાન્ટ માટે લાદવાના થતા સમાંતર કાર્યવાહક દરને લગતી અપીલ અરજી અંગેનો હુકમ-૨૫ જૂન-૨૦૦૪	૨૦૦૪

તા:૦૧-૦૧-૨૦૦૫ પછી ઇસ્યુ કરવામાં આવેલા હુકમો/જજમેન્ટ:

અનુ નં	પીટીશન નં.	હુકમો અને જજમેન્ટની તારીખ
૧	૩૮/૨૦૦૧	૨૯/૦૩/૨૦૦૫
૨	૪૨/૨૦૦૧	૨૯/૦૩/૨૦૦૫
૩	૫૪/૨૦૦૧	૧૯/૦૪/૨૦૦૫
૪	૬૫/૨૦૦૨	૦૮/૦૮/૨૦૦૭
૫	૬૬/૨૦૦૨	૨૩/૦૫/૨૦૦૮
૬	૬૭/૨૦૦૨	૦૮/૦૮/૨૦૦૭
૭	૬૮/૨૦૦૨	૧૨/૧૦/૨૦૦૬
૮	૭૭/૨૦૦૨	૨૨/૧૨/૨૦૦૫
૯	૮૦/૨૦૦૨	૨૨/૧૨/૨૦૦૬
૧૦	૮૨/૨૦૦૨	૦૭/૦૩/૨૦૦૬
૧૧ થી ૧૪	૮૪/૨૦૦૨ થી ૮૭/૨૦૦૨	૧૯/૦૪/૨૦૦૫
૧૫	૮૮/૨૦૦૨	૦૬/૧૦/૨૦૦૫
૧૬	૯૦/૨૦૦૨	૨૨/૧૨/૨૦૦૬
૧૭	૯૩/૨૦૦૨	૦૬/૧૦/૨૦૦૫
૧૮	૯૪/૨૦૦૨	૧૯/૦૪/૨૦૦૫
૧૯	૯૮/૨૦૦૩	૧૫/૦૪/૨૦૦૫
૨૦	૯૯/૨૦૦૩	૧૫/૦૭/૨૦૦૫
૨૧	૧૦૯/૨૦૦૩	૨૨/૧૨/૨૦૦૬
૨૨	૧૧૦/૨૦૦૩	૨૨/૧૨/૨૦૦૬
૨૩	૧૨૦/૨૦૦૩	૧૯/૦૪/૨૦૦૫
૨૪	૧૨૫/૨૦૦૩	૨૧/૦૪/૨૦૦૬
૨૫	૧૨૭/૨૦૦૩	૦૯/૧૦/૨૦૦૬
૨૬	૧૨૮/૨૦૦૩	૨૨/૧૨/૨૦૦૬
૨૭	૧૨૯/૨૦૦૩	૦૮/૧૨/૨૦૦૫
૨૮	૧૩૨/૨૦૦૩	૧૪/૧૧/૨૦૦૫
૨૯	૧૩૩/૨૦૦૩	૨૨/૧૨/૨૦૦૫

30	135/2004	23/12/2004
31	136/2003	03/05/2004
32	193/2003	29/09/2009
33	198/2003	22/12/2004
34	241/2003	22/12/2005
35	249/2003	16/06/2004
36	246/2003	18/09/2004
37	246/2003	29/09/2009
38	494/2003	06/12/2004
39	966/2008	05/05/2005
40	966/2008	29/04/2004
41	600/2008	03/10/2005
42	603/2008	12/06/2004
43	608/2008	16/10/2005
44	604/2008	16/10/2005
45	605/2008	09/10/2005
46	609/2008	09/10/2005
47	606/2008	06/01/2006
48	610/2008	24/11/2004
49	611/2008	03/04/2005
50	612/2008	10/10/2005
51	613/2008	23/12/2004
52	618/2008	23/12/2004
53	615/2008	09/10/2005
54	620/2008	10/01/2004
55	621/2008	23/02/2005
56	622/2008	05/05/2005
57	623/2008	26/03/2004
58	628/2008	26/10/2004

46	626/2008	29/09/2004
50	630/2008	04/08/2004
51	633/2008	08/10/2005
52	638/2008	26/03/2004
53	634/2008	26/03/2004
58	635/2008	29/11/2004
54	639/2008	28/03/2004
55	636/2008	06/06/2005
59	636/2008	04/04/2005
56	680/2008	06/12/2004
56	681/2004	09/02/2009
90	682/2004	09/08/2004
91	683/2004	13/06/2004
92	688/2004	11/03/2004
93	684/2004	30/11/2009
98	685/2004	09/06/2005
94	689/2004	05/01/2005
95	686/2004	25/04/2005
99	686/2004	09/02/2009
96	640/2004	16/11/2005
96	641/2004	18/06/2009
60	642/2004	18/06/2004
61	643/2004	18/05/2009
62	648/2004	30/05/2009
63	644/2004	16/11/2005
68	645/2004	09/06/2004
64	649/2004	29/09/2009
65	646/2004	29/09/2009
69	646/2005	23/03/2005

୮୮	୮୨୦/୨୦୦୨	୨୨/୧୦/୨୦୦୭
୮୯	୮୨୧/୨୦୦୨	୦୨/୦୪/୨୦୦୨
୯୦	୮୨୨/୨୦୦୨	୦୨/୦୪/୨୦୦୨
୯୧	୮୨୩/୨୦୦୨	୦୨/୦୪/୨୦୦୨
୯୨	୮୨୪/୨୦୦୨	୦୨/୦୪/୨୦୦୨
୯୩	୮୨୫/୨୦୦୨	୦୨/୦୪/୨୦୦୨
୯୪	୮୨୬/୨୦୦୨	୦୨/୦୪/୨୦୦୨
୯୫	୮୨୭/୨୦୦୨	୨୪/୦୨/୨୦୦୨
୯୬	୮୨୮/୨୦୦୨	୨୪/୦୨/୨୦୦୨
୯୭	୮୨୯/୨୦୦୨	୨୪/୦୨/୨୦୦୨
୯୮	୮୩୦/୨୦୦୨	୨୪/୦୨/୨୦୦୨
୯୯	୮୩୧/୨୦୦୨	୧୮/୦୨/୨୦୦୮
୧୦୦	୮୩୨/୨୦୦୨	୧୮/୦୨/୨୦୦୮
୧୦୧	୮୩୩/୨୦୦୨	୧୮/୦୨/୨୦୦୮
୧୦୨	୮୩୪/୨୦୦୨	୧୨/୦୭/୨୦୦୭
୧୦୩	୮୩୫/୨୦୦୨	୧୮/୧୦/୨୦୦୨
୧୦୪	୮୩୬/୨୦୦୨	୧୭/୦୪/୨୦୦୨
୧୦୫	୮୩୭/୨୦୦୨	୨୮/୦୩/୨୦୦୮
୧୦୬	୮୩୮/୨୦୦୨	୧୮/୧୦/୨୦୦୨
୧୦୭	୮୩୯/୨୦୦୨	୨୨/୧୨/୨୦୦୨
୧୦୮	୮୪୦/୨୦୦୨	୦୨/୦୭/୨୦୦୨
୧୦୯	୮୪୧/୨୦୦୨	୨୨/୦୪/୨୦୦୨
୧୧୦	୮୪୨/୨୦୦୨	୨୨/୦୪/୨୦୦୨
୧୧୧	୮୪୩/୨୦୦୨	୧୮/୧୦/୨୦୦୨
୧୧୨	୮୪୪/୨୦୦୨	୦୩/୧୧/୨୦୦୨
୧୧୩	୮୪୫/୨୦୦୨	୨୨/୧୨/୨୦୦୨
୧୧୪	୮୪୬/୨୦୦୨	୨୮/୦୨/୨୦୦୭
୧୧୫	୮୪୭/୨୦୦୨	୨୩/୦୩/୨୦୦୭
୧୧୬	୮୪୮/୨୦୦୨	୦୭/୦୧/୨୦୦୮

၁၁၅	၂၆၀/၂၀၀၅	၀၅/၀၁/၂၀၀၆
၁၁၆	၂၆၁/၂၀၀၅	၀၅/၀၂/၂၀၀၅
၁၁၆	၂၆၂/၂၀၀၅	၂၈/၁၁/၂၀၀၅
၁၂၀	၂၆၃/၂၀၀၅	၂၀/၁၂/၂၀၀၅
၁၂၁	၂၆၄/၂၀၀၅	၀၅/၀၁/၂၀၀၆
၁၂၂	၂၆၅/၂၀၀၅	၂၂/၁၂/၂၀၀၅
၁၂၃	၂၆၆/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၂၄	၂၆၇/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၂၅	၂၆၈/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၂၅	၂၆၉/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၂၅	၂၇၀/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၂၆	၂၇၁/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၂၆	၂၇၂/၂၀၀၅	၂၅/၀၃/၂၀၀၆
၁၃၀	၂၇၃/၂၀၀၅	၁၂/၀၆/၂၀၀၅
၁၃၁	၂၇၄/၂၀၀၅	၂၀/၀၅/၂၀၀၅
၁၃၂	၂၇၅/၂၀၀၅	၀၁/၀၆/၂၀၀၅
၁၃၃	၂၇၆/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၃၄	၂၇၇/၂၀၀၅	၃၁/၀၃/၂၀၀၅
၁၃၅	၂၇၈/၂၀၀၅	၂၀/၀၈/၂၀၀၆
၁၃၅	၂၇၉/၂၀၀၅	၂၂/၀၁/၂၀၀၆
၁၃၆	၂၈၀/၂၀၀၅	၁၈/၀၂/၂၀၀၆
၁၃၆	၂၈၁/၂၀၀၅	၁၈/၀၃/၂၀၀၆
၁၄၀	၂၈၂/၂၀၀၅	withdrawn
၁၄၁	၂၈၃/၂၀၀၅	၃၁/၀၅/၂၀၀၅
၁၄၂	၂၈၄/၂၀၀၅	၃၁/၀၅/၂၀၀၅
၁၄၃	၂၈၅/၂၀၀၅	၂၆/၀၆/၂၀၀၅
၁၄၄	၂၈၆/၂၀၀၅	၂၅/၀၃/၂၀၀၆
၁၄၅	၂၈၇/၂၀၀၅	၂၆/၀၁/၂၀၀၆

၁၃၄	၆၃၀/၃၀၀၅	၃၆/၀၁/၃၀၀၆
၁၃၅	၆၃၁/၃၀၀၅	၁၆/၀၃/၃၀၀၆
၁၃၆	၆၃၂/၃၀၀၅	၁၈/၀၃/၃၀၀၆
၁၃၇	၆၃၃/၃၀၀၅	၃၆/၀၃/၃၀၀၆
၁၃၈	၆၃၄/၃၀၀၅	၃၆/၀၃/၃၀၀၆
၁၃၉	၆၃၅/၃၀၀၅	၀၅/၁၃/၃၀၀၅
၁၄၀	၆၃၆/၃၀၀၅	၀၅/၁၃/၃၀၀၅
၁၄၁	၆၃၇/၃၀၀၅	၁၅/၀၁/၃၀၀၆
၁၄၂	၆၃၈/၃၀၀၅	၁၈/၀၃/၃၀၀၆
၁၄၃	၆၃၉/၃၀၀၅	၃၆/၀၃/၃၀၀၆
၁၄၄	၆၄၀/၃၀၀၅	၀၆/၀၄/၃၀၀၆
၁၄၅	၆၄၁/၃၀၀၆	၃၃/၀၄/၃၀၀၆
၁၄၆	၆၄၂/၃၀၀၆	၀၆/၀၄/၃၀၀၆
၁၄၇	၆၄၃/၃၀၀၆	၃၅/၁၃/၃၀၀၆
၁၄၈	၆၄၄/၃၀၀၆	၀၁/၀၅/၃၀၀၆
၁၄၉	၆၄၅/၃၀၀၆	၁၅/၁၁/၃၀၀၆
၁၅၀	၆၄၆/၃၀၀၆	၀၈/၁၃/၃၀၀၆
၁၅၁	၆၄၇/၃၀၀၆	၁၄/၁၃/၃၀၀၆
၁၅၂	၆၄၈/၃၀၀၆	၁၅/၀၁/၃၀၀၆
၁၅၃	၆၄၉/၃၀၀၆	၁၅/၀၁/၃၀၀၆
၁၅၄	၆၅၀/၃၀၀၆	၁၅/၀၁/၃၀၀၆
၁၅၅	၆၅၁/၃၀၀၆	၁၅/၀၁/၃၀၀၆
၁၅၆	၆၅၂/၃၀၀၆	၁၅/၀၁/၃၀၀၆
၁၅၇	၆၅၃/၃၀၀၆	၁၅/၀၁/၃၀၀၆
၁၅၈	၆၅၄/၃၀၀၆	၁၅/၀၁/၃၀၀၆
၁၅၉	၆၅၅/၃၀၀၆	၀၆/၀၄/၃၀၀၆
၁၆၀	၆၅၆/၃၀၀၆	၃၅/၀၃/၃၀၀၆

၁၅၄	၆၄၁/၂၀၀၆	၀၆/၁၀/၂၀၀၆
၁၅၅	၆၄၂/၂၀၀၆	၀၆/၀၄/၂၀၀၆
၁၅၅	၆၄၃/၂၀၀၆	၂၀/၁၀/၂၀၀၆
၁၅၆	၆၄၄/၂၀၀၆	၀၅/၀၄/၂၀၀၆
၁၅၆	၆၄၄/၂၀၀၆	၁၄/၁၂/၂၀၀၆
၁၆၀	၆၄၅/၂၀၀၆	၁၅/၀၈/၂၀၀၆
၁၆၁	၆၄၅/၂၀၀၆	၁၅/၁၂/၂၀၀၆
၁၆၂	၆၄၆/၂၀၀၆	၁၅/၁၂/၂၀၀၆
၁၆၃	၆၄၆/၂၀၀၆	၂၂/၀၈/၂၀၀၆
၁၆၄	၆၅၀/၂၀၀၆	၁၃/၀၂/၂၀၀၆
၁၆၄	၆၅၁/၂၀၀၆	၂၁/၀၁/၂၀၁၀
၁၆၅	၆၅၂/၂၀၀၆	၁၅/၁၁/၂၀၀၆
၁၆၅	၆၅၃/၂၀၀၆	၂၃/၀၃/၂၀၀၆
၁၆၆	၆၅၄/၂၀၀၆	၀၆/၀၄/၂၀၀၆
၁၆၆	၆၅၄/၂၀၀၆	၂၃/၀၆/၂၀၀၆
၁၆၇	၆၅၅/၂၀၀၆	၀၆/၁၂/၂၀၀၆
၁၆၈	၆၅၅/၂၀၀၆	၁၀/၀၄/၂၀၀၆
၁၆၉	၆၅၆/၂၀၀၆	၁၀/၀၄/၂၀၀၆
၁၆၉	၆၅၆/၂၀၀၆	၀၈/၀၂/၂၀၁၀
၁၇၀	၆၅၇/၂၀၀၆	၂၆/၁၀/၂၀၁၀
၁၇၁	၆၅၈/၂၀၀၆	၂၃/၀၆/၂၀၀၆
၁၇၂	၆၅၉/၂၀၀၆	၀၆/၀၆/၂၀၀၆
၁၇၃	၆၅၉/၂၀၀၆	၁၈/၁၂/၂၀၀၆
၁၇၄	၆၆၀/၂၀၀၆	၁၈/၁၂/၂၀၀၆
၁၇၄	၆၆၀/၂၀၀၆	၁၈/၁၂/၂၀၀၆
၂၀၀	၆၆၁/၂၀၀၆	၁၈/၁၂/၂၀၀၆
၂၀၁	၆၆၂/၂၀၀၆	၁၈/၁၂/၂၀၀၆
၂၀၂	၆၆၃/၂၀၀၆	၁၈/၁၂/၂၀၀၆
၂၀၃	၆၆၄/၂၀၁၀	၁၈/၁၂/၂၀၀၆

208	669/2006	13/11/2006
204	662/2006	30/08/2010
205	663/2006	03/04/2010
209	668/2006	03/04/2010
206	664/2006	09/02/2011
206	665/2006	16/10/2010
210	669/2010	19/08/2010
211	666/2010	31/03/2010
212	666/2010	31/03/2010
213	660/2010	31/03/2010
218	669/2010	31/03/2010
214	662/2010	31/03/2010
215	668/2010	31/03/2010
219	664/2010	31/03/2010
216	665/2010	16/10/2010
216	669/2010	06/10/2010
220	666/2010	26/08/2010
221	666/2010	30/03/2010
222	1000/2010	31/06/2010
223	1001/2010	31/03/2010
228	1003/2010	31/03/2010
224	1008/2010	13/04/2010
225	1004/2010	16/05/2010
229	1005/2010	19/04/2010
226	1009/2010	22/06/2010
226	1006/2010	16/05/2010
230	1010/2010	08/10/2010
231	1011/2010	08/10/2010
232	1012/2010	08/10/2010

૨૩૩	૧૦૧૩/૨૦૧૦	૦૪/૧૦/૨૦૧૦
૨૩૪	૧૦૧૪/૨૦૧૦	૦૪/૧૦/૨૦૧૦
૨૩૫	૧૦૧૫/૨૦૧૦	૨૨/૧૧/૨૦૧૦
૨૩૬	૧૦૧૬/૨૦૧૦	૦૬/૦૮/૨૦૧૦
૨૩૭	૧૦૧૭/૨૦૧૦	૦૬/૦૮/૨૦૧૦
૨૩૮	૧૦૧૮/૨૦૧૦	૦૬/૦૮/૨૦૧૦
૨૩૯	૧૦૧૯/૨૦૧૦	૦૬/૦૮/૨૦૧૦
૨૪૦	૧૦૨૦/૨૦૧૦, ૧૦૨૩/૨૦૧૦	૨૩/૦૮/૨૦૧૦
૨૪૧	૧૦૨૪/૨૦૧૦	૦૩/૦૯/૨૦૧૦
૨૪૨	૧૦૨૫/૨૦૧૦	૦૭/૦૯/૨૦૧૦
૨૪૩	૧૦૨૬/૨૦૧૦	૦૭/૧૦/૨૦૧૦
૨૪૪	૧૦૨૭/૨૦૧૦	૦૧/૦૯/૨૦૧૦
૨૪૫	૧૦૨૮/૨૦૧૦	૧૦/૦૮/૨૦૧૦
૨૪૬	૧૦૩૦/૨૦૧૦	૦૮/૧૧/૨૦૧૦
૨૪૭	૧૦૩૧/૨૦૧૦, ૧૦૩૨/૨૦૧૦	૦૭/૦૮/૨૦૧૦ ૦૩/૦૨/૨૦૧૧
૨૪૮	૧૦૩૩/૨૦૧૦ ૧૦૩૪/૨૦૧૦	૨૨/૦૯/૨૦૧૧ ૨૨/૦૯/૨૦૧૧
૨૪૯	૧૦૩૫/૨૦૧૦	૧૦/૦૧/૨૦૧૧
૨૫૦	૧૦૩૬/૨૦૧૦	૦૧/૦૯/૨૦૧૧
૨૫૧	૧૦૩૭/૨૦૧૦	૦૫/૧૦/૨૦૧૦
૨૫૨	૧૦૩૮/૨૦૧૦	૨૩/૧૧/૨૦૧૦
૨૫૩	૧૦૩૯/૨૦૧૦	૦૧/૦૯/૨૦૧૧
૨૫૪	૧૦૪૦/૨૦૧૦	૦૧/૦૯/૨૦૧૧
૨૫૫	૧૦૪૧/૨૦૧૦	૩૦/૧૦/૨૦૧૦
૨૫૬	૧૦૪૨/૨૦૧૦	૧૬/૧૧/૨૦૧૦
૨૫૭	૧૦૪૪/૨૦૧૦	૧૬/૧૧/૨૦૧૦
૨૫૮	૧૦૪૫/૨૦૧૧	૨૯/૧૦/૨૦૧૦
૨૫૯	૧૦૪૬/૨૦૧૦	૨૯/૧૦/૨૦૧૦

250	1086/2010	16/12/2010
251	1040/2010	26/12/2010
252	1041/2010	26/12/2010
253	1048/2010	26/12/2010
254	1044/2010	16/01/2011
255	1049/2010	31/01/2011
256	1046/2010	10/02/2011
257	1055/2011	21/02/2011
258	1059/2011	09/02/2011
259	1053/2011	31/03/2011
260	1051/2011	11/04/2011
261	1090/2011	16/06/2011
262	1050/2011	16/06/2011
263	1062/2011	05/06/2011
264	1102/2011	05/06/2011
265	1066/2011	05/06/2011
266	1100/2011	05/06/2011
267	1101/2011	05/06/2011
268	1119/2011	12/12/2011
269	1052/2011	31/03/2011
270	1142/2011	09/04/2012
271	1141/2011	09/04/2012
272	1026/2010	03/03/2011
273	1093/2010	26/03/2011
274	1046/2010	13/04/2011
275	1056/2011	14/04/2011
276	1006/2011	14/04/2011
277	1089/2011	16/04/2011
278	1065/2011	20/04/2011

266	1091/2011	09/04/2011
260	1056/2011	19/04/2011
261	10922011	21/04/2011
262	1064/2011	25/04/2011
263	1069/2011	30/04/2011
268	245/2003, 269/2005, 681/2006	01/05/2011
264	1068/2011	29/05/2011
265	1098/2011	29/05/2011
269	1064/2011	29/05/2011
266	1068/2011	29/05/2011
266	10632011	29/05/2011
300	1061/2011	29/05/2011
301	1062/2011	29/05/2011
302	1108/2011	29/05/2011
303	1104/2011	30/05/2011
308	1103/2011	20/09/2011
304	1045/2010	20/09/2011
305	1060/2011	22/09/2011
309	1021/2010	29/09/2011
306	1083/2010	26/09/2011
306	1042/2011	30/09/2011
310	1058/2011	01/06/2011
311	1056/2011	02/06/2011
312	1096/2011	02/06/2011
313	1106/2011	02/06/2011
318	1099/2011, 1066/2011	06/06/2011
314	1111/2011	11/06/2011
315	1094/2011	11/06/2011
319	1086/2010	23/06/2011

316	1110/2011	30/06/2011
316	1022/2010	04/06/2011
320	665/2006	04/06/2011
321	629/2009	26/06/2011
322	1063/2011	21/10/2011
323	1060/2011	21/10/2011
324	1054/2011	21/10/2011
324	1115/2011	21/10/2011
325	1105/2011	21/10/2011
329	1106/2011	21/10/2011
326	615/2009	21/11/2011
326	1065/2011	21/11/2011
330	1116/2011	26/11/2011
331	1069/2011	06/12/2011
332	1112/2011	16/12/2011
333	1136/2011	06/01/2012
334	1146/2011	15/01/2012
334	1142/2011	16/01/2012
335	1140/2012	16/01/2011
339	1168/2012	23/01/2012
336	1164/2012	23/01/2012
336	1125/2011, 1169/2012	29/01/2012
340	1114/2012	30/01/2012
341	1166/2012	22/02/2012
342	1166/2012, 1161/2012	22/02/2012
343	1160/2012	22/02/2012
344	1128/2011	23/02/2012
344	1139/2011	18/03/2012
345	1155/2011	03/08/2012

૩૪૭	૧૧૪૧/૨૦૧૧	૦૩/૦૪/૨૦૧૨
૩૪૮	૧૧૭૩/૨૦૧૧	૦૩/૦૪/૨૦૧૨
૩૪૯	૧૧૬૧/૨૦૧૧	૦૭/૦૪/૨૦૧૨
૩૫૦	૧૧૨૫/૨૦૧૧	૦૭/૦૪/૨૦૧૨
૩૫૧	૧૧૨૧/૨૦૧૧	૧૬/૦૪/૨૦૧૨
૩૫૨	૧૧૩૧/૨૦૧૧	૦૨/૦૫/૨૦૧૨
૩૫૩	૧૧૨૩/૨૦૧૧	૦૪/૦૫/૨૦૧૨
૩૫૪	૧૧૧૩/૨૦૧૧, ૧૧૧૪/૨૦૧૧	૧૦/૦૫/૨૦૧૨
૩૫૫	૧૧૬૭/૨૦૧૧	૧૫/૦૫/૨૦૧૨
૩૫૬	૧૧૯૯/૨૦૧૨	૨૨/૦૫/૨૦૧૨
૩૫૭	૧૧૩૦/૨૦૧૧	૨૫/૦૫/૨૦૧૨
૩૫૮	૧૧૨૨/૨૦૧૧	૨૫/૦૫/૨૦૧૨
૩૫૯	૧૧૮૧/૨૦૧૧	૩૦/૦૫/૨૦૧૨
૩૬૦	૧૧૭૫/૨૦૧૧	૦૨/૦૬/૨૦૧૨
૩૬૧	૧૧૭૬/૨૦૧૧	૦૨/૦૬/૨૦૧૨
૩૬૨	૧૧૭૭/૨૦૧૧	૦૨/૦૬/૨૦૧૨
૩૬૩	૧૧૮૦/૨૦૧૧	૦૮/૧૦/૨૦૧૩
૩૬૪	૧૧૮૮/૨૦૧૨	૦૫/૦૪/૨૦૧૪
૩૬૫	૧૧૯૨/૨૦૧૨	૧૦/૧૨/૨૦૧૨
૩૬૬	૧૧૯૩/૨૦૧૨	૨૧/૦૮/૨૦૧૨
૩૬૭	સુઓ/મોટો પીટીશન ૧૧૯૪/૨૦૧૨	૦૨/૦૬/૨૦૧૨
૩૬૮	સુઓ/મોટો પીટીશન ૧૧૯૫/૨૦૧૨	૦૨/૦૬/૨૦૧૨
૩૬૯	સુઓ/મોટો પીટીશન ૧૧૯૬/૨૦૧૨	૦૨/૦૬/૨૦૧૨
૩૭૦	સુઓ/મોટો પીટીશન ૧૧૯૭/૨૦૧૨	૦૨/૦૬/૨૦૧૨
૩૭૧	૧૧૯૯/૨૦૧૨	૨૨/૦૪/૨૦૧૨
૩૭૨	૧૨૦૦/૨૦૧૨	૧૮/૦૧/૨૦૧૩
૩૭૩	૧૨૦૧/૨૦૧૨	૦૪/૦૬/૨૦૧૨
૩૭૪	૧૨૦૨/૨૦૧૨	૦૬/૧૧/૨૦૧૨
૩૭૫	૧૨૦૩/૨૦૧૨	૨૧/૦૮/૨૦૧૨

૩૭૬	૧૨૦૫/૨૦૧૨	૨૪/૦૪/૨૦૧૩
૩૭૭	૧૨૦૬/૨૦૧૨	૧૪/૦૬/૨૦૧૨
૩૭૮	૧૨૦૭/૨૦૧૨	૦૪/૦૬/૨૦૧૨
૩૭૯	સુઓ/મોટો પીટીશન ૧૨૦૮/૨૦૧૨	૦૬/૦૮/૨૦૧૨
૩૮૦	૧૨૧૦/૨૦૧૨	૦૭/૦૧/૨૦૧૩
૩૮૧	૧૨૧૧/૨૦૧૨	૦૮/૦૧/૨૦૧૩
૩૮૨	૧૨૧૨/૨૦૧૨	૦૮/૦૮/૨૦૧૩
૩૮૩	૧૨૧૩/૨૦૧૨	૦૫/૦૬/૨૦૧૩
૩૮૪	૧૨૧૪/૨૦૧૨	૧૬/૦૭/૨૦૧૨
૩૮૫	૧૨૧૫/૨૦૧૨	૨૩/૧૦/૨૦૧૩
૩૮૬	૧૨૧૬/૨૦૧૨	૧૬/૦૮/૨૦૧૨
૩૮૭	૧૨૧૭/૨૦૧૨	૧૬/૦૮/૨૦૧૨
૩૮૮	૧૨૧૮/૨૦૧૨	૨૩/૧૦/૨૦૧૩
૩૮૯	સુઓ/મોટો પીટીશન ૧૨૧૯/૨૦૧૨	૧૭/૦૮/૨૦૧૨
૩૯૦	૧૨૨૦/૨૦૧૨	૨૯/૦૮/૨૦૧૨
૩૯૧	૧૨૨૧/૨૦૧૨	૧૯/૦૧/૨૦૧૩
૩૯૨	૧૨૨૩/૨૦૧૩	૦૮/૦૮/૨૦૧૩
૩૯૩	૧૨૨૪/૨૦૧૨	૦૧/૦૫/૨૦૧૩
૩૯૪	૧૧૨૫/૨૦૧૨	૦૫/૧૧/૨૦૧૨
૩૯૫	સુઓ/મોટો પીટીશન ૧૨૨૬/૨૦૧૨	૧૬/૦૬/૨૦૧૩
૩૯૬	૧૨૨૭/૨૦૧૨	૨૬/૦૬/૨૦૧૩
૩૯૭	૧૨૨૮/૨૦૧૨	૦૪/૦૮/૨૦૧૩
૩૯૮	૧૨૨૯/૨૦૧૨	૦૨/૦૩/૨૦૧૩
૩૯૯	૧૨૩૦/૨૦૧૨	૨૦/૦૮/૨૦૧૨
૪૦૦	૧૨૩૧/૨૦૧૨	૨૧/૧૧/૨૦૧૨
૪૦૧	૧૨૩૨/૨૦૧૨	૧૨/૦૨/૨૦૧૩
૪૦૨	૧૨૩૩/૨૦૧૨	૨૭/૦૮/૨૦૧૨
૪૦૩	૧૨૩૪/૨૦૧૨	૨૭/૦૫/૨૦૧૨
૪૦૪	૧૨૩૫/૨૦૧૨	૩૧/૧૨/૨૦૧૨

៨០៤	១២៣៥/២០១២	១៨/១០/២០១២
៨០៥	១២៣៦/២០១២	៣០/១០/២០១២
៨០៦	១២៣៧/២០១២	១១/០៤/២០១២
៨០៧	១២៣៨/២០១២	២០/១០/២០១២
៨០៨	១២៣៩/២០១២	២៤/១២/២០១២
៨១០	១២៤០/២០១២	០១/០១/២០១៣
៨១១	១២៤១/២០១២	០៤/០៤/២០១២
៨១២	១២៤២/២០១២	០៤/០៤/២០១៣
៨១៣	១២៤៣/២០១២	០៤/០៤/២០១៣
៨១៤	១២៤៤/២០១២	០៤/០៤/២០១៣
៨១៥	១២៤៥/២០១២	០១/០១/២០១៣
៨១៦	១២៤៦/២០១២	០១/០២/២០១៣
៨១៧	១២៤៧/២០១២	០៥/១១/២០១២
៨១៨	១២៤៨/២០១២	២៤/០២/២០១៣
៨១៩	១២៤៩/២០១២	១១/០១/២០១៣
៨២០	១២៥០/២០១២	០៥/០៨/២០១៣
៨២១	១២៥១/២០១២	០៥/០៨/២០១៣
៨២២	១២៥២/២០១២	០៤/០៤/២០១៣
៨២៣	១២៥៣/២០១២	០៣/០៨/២០១៣
៨២៤	១២៥៤/២០១២	០៤/០៤/២០១៣
៨២៥	១២៥៥/២០១២	៣១/១២/២០១២
៨២៦	១២៥៦/២០១២	៣០/០៣/២០១២
៨២៧	១២៥៧/២០១២	២៤/០៣/២០១៣
៨២៨	១២៥៨/២០១២	២៤/០៣/២០១៣
៨២៩	១២៥៩/២០១២	២០/០៤/២០១៣
៨៣០	១២៦០/២០១២	២៤/០៥/២០១៣
៨៣១	១២៦១/២០១២	០៣/០៤/២០១៣
៨៣២	១២៦២/២០១២	១៥/០៨/២០១៣
៨៣៣	១២៦៣/២០១២	១៥/០៨/២០១៣

៨៣៨	១២៥៤/២០១២	១៥/០៨/២០១៣
៨៣៤	១២៦០/២០១៣	០៤/០៤/២០១៣
៨៣៥	១២៦១/២០១២	០៤/០៤/២០១៣
៨៣៦	១២៦៨/២០១៣	០៥/០៤/២០១៣
៨៣៧	១២៦៩/២០១៣	១៣/០២/២០១៣
៨៣៨	១២៦៩/២០១៣	១៤/០១/២០១៣
៨៣៩	១២៦៩/២០១៣	១៤/០១/២០១៣
៨៤០	១២៦៩/២០១៣	១៤/០១/២០១៣
៨៤១	១២៦៩/២០១៣	១៤/០១/២០១៣
៨៤២	១២៧០/២០១៣	២១/០៨/២០១៣
៨៤៣	១២៧១/២០១៣	២០/០៨/២០១៣
៨៤៤	១២៧២/២០១៣	១១/០១/២០១៣
៨៤៥	១២៧៣/២០១៣	១៥/០៨/២០១៣
៨៤៦	១២៧៤/២០១៣	១៥/០៨/២០១៣
៨៤៧	១២៧៤/២០១៣	១៥/០៨/២០១៣
៨៤៨	១២៧៥/២០១៣	១៥/០៨/២០១៣
៨៤៩	១២៧៥/២០១៣	៣១/០១/២០១៣
៨៥០	១២៧៧/២០១៣	១៣/០២/២០១៣
៨៥១	១២៧៧/២០១៣	២៣/០៤/២០១៣
៨៥២	១២៧៧/២០១៣	០៤/០៤/២០១៣
៨៥៣	១២៧៧/២០១៣	២៥/០១/២០១៣
៨៥៤	១២៧៧/២០១៣	២២/០៨/២០១៣
៨៥៥	១២៧៧/២០១៣	២៥/០៨/២០១៣
៨៥៦	១២៧៨/២០១៣	១៤/០៨/២០១៣
៨៥៧	១២៧៩/២០១៣	២៣/០៤/២០១៣
៨៥៨	១២៧៩/២០១៣	០២/០៤/២០១៣
៨៥៩	១២៧៩/២០១៣	២៨/០៨/២០១៣
៨៦០	១២៧៩/២០១៣	០៤/០៤/២០១៣
៨៦១	១៣០០/២០១៣	២៤/០៨/២០១៣
៨៦២	១៣០៣/២០១៣	០៤/០៤/២០១៣

៨៥៣	១៣០២/២០១៣	១២/០៣/២០១៤
៨៥៤	១៣០៨/២០១៣	០៤/០៤/២០១៣
៨៥៥	១៣០៤/២០១៣	០៤/០៤/២០១៣
៨៥៦	១៣០៥/២០១៣	០១/១១/២០១៣
៨៥៧	១៣០១/២០១២	០៤/០៤/២០១៣
៨៥៨	១៣០៤/២០១៣	២៤/១០/២០១៣
៨៥៩	១៣១១/២០១៣	០៣/០៤/២០១៣
៨៦០	១៣១៣/២០១៣	២៤/១០/២០១៣
៨៦១	១៣១៤/២០១៣	៣០/១០/២០១៣
៨៦២	១៣១៤/២០១៣	៣០/១០/២០១៣
៨៦៣	១៣១៥/២០១៣	០៤/០៤/២០១៣
៨៦៤	១៣១១/២០១៣	៣០/១០/២០១៣
៨៦៥	១៣១៤/២០១៣	៣០/១០/២០១៣
៨៦៦	១៣១៤/២០១៣	២៥/០៥/២០១៣
៨៦៧	១៣២០/២០១៣	០៤/០៤/២០១៣
៨៦៨	១៣២១/២០១៣	២៤/១០/២០១៣
៨៦៩	១៣២៣/២០១៣	០៨/០៤/២០១៣
៨៧០	១៣២៤/២០១៣	០៨/០៤/២០១៣
៨៧១	១៣២៤/២០១៣	១៤/១០/២០១៣
៨៧២	១៣២៥/២០១៣	១៤/១០/២០១៣
៨៧៣	១៣២១/២០១៣	១៤/១០/២០១៣
៨៧៤	១៣២៤/២០១៣	៣០/០៤/២០១៣
៨៧៥	១៣២៤/២០១៣	៣០/០៤/២០១៣
៨៧៦	១៣៣០/២០១៣	៣០/០៤/២០១៣
៨៧៧	១៣៣១/២០១៣	២៤/១១/២០១៣
៨៧៨	១៣៣២/២០១៣	១១/១០/២០១៣
៨៧៩	១០៤៣/២០១០	២៤/១១/២០១៣
៨៨០	១៣៣៤/២០១៣	០២/១២/២០១៣
៨៨១	១៣៣៥/២០១៣	២៤/១១/២០១៣

៨៩២	១៣៣៤/២០១៣	២០/១២/២០១៣
៨៩៣	១៣៨០/២០១៣	០២/១២/២០១៣
៨៩៤	១៣៨១/២០១៣	២៩/០៨/២០១៤
៨៩៥	១៣៨២/២០១៣	២៩/០៤/២០១៤
៨៩៦	១៣៨៣/២០១៣	០៨/០១/២០១៤
៨៩៧	១៣៨៤/២០១៣	០៣/១២/២០១៣
៨៩៨	១៣៨៥/២០១៣	០២/១២/២០១៣
៨៩៩	១៣៨៦/២០១៣	២៤/០៣/២០១៤
៤០០	១៣៨៧/២០១៣	២៥/១២/២០១៣
៤០១	១៣៨៨/២០១៣	១០/០១/២០១៤
៤០២	១៣៨៩/២០១៣	២២/០១/២០១៤
៤០៣	១៣៩០/២០១៣	១២/០២/២០១៤
៤០៤	១៣៩១/២០១៣	១២/០២/២០១៤
៤០៥	១៣៩២/២០១៣	២៩/០៨/២០១៤
៤០៦	១៣៩៣/២០១៣	២៩/០៨/២០១៤
៤០៧	១៣៩៤/២០១៣	២៩/០៨/២០១៤
៤០៨	១៣៩៥/២០១៣	០៣/០៣/២០១៤
៤០៩	១៣៩៦/២០១៣	១២/០២/២០១៤
៤១០	១៣៩៧/២០១៣	៣១/១២/២០១៣
៤១១	១៣៩៨/២០១៣	០៣/០៨/២០១៤
៤១២	១៣៩៩/២០១៣	២៩/០៣/២០១៤
៤១៣	១៣៩០/២០១៣	២៩/០៨/២០១៤
៤១៤	១៣៩១/២០១៣	២៩/០៨/២០១៤
៤១៥	១៣៩២/២០១៣	២៩/០៨/២០១៤
៤១៦	១៣៩៣/២០១៣	២៩/០៨/២០១៤
៤១៧	១៣៩៤/២០១៣	២៩/០៨/២០១៤
៤១៨	១៣៩៥/២០១៣	២៩/០៨/២០១៤
៤១៩	១៣៩៦/២០១៣	២៩/០៨/២០១៤
៤២០	១៣៩៧/២០១៣	២៩/០៨/២០១៤

421	9393/2013	26/08/2018
422	9398/2013	26/08/2018
423	9394/2013	26/08/2018
424	9390/2013	26/08/2018
424	9395/2013	26/08/2018
425	9399/2013	26/08/2018
429	9396/2013	26/08/2018
426	9396/2013	26/04/2018
426	9360/2013	26/04/2018
430	9361/2013	04/03/2018
431	9362/2013	04/03/2018
432	9363/2013	04/03/2018
433	9368/2013	04/03/2018
434	9364/2013	04/03/2018
434	9365/2013	26/08/2018
435	9366/2013	09/02/2018
439	9360/2018	26/04/2018
436	9361/2018	09/02/2018
436	9362/2018	26/04/2018
480	9368/2018	16/03/2018
481	9364/2018	09/08/2018
482	9365/2018	18/04/2018
483	9800/2018	24/08/2018
484	9802/2018	04/09/2018
484	9805/2018	10/09/2018
485	9363/2018	11/09/2018
489	9366/2018	12/09/2018
486	9822/2018	13/09/2018
486	9812/2018	24/06/2018

440	9893/2018	24/06/2018
441	9898/2018	24/06/2018
442	9366/2018	09/10/2018
443	9888/2018	18/10/2018
448	9836/2018	09/11/2018
444	9884/2018	13/11/2018
445	9838/2018	19/11/2018
449	9834/2018	19/11/2018
446	9835/2018	19/11/2018
446	9836/2018	19/11/2018
450	9831/2018	14/12/2018
451	9821/2018	20/12/2018
452	9803/2018	31/12/2018
453	9886/2018	05/01/2019
458	9809/2018	15/01/2019
454	9806/2018	15/01/2019
455	9806/2018	15/01/2019
459	9890/2018	15/01/2019
456	9895/2018	15/01/2019
456	9899/2018	15/01/2019
490	9896/2018	15/01/2019
491	9824/2018	15/01/2019
492	9825/2018	15/01/2019
493	9829/2018	15/01/2019
498	9826/2018	15/01/2019
494	9839/2018	15/01/2019
495	9882/2018	15/01/2019
499	9886/2018	06/03/2019
496	9880/2018	28/03/2019

496	1844/2018	30/03/2014
490	1861/2018	31/03/2014
491	1823/2018	01/08/2014
492	1830/2018	01/08/2014
493	1889/2018	01/08/2014
498	1899/2018	01/08/2014
494	1862/2014	16/04/2014
495	1863/2014	16/04/2014
499	1868/2014	16/04/2014
496	1864/2014	16/04/2014
496	1865/2014	16/04/2014
490	1869/2014	16/04/2014
491	1866/2014	16/04/2014
492	1840/2018	21/04/2014
493	1841/2018	21/04/2014
498	1842/2018	21/04/2014
494	1893/2018	26/04/2014
495	1896/2018	26/04/2014
499	1843/2018	03/05/2014
496	1396/2013	01/09/2014
496	1369/2018	01/09/2014
500	1353/2013	01/09/2014
501	1863/2014	14/09/2014
502	1894/2018	14/09/2014
503	1849/2018	21/09/2014
508	1336/2013	23/09/2014
504	1860/2014	30/09/2014
505	1833/2018	31/09/2014
509	1493/2014	31/09/2014

506	૧૪૩૨/૨૦૧૪	૦૩/૦૮/૨૦૧૫
506	૧૨૯૬/૨૦૧૩	૦૩/૦૮/૨૦૧૫
510	૧૪૯૫/૨૦૧૫	૦૪/૦૮/૨૦૧૫
511	૧૪૪૩/૨૦૧૪	૦૪/૦૮/૨૦૧૫
512	૧૪૭૮/૨૦૧૫	૦૪/૦૮/૨૦૧૫
513	સ્વયં અરજી પ્રક્રિયા કેસ ૧૩૦૭ અને ૧૩૧૨/૨૦૧૩	૦૪/૦૮/૨૦૧૫
514	૧૪૨૪/૨૦૧૪	૦૪/૦૮/૨૦૧૫
515	૧૪૦૫/૨૦૧૪	૦૪/૦૮/૨૦૧૫
515	૧૪૭૬/૨૦૧૫	૦૪/૦૮/૨૦૧૫
519	સ્વયં અરજી પ્રક્રિયા કેસ ૧૪૪૬/૨૦૧૪	૧૭/૦૮/૨૦૧૫
516	૧૪૫૮/૨૦૧૪	૧૭/૦૮/૨૦૧૫
516	૧૫૧૦/૨૦૧૫	૧૮/૧૧/૨૦૧૫
520	૧૫૩૪/૨૦૧૫	૦૨/૧૨/૨૦૧૫
521	૧૫૧૪/૨૦૧૫	૦૭/૧૨/૨૦૧૫
522	૧૫૦૯/૨૦૧૫	૦૪/૦૨/૨૦૧૬
523	૧૫૦૬/૨૦૧૫	૦૪/૦૨/૨૦૧૬
524	૧૫૦૭/૨૦૧૫	૦૪/૦૨/૨૦૧૬
525	૧૫૨૮/૨૦૧૫	૦૮/૦૨/૨૦૧૬
525	૧૫૩૭/૨૦૧૫	૦૮/૦૨/૨૦૧૬
529	૧૫૦૮/૨૦૧૫	૧૦/૦૨/૨૦૧૬
526	૧૫૪૩/૨૦૧૫	૦૯/૦૩/૨૦૧૬
526	૧૫૧૭/૨૦૧૫	૨૩/૦૩/૨૦૧૬
530	૧૫૬૩/૨૦૧૬	૨૯/૦૩/૨૦૧૬
531	૧૫૭૯/૨૦૧૬	૦૯/૦૫/૨૦૧૬
532	૧૫૭૫/૨૦૧૬	૧૭/૦૫/૨૦૧૬
533	૧૫૭૬/૨૦૧૬	૧૭/૦૫/૨૦૧૬
534	૧૫૭૭/૨૦૧૬	૧૭/૦૫/૨૦૧૬
535	૧૫૭૮/૨૦૧૬	૧૭/૦૫/૨૦૧૬
535	૧૫૮૬/૨૦૧૬	૧૮/૦૫/૨૦૧૬

539	૧૫૮૭/૨૦૧૬	૧૮/૦૫/૨૦૧૬
53૮	૧૫૬૪/૨૦૧૫	૨૩/૦૫/૨૦૧૬
53૯	૧૫૬૫/૨૦૧૫	૨૪/૦૫/૨૦૧૬
5૪૦	૧૫૪૭/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૧	૧૫૪૮/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૨	૧૫૪૯/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૩	૧૫૫૦/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૪	૧૫૫૧/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૫	૧૫૫૨/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૬	૧૫૫૩/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૭	૧૫૫૪/૨૦૧૫	૩૧/૦૩/૨૦૧૬
5૪૮	૧૫૫૬/૨૦૧૬	૩૧/૦૩/૨૦૧૬
5૪૯	૧૫૮૧/૨૦૧૬	૧૯/૦૫/૨૦૧૬
5૫૦	૧૫૬૨/૨૦૧૬	૨૨/૦૬/૨૦૧૬
5૫૧	૧૫૧૨/૨૦૧૫	૦૭/૦૭/૨૦૧૬
5૫૨	૧૫૭૦/૨૦૧૬	૧૧/૦૭/૨૦૧૬
5૫૩	૧૫૧૫/૨૦૧૬	૧૨/૦૭/૨૦૧૬
5૫૪	૧૫૧૬/૨૦૧૬	૧૨/૦૭/૨૦૧૬
5૫૫	૧૫૮૦/૨૦૧૬	૨૮/૦૭/૨૦૧૬
5૫૬	૧૫૩૧/૨૦૧૫	૨૯/૦૭/૨૦૧૬
5૫૭	૧૫૬૭/૨૦૧૬	૦૮/૦૮/૨૦૧૬
5૫૮	૧૪૫૯/૨૦૧૪	૨૦/૦૮/૨૦૧૬
5૫૯	૧૫૨૫/૨૦૧૫	૨૧/૦૮/૨૦૧૬
5૬૦	૧૫૯૮/૨૦૧૬	૨૪/૧૦/૨૦૧૬
5૬૧	સ્વયમ અર્જી ૧૬૦૯/૨૦૧૬	૦૭/૧૧/૨૦૧૬
5૬૨	૧૫૩૩/૨૦૧૫	૩૧/૧૨/૨૦૧૬
5૬૩	૧૫૧૮/૨૦૧૫	૩૧/૧૨/૨૦૧૬
5૬૪	સ્વયમ અર્જી ૧૫૪૨/૨૦૧૫	૩૧/૧૨/૨૦૧૬
5૬૫	૧૫૩૬/૨૦૧૫	૩૧/૧૨/૨૦૧૬
5૬૬	૧૬૩૨/૨૦૧૬	૦૩/૦૧/૨૦૧૭

559	1530/2015	29/02/2019
556	1584/2019	16/08/2019
556	1585/2019	16/08/2019
590	1535/2019	28/08/2019
591	1534/2019	29/08/2019
592	1586/2019	03/04/2019
593	1538/2019	03/04/2019
598	1892/2018	06/04/2019
594	1549/2019	25/04/2019
595	1460/2015	31/04/2019
599	1466/2015	31/04/2019
596	1466/2015	31/04/2019
596	1464/2015	31/04/2019
560	1468/2015	31/04/2019
561	1596/2015	31/03/2019
562	1520/2015	31/03/2019
563	1521/2015	31/03/2019
568	1522/2015	31/03/2019
564	1523/2015	31/03/2019
565	1528/2015	31/03/2019
569	1524/2015	31/03/2019
566	1531/2015	31/03/2019
566	1525/2019/16	06/05/2019
560	1529/2019/16	06/05/2019
561	1526/2019/16	06/05/2019
562	1526/2019/16	04/08/2016
563	1536/2019/16	30/05/2019
568	1536/2019/16	30/05/2019
564	1561/2019/16	31/03/2016
565	1562/2019/16	31/03/2016
569	1563/2019/16	31/03/2016

૬૯૮	૧૬૯૪/૨૦૧૭/૧૮	૦૪/૦૪/૨૦૧૮
૬૯૯	૧૬૯૫/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૦	૧૬૯૬/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૧	૧૬૯૭/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૨	૧૬૯૮/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૩	૧૬૯૯/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૪	૧૭૦૦/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૫	૧૭૦૧/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૬	૧૭૦૨/૨૦૧૭/૧૮	૩૧/૦૩/૨૦૧૮
૭૦૭	૧૬૬૪/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭
૭૦૮	૧૬૬૫/૨૦૧૭	૧૨/૧૦/૨૦૧૭
૭૦૯	૧૬૬૬/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭
૭૧૦	૧૬૬૮/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭
૭૧૧	૧૬૬૯/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭
૭૧૨	૧૬૭૦/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭
૭૧૩	૧૬૭૧/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭
૭૧૪	૧૬૭૩/૨૦૧૭	૦૪/૦૯/૨૦૧૭
૭૧૫	૧૬૭૪/૨૦૧૭	૦૪/૦૯/૨૦૧૭
૭૧૬	રિવ્યુ પિટિશન ૧૫૬૮/૨૦૧૬, ૧૫૭૨/૨૦૧૬ અને ૧૫૭૪/૨૦૧૬	૦૮/૦૬/૨૦૧૭
૭૧૭	રિવ્યુ પિટિશન ૧૬૫૨/૨૦૧૭	૦૮/૦૬/૨૦૧૭
૭૧૮	૧૫૯૨/૨૦૧૬	૧૫/૦૬/૨૦૧૭
૭૧૯	૧૫૯૩/૨૦૧૬	૧૫/૦૬/૨૦૧૭
૭૨૦	૧૫૯૪/૨૦૧૬	૧૫/૦૬/૨૦૧૭
૭૨૧	૧૫૯૫/૨૦૧૬	૧૫/૦૬/૨૦૧૭
૭૨૨	૧૫૯૧/૨૦૧૬	૧૫/૦૬/૨૦૧૭
૭૨૩	૧૬૫૦/૨૦૧૬	૧૯/૦૬/૨૦૧૭
૭૨૪	૧૬૪૮/૨૦૧૭	૦૩/૦૮/૨૦૧૭
૭૨૫	૧૫૬૧/૨૦૧૬	૦૯/૦૮/૨૦૧૭
૭૨૬	૧૬૦૦/૨૦૧૬	૧૧/૦૮/૨૦૧૭
૭૨૭	૧૬૬૪, ૧૬૬૯ & ૧૬૭૦/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭

૭૨૮	૧૬૬૬,૧૬૬૮ & ૧૬૭૧/૨૦૧૭	૧૧/૦૮/૨૦૧૭
૭૨૯	૧૫૫૮/૨૦૧૬	૦૮/૦૮/૨૦૧૭
૭૩૦	૧૬૪૭/૨૦૧૭	૦૫/૦૮/૨૦૧૭
૭૩૧	૧૬૭૩/૨૦૧૭	૦૪/૦૮/૨૦૧૭
૭૩૨	૧૬૭૪/૨૦૧૭	૦૪/૦૮/૨૦૧૭
૭૩૩	૧૫૪૫/૨૦૧૫	૦૬/૧૦/૨૦૧૭
૭૩૪	૧૬૮૨/૨૦૧૭	૦૬/૧૦/૨૦૧૭
૭૩૫	૧૬૬૫/૨૦૧૭	૧૨/૧૦/૨૦૧૭
૭૩૬	૧૬૮૩/૨૦૧૭	૧૩/૧૦/૨૦૧૭
૭૩૭	સુઓ/મોટો પિટિશન ૧૬૫૪/૨૦૧૭	૨૩/૧૦/૨૦૧૭
૭૩૮	૧૫૪૫/૨૦૧૫	૨૫/૧૦/૨૦૧૭
૭૩૯	૧૫૮૩/૨૦૧૬	૨૫/૧૦/૨૦૧૭
૭૪૦	૧૬૩૩/૨૦૧૬	૦૩/૧૧/૨૦૧૭
૭૪૧	૧૬૪૦/૨૦૧૭	૧૦/૧૧/૨૦૧૭
૭૪૨	૧૬૮૪/૨૦૧૭	૦૧/૧૨/૨૦૧૭
૭૪૩	૧૬૮૧/૨૦૧૭	૦૨/૦૧/૨૦૧૮
૭૪૪	૧૬૮૭/૨૦૧૭	૦૩/૦૧/૨૦૧૮
૭૪૫	૧૭૦૩/૨૦૧૮	૦૨/૦૨/૨૦૧૮
૭૪૬	ઓર્ડર ટેરી (TERI)	૦૮/૦૨/૨૦૧૮
૭૪૭	૧૭૦૮/૨૦૧૮	૧૫/૦૩/૨૦૧૮
૭૪૮	૧૭૦૬/૨૦૧૮	૧૫/૦૩/૨૦૧૮
૭૪૯	૧૭૦૭/૨૦૧૮	૧૫/૦૩/૨૦૧૮
૭૫૦	૧૭૧૧/૨૦૧૮	૨૧/૦૪/૨૦૧૮
૭૫૧	૧૦૨૪/૨૦૧૦ અને આઈએ ૮/૨૦૧૬	૦૭/૦૫/૨૦૧૮
૭૫૨	૧૬૧૭/૨૦૧૭	૦૭/૦૫/૨૦૧૮
૭૫૩	૧૭૧૪/૨૦૧૮	૧૮/૦૫/૨૦૧૮
૭૫૪	૧૬૧૦/૨૦૧૬	૩૦/૦૫/૨૦૧૮
૭૫૫	૧૭૦૫/૨૦૧૮	૩૧/૦૫/૨૦૧૮
૭૫૬	૧૭૧૫/૨૦૧૮	૦૭/૦૬/૨૦૧૮
૭૫૭	રિવ્યુ પિટીશન નં ૧૫૨૩/૨૦૧૫	૦૭/૦૬/૨૦૧૮
૭૫૮	૧૬૦૫/૨૦૧૬	૦૮/૦૬/૨૦૧૮

૭૫૯	રિવ્યુ પિટીશન નં ૧૫૧૯/૨૦૧૫	૦૮/૦૬/૨૦૧૮
૭૬૦	૧૬૫૯/૨૦૧૭	૦૮/૦૬/૨૦૧૮
૭૬૧	૧૬૬૭/૨૦૧૭	૦૮/૦૬/૨૦૧૮
૭૬૨	૧૬૮૫/૨૦૧૭	૧૮/૦૬/૨૦૧૮
૭૬૩	૧૬૬૩/૨૦૧૭	૨૫/૦૭/૨૦૧૮
૭૬૪	૧૬૬૨/૨૦૧૭	૨૫/૦૭/૨૦૧૮
૭૬૫	૧૬૬૧/૨૦૧૭	૨૫/૦૭/૨૦૧૮
૭૬૬	રિવ્યુ પિટીશન નં ૧૬૦૭/૨૦૧૬	૩૧/૦૭/૨૦૧૮
૭૬૭	૧૨૪૪/૨૦૧૨ & આઇએ નં ૩/૨૦૧૪, ૭/૨૦૧૬ & ૧૩/૨૦૧૬	૩૧/૦૭/૨૦૧૮
૭૬૮	૧૬૦૩/૨૦૧૬	૩૧/૦૭/૨૦૧૮
૭૬૯	રિવ્યુ પિટીશન નં ૧૫૪૦/૨૦૧૫	૧૦/૦૮/૨૦૧૮
૭૭૦	૧૫૨૨/૨૦૧૫	૧૦/૦૮/૨૦૧૮
૭૭૧	૧૫૯૭/૨૦૧૬	૨૧/૦૮/૨૦૧૮
૭૭૨	૧૬૦૬/૨૦૧૬	૨૯/૦૯/૨૦૧૮
૭૭૩	૧૪૭૭/૨૦૧૫ & આઇએ નં ૨/૨૦૧૬, ૧૧/૨૦૧૭	૨૯/૦૯/૨૦૧૮
૭૭૪	૧૬૭૬/૨૦૧૭ & આઇએ નં ૧૭ /૨૦૧૭	૦૧/૧૦/૨૦૧૮
૭૭૫	૧૬૭૮/૨૦૧૭	૦૧/૧૦/૨૦૧૮
૭૭૬	૧૬૭૯/૨૦૧૭	૦૧/૧૦/૨૦૧૮
૭૭૭	૧૫૯૬/૨૦૧૬	૨૦/૧૦/૨૦૧૮
૭૭૮	૧૭૪૩/૨૦૧૮	૨૩/૧૦/૨૦૧૮
૭૭૯	૧૭૨૯/૨૦૧૮	૨૯/૧૦/૨૦૧૮
૭૮૦	૧૭૩૧/૨૦૧૮ & આઇએ નં ૪ /૨૦૧૮ & ૫/૨૦૧૮	૦૫/૧૧/૨૦૧૮
૭૮૧	૧૭૪૫/૨૦૧૮	૨૦/૧૧/૨૦૧૮
૭૮૨	૧૭૪૪/૨૦૧૮	૨૦/૧૧/૨૦૧૮
૭૮૩	૧૭૫૫/૨૦૧૮	૨૯/૧૧/૨૦૧૮
૭૮૪	૧૫૨૯/૨૦૧૫	૦૭/૧૨/૨૦૧૮
૭૮૫	૧૬૦૮/૨૦૧૬	૦૭/૧૨/૨૦૧૮
૭૮૬	૧૭૪૬/૨૦૧૮	૦૧/૦૧/૨૦૧૯
૭૮૭	સુઓ/મોટો ૧૪૪૨/૨૦૧૪*	૦૨/૦૧/૨૦૧૯
૭૮૮	૧૬૫૫/૨૦૧૭	૦૮/૦૧/૨૦૧૯

૭૮૯	૧૪૩૭/૨૦૧૪*	૦૮/૦૧/૨૦૧૯
૭૯૦	૧૭૩૭/૨૦૧૮	૨૫/૦૧/૨૦૧૯
૭૯૧	રિવ્યુ પિટીશન નં ૧૭૭૫/૨૦૧૯	૨૬/૦૨/૨૦૧૯
૭૯૨	૧૭૯૧/૨૦૧૯	૨૯/૦૫/૨૦૧૯
૭૯૩	૧૬૧૬/૨૦૧૬	૨૩/૦૫/૨૦૧૯
૭૯૪	૧૭૩૨/૨૦૧૮	૧૬/૦૫/૨૦૧૯
૭૯૫	૧૭૮૪/૨૦૧૯	૧૬/૦૫/૨૦૧૯
૭૯૬	૧૭૧૬/૨૦૧૮	૦૯/૦૫/૨૦૧૯
૭૯૭	૧૭૧૭/૨૦૧૮	૦૯/૦૫/૨૦૧૯
૭૯૮	૧૭૧૮/૨૦૧૮	૦૯/૦૫/૨૦૧૯
૭૯૯	૧૭૧૯/૨૦૧૮	૦૯/૦૫/૨૦૧૯
૮૦૦	૧૭૨૦/૨૦૧૮	૦૯/૦૫/૨૦૧૯
૮૦૧	૧૭૨૮/૨૦૧૮	૦૯/૦૫/૨૦૧૯
૮૦૨	અમલ અરજી (EP) ૦૧/૨૦૨૦	૧૬/૦૫/૨૦૧૯
૮૦૩	૧૬૮૯/૨૦૧૭	૦૬/૦૫/૨૦૧૯
૮૦૪	૯૭૨/૨૦૦૯	૨૭/૧૨/૨૦૧૯
૮૦૫	૧૩૨૨/૨૦૧૩	૧૯/૦૬/૨૦૧૯
૮૦૬	૧૩૮૯/૨૦૧૪, દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૦૧/૨૦૧૪	૧૯/૦૮/૨૦૧૯
૮૦૭	૧૪૦૪/૨૦૧૪	૨૭/૦૨/૨૦૧૯
૮૦૮	૧૪૦૫/૨૦૧૪	૦૭/૧૨/૨૦૧૯
૮૦૯	૧૪૧૮/૨૦૧૪	૨૧/૧૨/૨૦૧૯
૮૧૦	૧૪૫૪/૨૦૧૪	૦૨/૦૯/૨૦૨૦
૮૧૧	૧૪૭૫/૨૦૧૫	૨૭/૦૯/૨૦૧૯
૮૧૨	દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૦૪/૨૦૧૬, ૧૪૮૯/૨૦૧૫	૨૬/૦૯/૨૦૧૯
૮૧૩	૧૪૯૨/૨૦૧૫	૨૬/૦૯/૨૦૧૯
૮૧૪	૧૫૨૧/૨૦૧૫	૨૦/૧૨/૨૦૧૯
૮૧૫	૧૭૨૭/૨૦૧૮ અને દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૦૫/૨૦૧૯	૨૨/૧૧/૨૦૧૯
૮૧૬	૧૫૨૯/૨૦૧૫	૨૬/૧૨/૨૦૧૯

૮૧૭	સુધારા આદેશ તા/:૨૬/૧૨/૨૦૧૯ પીટીશન નં ૧૫૨૯/૨૦૧૫	૨૭/૧૨/૨૦૧૯
૮૧૮	૧૫૩૨/૨૦૧૫, દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૦૭/૨૦૧૭, ૧૨/૨૦૧૭ અને ૨૧/૨૦૧૭	૨૮/૦૨/૨૦૧૯
૮૧૯	૧૫૩૫/૨૦૧૫	૨૩/૧૨/૨૦૧૯
૮૨૦	રિવ્યુ પીટીશન નં : ૧૫૩૯/૨૦૧૫	૨૩/૧૨/૨૦૧૯
૮૨૧	પીટીશન નં ૧૫૫૪/૨૦૧૫નો આનુષંગિક આદેશ	૧૯/૦૬/૨૦૧૯
૮૨૨	૧૫૫૯/૨૦૧૬	૧૮/૦૭/૨૦૧૯
૮૨૩	૧૫૬૬/૨૦૧૬	૨૧/૧૨/૨૦૧૯
૮૨૪	૧૫૬૯/૨૦૧૬	૨૪/૧૨/૨૦૧૯
૮૨૫	૧૫૮૨/૨૦૧૬	૦૬/૦૮/૨૦૧૯
૮૨૬	૧૫૯૯/૨૦૧૬	૨૭/૧૨/૨૦૧૯
૮૨૭	૧૬૦૨/૨૦૧૬	૨૪/૧૨/૨૦૧૯
૮૨૮	૧૬૦૪/૨૦૧૬	૨૬/૧૨/૨૦૧૯
૮૨૯	૧૬૧૫/૨૦૧૬	૨૬/૧૨/૨૦૧૯
૮૩૦	સુઓ/મોટો પીટીશન નં ૧૬૩૭/૨૦૧૭	૨૬/૧૨/૨૦૧૯
૮૩૧	૧૬૪૧/૨૦૧૭ દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૧૫/૨૦૧૭	
૮૩૨	૧૬૪૨/૨૦૧૭	૦૯/૦૯/૨૦૧૯
૮૩૩	૧૬૪૩/૨૦૧૭ દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૧૦/૨૦૧૭	૨૩/૧૨/૨૦૧૯
૮૩૪	૧૬૫૮/૨૦૧૭	૨૬/૦૮/૨૦૧૯
૮૩૫	૧૬૬૦/૨૦૧૯	૧૯/૦૬/૨૦૧૯
૮૩૬	૧૬૭૭/૨૦૧૭	૨૭/૦૫/૨૦૨૦
૮૩૭	૧૬૮૦/૨૦૧૭ દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૧૬/૨૦૧૭	૨૩/૧૨/૨૦૧૯
૮૩૮	૧૬૮૮/૨૦૧૭	૦૬/૦૫/૨૦૨૦
૮૩૯	૧૬૯૦/૨૦૧૭	૧૪/૦૫/૨૦૨૦
૮૪૦	૧૭૧૨/૨૦૧૮	૦૯/૦૩/૨૦૨૦
૮૪૧	૧૭૨૫/૨૦૧૮ દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં	૧૮/૧૨/૨૦૧૯

	૦૪/૨૦૧૯	
૮૪૨	૧૭૨૬/૨૦૧૮ દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૦૩/૨૦૧૯	૨૪/૧૨/૨૦૧૯
૮૪૩	૧૭૩૩/૨૦૧૮	૦૪/૦૭/૨૦૧૯
૮૪૪	૧૭૩૪/૨૦૧૮	૦૫/૦૯/૨૦૧૯
૮૪૫	૧૭૩૫/૨૦૧૭, ૧૭૩૬/૨૦૧૭,	૧૫/૧૦/૨૦૧૯
૮૪૬	૧૭૪૮/૨૦૧૮	૦૫/૦૩/૨૦૨૦
૮૪૭	૧૭૫૦/૨૦૧૮	૨૭/૦૯/૨૦૧૯
૮૪૮	રિવ્યુ પીટીશન નં ૧૭૫૩/૨૦૧૮	૦૪/૦૭/૨૦૧૯
૮૪૯	૧૭૬૭/૨૦૧૮	૦૫/૦૩/૨૦૨૦
૮૫૦	૧૭૬૮/૨૦૧૮	૧૯/૦૬/૨૦૧૯
૮૫૧	૧૭૭૬/૨૦૧૯	૨૭/૧૨/૨૦૧૯
૮૫૨	૧૭૮૬/૨૦૧૯	૨૬/૧૨/૨૦૧૯
૮૫૩	૧૭૮૭/૨૦૧૯	૧૯/૦૬/૨૦૧૯
૮૫૪	૧૭૯૦/૨૦૧૯	૧૫/૦૬/૨૦૧૯
૮૫૫	૧૭૯૩/૨૦૧૯	૨૫/૦૬/૨૦૧૯
૮૫૬	૧૭૯૪/૨૦૧૯	૦૫/૦૮/૨૦૧૯
૮૫૭	૧૭૯૪/૨૦૧૯	૦૯/૧૦/૨૦૧૯
૮૫૮	રિવ્યુ પીટીશન નં ૧૭૯૭/૨૦૧૯	૦૮/૦૭/૨૦૧૯
૮૫૯	૧૮૦૦/૨૦૧૯	૧૫/૦૭/૨૦૧૯
૮૬૦	૧૮૦૨/૨૦૧૯	૦૮/૦૮/૨૦૧૯
૮૬૧	૧૮૦૩/૨૦૧૯	૧૭/૦૭/૨૦૧૯
૮૬૨	૧૮૦૪/૨૦૧૯	૨૨/૦૭/૨૦૧૯
૮૬૩	૧૮૦૭/૨૦૧૯	૨૭/૦૪/૨૦૨૦
૮૬૪	૧૮૧૮/૨૦૧૯	૨૩/૧૦/૨૦૧૯
૮૬૫	૧૮૧૯/૨૦૧૯	૨૩/૧૦/૨૦૧૯
૮૬૬	૧૮૨૧/૨૦૧૯	૧૬/૧૨/૨૦૧૯
૮૬૭	૧૮૨૫/૨૦૧૯	૧૭/૧૨/૨૦૧૯
૮૬૮	૧૮૨૭/૨૦૧૯	૧૮/૦૧/૨૦૨૦

૮૬૯	૧૮૨૯/૨૦૧૯	૦૭/૦૭/૨૦૨૦
૮૭૦	૧૮૪૮/૨૦૧૯	૧૩/૦૧/૨૦૨૦
૮૭૧	૧૮૪૯/૨૦૧૯	૦૭/૦૧/૨૦૨૦
૮૭૨	૧૮૬૦/૨૦૨૦	૧૯/૦૫/૨૦૨૦
૮૭૩	૧૪૫૪/૨૦૧૪	૦૨/૦૬/૨૦૨૦
૮૭૪	૧૬૫૩/૨૦૧૭, દાવા દરમિયાન કરાયેલી અરજી (IA) નં ૧૦/૨૦૧૭	૦૬/૦૩/૨૦૨૦
૮૭૫	૧૫૪૧/૨૦૧૫	૧૯/૧૨/૨૦૧૯
૮૭૬	૧૭૨૭/૨૦૧૮	૨૨/૧૧/૨૦૧૯
૮૭૭	૧૭૫૬/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૭૮	૧૭૫૭/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૭૯	૧૭૫૮/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૦	૧૭૫૯/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૧	૧૭૬૦/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૨	૧૭૬૧/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૩	૧૭૬૨/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૪	૧૭૬૩/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૫	૧૭૬૪/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૬	૧૭૬૫/૨૦૧૮	૨૪/૦૪/૨૦૧૯
૮૮૭	૧૭૬૬/૨૦૧૮	૧૭/૦૭/૨૦૧૯
૮૮૮	૧૭૭૨/૨૦૧૮	૩૦/૦૭/૨૦૧૯
૮૮૯	૧૭૭૭/૨૦૧૯	૩૧/૦૭/૨૦૧૯
૮૯૦	૧૭૭૮/૨૦૧૯	૩૧/૦૭/૨૦૧૯
૮૯૧	પીટીશન નં ૧૫૫૧/૨૦૧૫નો આનુષંગિક આદેશ	૧૯/૦૮/૨૦૧૯
૮૯૨	૧૮૧૨/૨૦૧૯	૨૭/૦૯/૨૦૧૯
૮૯૩	૧૮૧૩/૨૦૧૯	૦૭/૧૧/૨૦૧૯
૮૯૪	૧૮૩૬/૨૦૧૯	૨૬/૦૩/૨૦૨૦
૮૯૫	૧૮૩૭/૨૦૧૯	૨૬/૦૩/૨૦૨૦
૮૯૬	૧૮૩૮/૨૦૧૯	૨૬/૦૩/૨૦૨૦

૮૯૭	૧૮૩૯/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૮૯૮	૧૮૪૦/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૮૯૯	૧૮૪૧/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૯૦૦	૧૮૪૨/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૯૦૧	૧૮૪૩/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૯૦૨	૧૮૪૪/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૯૦૩	૧૮૪૫/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૯૦૪	૧૮૪૬/૨૦૧૯	૩૧/૦૩/૨૦૨૦
૯૦૫	૧૮૫૦/૨૦૧૯	૦૩/૦૪/૨૦૨૦
૯૦૬	૧૮૫૩/૨૦૨૦	૦૪/૦૪/૨૦૨૦
૯૦૭	૧૮૦૯/૨૦૧૯	૦૧/૦૭/૨૦૨૦
૯૦૮	પીટીશન નં ૧૬૨૭/૨૦૧૬નો આનુષંગિક આદેશ	૦૫/૦૯/૨૦૨૦
૯૦૯	પીટીશન નં ૧૬૨૮/૨૦૧૬નો આનુષંગિક આદેશ	૦૫/૦૯/૨૦૨૦
૯૧૦	પીટીશન નં ૧૬૨૯/૨૦૧૬નો આનુષંગિક આદેશ	૦૫/૦૯/૨૦૨૦
૯૧૧	૧૮૧૦ અને ૧૮૧૧/૨૦૧૯	૨૯/૦૯/૨૦૨૦
૯૧૨	૧૮૫૧/૨૦૨૦	૦૯/૧૦/૨૦૨૦
૯૧૩	સુઓ/મોટો આદેશ નં ૭/૨૦૨૦	૨૩/૧૨/૨૦૨૦
૯૧૪	૧૯૦૦/૨૦૨૦	૨૯/૦૧/૨૦૨૧
૯૧૫	૧૯૦૫/૨૦૨૦	૨૬/૦૨/૨૦૨૧
૯૧૬	૧૯૦૬/૨૦૨૦	૨૯/૦૧/૨૦૨૧
૯૧૭	૧૯૦૮/૨૦૨૦	૩૧/૦૩/૨૦૨૧
૯૧૮	૧૯૦૯/૨૦૨૦	૩૧/૦૩/૨૦૨૧
૯૧૯	૧૯૧૦/૨૦૨૦	૩૧/૦૩/૨૦૨૧
૯૨૦	૧૯૧૧/૨૦૨૦	૩૧/૦૩/૨૦૨૧
૯૨૧	૧૯૧૨/૨૦૨૦	૩૧/૦૩/૨૦૨૧
૯૨૨	૧૯૧૩/૨૦૨૦	૩૧/૦૩/૨૦૨૧
૯૨૩	૧૯૧૪/૨૦૨૦	૩૧/૦૩/૨૦૨૧
૯૨૪	૧૯૨૩/૨૦૨૧	૧૨/૧૦/૨૦૨૦
૯૨૫	૧૯૨૫/૨૦૨૧	૩૧/૦૩/૨૦૨૧

૯૨૬	૧૯૨૬/૨૦૨૧	૩૧/૦૩/૨૦૨૧
૯૨૭	૧૯૨૭/૨૦૨૧	૩૧/૦૩/૨૦૨૧
૯૨૮	૧૯૨૮/૨૦૨૧	૩૧/૦૩/૨૦૨૧
૯૨૯	૧૯૨૯/૨૦૨૧	૩૧/૦૩/૨૦૨૧
૯૩૦	૧૯૨૪/૨૦૨૧	૦૧/૦૪/૨૦૨૧
૯૩૧	૧૯૩૪/૨૦૨૧	૦૧/૦૪/૨૦૨૧
૯૩૨	૧૯૩૭/૨૦૨૧	૦૩/૦૫/૨૦૨૧
૯૩૩	૧૯૫૪/૨૦૨૧	૨૫/૦૩/૨૦૨૧
૯૩૪	૧૯૫૯/૨૦૨૧	૧૨/૦૫/૨૦૨૧
૯૩૫	૧૯૬૩/૨૦૨૧	૧૩/૦૫/૨૦૨૧
૯૩૬	૧૭૨૧/૨૦૧૮	૦૨/૦૬/૨૦૨૦
૯૩૭	૧૪૫૪/૨૦૧૪	૦૨/૦૬/૨૦૨૦
૯૩૮	૧૮૨૪/૨૦૧૯	૦૪/૦૬/૨૦૨૦
૯૩૯	સુઓ મોટુ પીટીશન નં ૧૭૧૩/૨૦૧૮	૦૯/૦૬/૨૦૨૦
૯૪૦	૧૭૭૦/૨૦૧૮	૦૪/૦૭/૨૦૨૦
૯૪૧	૧૮૨૯/૨૦૧૯	૦૭/૦૭/૨૦૨૦
૯૪૨	૧૭૮૦/૨૦૨૦	૦૭/૦૭/૨૦૨૦
૯૪૩	૧૮૬૧/૨૦૨૦	૦૮/૦૭/૨૦૨૦
૯૪૪	૧૮૭૪/૨૦૨૦	૨૦/૦૭/૨૦૨૦
૯૪૫	૧૭૪૦/૨૦૧૮	૨૨/૦૭/૨૦૨૦
૯૪૬	૧૭૨૨/૨૦૧૮	૨૨/૦૭/૨૦૨૦
૯૪૭	૧૭૮૫/૨૦૧૮	૩૧/૦૮/૨૦૨૦
૯૪૮	૧૭૫૪/૨૦૧૮	૦૭/૧૦/૨૦૨૦
૯૪૯	સુઓ મોટુ પીટીશન નં ૧૮૭૨/૨૦૨૦	૦૯/૧૦/૨૦૨૦
૯૫૦	૧૮૮૫/૨૦૨૦	૧૨/૧૦/૨૦૨૦
૯૫૧	૧૮૬૭/૨૦૨૦	૧૨/૧૦/૨૦૨૦
૯૫૨	૧૭૨૩/૨૦૧૮	૧૨/૧૦/૨૦૨૦
૯૫૩	૧૭૪૨/૨૦૧૮	૧૨/૧૦/૨૦૨૦
૯૫૪	૧૯૨૩/૨૦૨૧	૦૮/૦૧/૨૦૨૧

୯୫୫	ରୀଘ୍ୟୁ ପିଠିଶନ ୧୮୫୭/୨୦୨୦	୨୦/୦୧/୨୦୨୧
୯୫୬	ରୀଘ୍ୟୁ ପିଠିଶନ ୧୮୮୫/୨୦୨୦	୨୦/୦୧/୨୦୨୧
୯୫୭	୧୯୫୫/୨୦୨୧	୧୧/୦୨/୨୦୨୨
୯୫୮	୧୯୫୭/୨୦୨୧	୨୨/୦୭/୨୦୨୧
୯୫୯	୨୦୦୪/୨୦୨୧	୨୦/୧୧/୨୦୨୧
୯୬୦	୨୦୨୫/୨୦୨୧	୩୦/୦୩/୨୦୨୨
୯୬୧	୨୦୨୬/୨୦୨୧	୩୦/୦୩/୨୦୨୨
୯୬୨	୨୦୨୭/୨୦୨୧	୩୦/୦୩/୨୦୨୨
୯୬୩	୧୯୦୪/୨୦୨୧	୧୧.୦୬.୨୦୨୧
୯୬୪	୧୯୩୫/୨୦୨୧	୧୧.୦୬.୨୦୨୧
୯୬୫	୧୯୦୭/୨୦୨୧	୧୬.୦୬.୨୦୨୧
୯୬୬	୧୯୬୯/୨୦୨୧	୧୬.୦୬.୨୦୨୧
୯୬୭	୧୮୭୯/୨୦୨୦	୨୪.୦୬.୨୦୨୧
୯୬୮	୧୯୭୦/୨୦୨୧	୧୨.୦୭.୨୦୨୧
୯୬୯	୧୯୮୨/୨୦୨୧	୧୩.୦୭.୨୦୨୧
୯୭୦	୧୯୮୩/୨୦୨୧	୧୩.୦୭.୨୦୨୧
୯୭୧	୧୯୫୭/୨୦୨୧	୨୨.୦୭.୨୦୨୧
୯୭୨	୧୮୮୨/୨୦୨୧	୦୨.୦୮.୨୦୨୧
୯୭୩	୧୯୭୮/୨୦୨୧	୦୪.୦୮.୨୦୨୧
୯୭୪	୧୮୯୩/୨୦୨୦	୨୪.୦୮.୨୦୨୧
୯୭୫	୨୦୦୯/୨୦୨୧	୨୯.୦୯.୨୦୨୧
୯୭୬	୨୦୦୫/୨୦୨୧	୦୭.୧୦.୨୦୨୧
୯୭୭	୨୦୦୬/୨୦୨୧ & 1A ନଂ ୧୮/୨୦୨୧	୦୮.୧୦.୨୦୨୧
୯୭୮	୨୦୦୮/୨୦୨୧ & 1A ନଂ ୧୮/୨୦୨୧	୦୮.୧୦.୨୦୨୧
୯୭୯	୧୮୩୨/୨୦୧୯	୧୪.୧୦.୨୦୨୧
୯୮୦	୧୯୯୦/୨୦୨୧	୧୮.୧୦.୨୦୨୧
୯୮୧	୧୮୩୩/୨୦୧୯	୧୬.୧୧.୨୦୨୧
୯୮୨	୨୦୦୪/୨୦୨୧	୨୦.୧୧.୨୦୨୧
୯୮୩	୧୮୬୩/୨୦୧୯	୨୫.୧୧.୨୦୨୧

୯୯୪	୧୯୯୭/୨୦୨୧	୧୨.୧୨.୨୦୨୧
୯୯୫	୧୯୯୮/୨୦୨୧	୨୩.୧୨.୨୦୨୧
୯୯୬	୧୯୯୯/୨୦୨୧	୨୩.୧୨.୨୦୨୧
୯୯୭	୧୯୯୯/୨୦୨୦	୦୭.୦୧.୨୦୨୨
୯୯୮	୧୯୯୯/୨୦୨୧	୨୯.୦୧.୨୦୨୨
୯୯୯	୧୯୯୯/୨୦୨୧	୨୯.୦୧.୨୦୨୨
୧୦୦୦	୨୦୩୯/୨୦୨୧	୦୭.୦୨.୨୦୨୨
୧୦୦୧	୧୯୯୫/୨୦୨୧ & IA No. ୨୦/୨୦୨୧	୧୧.୦୨.୨୦୨୨
୧୦୦୨	୧୫୦୫/୨୦୧୫ & IAs No, ୨୩/୨୦୧୭ & ୦୫/୨୦୧୫	୦୨.୦୩.୨୦୨୨
୧୦୦୩	୧୨୦୪/୨୦୧୨	୦୨.୦୩.୨୦୨୨
୧୦୦୪	୨୦୪୯/୨୦୨୨	୨୪.୦୩.୨୦୨୨
୧୦୦୫	୨୦୫୭/୨୦୨୨	୦୪.୦୪.୨୦୨୨
୧୦୦୬	୧୯୦୯/୨୦୧୯	୨୧.୦୪.୨୦୨୨
୧୦୦୭	୧୯୫୨/୨୦୨୦	୨୫.୦୪.୨୦୨୨
୧୦୦୮	୨୦୨୭/୨୦୨୨ & IA No. ୧୩/୨୦୨୨	୨୯.୦୪.୨୦୨୨
୧୦୦୯	୧୯୩୦/୨୦୧୯	୦୪.୦୫.୨୦୨୨
୧୦୧୦	୧୯୩୧/୨୦୧୯	୦୪.୦୫.୨୦୨୨
୧୦୧୧	୧୯୩୨/୨୦୧୯	୦୪.୦୫.୨୦୨୨
୧୦୧୨	୧୯୨୨/୨୦୨୧	୦୯.୦୫.୨୦୨୨
୧୦୧୩	୧୯୦୧/୨୦୨୦	୧୦.୦୫.୨୦୨୨
୧୦୧୪	୧୯୦୨/୨୦୨୦	୧୧.୦୫.୨୦୨୨
୧୦୧୫	୧୯୧୫/୨୦୨୦	୧୧.୦୫.୨୦୨୨
୧୦୧୬	୧୯୪୩/୨୦୨୨	୧୨.୦୫.୨୦୨୨
୧୦୧୭	୧୯୫୩/୨୦୨୧	୧୨.୦୫.୨୦୨୨
୧୦୧୮	୧୯୯୪/୨୦୨୦	୧୨.୦୫.୨୦୨୨
୧୦୧୯	୨୦୨୯/୨୦୨୨	୧୯.୦୫.୨୦୨୨
୧୦୨୦	୨୦୫୧/୨୦୨୨	୨୦.୦୫.୨୦୨୨
୧୦୨୧	୨୦୨୨/୨୦୨୨	୨୦.୦୫.୨୦୨୨

૧૦૧૩	૨૦૬૮/૨૦૨૨	૩૦.૦૫.૨૦૨૨
૧૦૧૪	IA No.૧૦/૨૦૧૮ અનરજુસ્ટર્ડ પીટીશન અને તા: ૧૦/૦૫/૨૦૨૨ ન રોજ એફિડેવિટ સાથે પીટીશન દાખલ કરેલ હતી.	૩૦.૦૫.૨૦૨૨
૧૦૧૫	૧૯૭૨/૨૦૨૧	૧૦.૦૬.૨૦૨૧
૧૦૧૬	૧૯૪૨/૨૦૨૧ (૧ થી ૧૨૬)	૦૧.૦૪.૨૦૨૧
૧૦૧૭	૧૯૪૨/૨૦૨૧ (૧૨૭ થી ૨૭૨)	૦૧.૦૭.૨૦૨૧
૧૦૧૮	૧૯૬૮/૨૦૨૧	૦૪.૦૯.૨૦૨૧
૧૦૧૯	સુઓ મોટુ પીટીશન નં ૧૯૯૫/૨૦૨૧	૨૪.૦૯.૨૦૨૧
૧૦૨૦	IA No. ૩૩/૨૦૨૧ In પીટીશન નં ૧૯૭૩/૨૦૨૧	૧૪.૦૨.૨૦૨૨
૧૦૨૧	૨૦૨૮/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૨	૨૦૨૯/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૩	૨૦૩૦/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૪	૨૦૩૧/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૫	૨૦૩૨/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૬	૨૦૩૩/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૭	૨૦૩૪/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૮	૨૦૩૫/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૨૯	૨૦૩૬/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૩૦	૨૦૩૭/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૩૧	૨૦૪૦/૨૦૨૧	૩૧.૦૩.૨૦૨૨
૧૦૩૨	૨૦૪૫/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૨
૧૦૩૩	રિવ્યુ પિટિશન નં ૧૮૯૦/૨૦૨૦	૦૧.૦૬.૨૦૨૨
૧૦૩૪	આઇએ નં ૯/૨૦૨૦ માં પિટિશન નં ૧૪૦૧/૨૦૧૪	૦૧.૦૬.૨૦૨૨
૧૦૩૫	૧૯૩૧/૨૦૨૧	૦૪.૦૬.૨૦૨૨
૧૦૩૬	૧૮૮૧/૨૦૨૦	૨૭.૦૬.૨૦૨૨
૧૦૩૭	૨૧૦૨/૨૦૨૨	૩૦.૦૬.૨૦૨૨
૧૦૩૮	૧૯૨૧/૨૦૨૧	૦૪.૦૭.૨૦૨૨
૧૦૩૯	૧૯૧૮/૨૦૨૧	૦૪.૦૭.૨૦૨૨

૧૦૪૦	૧૯૧૭/૨૦૨૧	૦૪.૦૭.૨૦૨૨
૧૦૪૧	આઈએ નં ૦૩/૨૦૨૨ મં પિટિશન નં ૨૦૪૬/૨૦૨૨	૦૪.૦૭.૨૦૨૨
૧૦૪૨	૧૯૨૦/૨૦૨૧	૦૫.૦૭.૨૦૨૨
૧૦૪૩	૧૯૧૯/૨૦૨૧	૦૫.૦૭.૨૦૨૨
૧૦૪૪	૧૮૮૮/૨૦૨૦	૧૩.૦૭.૨૦૨૨
૧૦૪૫	૨૦૭૩/૨૦૨૨	૧૪.૦૭.૨૦૨૨
૧૦૪૬	લાઈસન્સ એપ્લિકેશન નં ૦૧/૨૦૨૧	૨૧.૦૭.૨૦૨૨
૧૦૪૭	૨૦૫૦/૨૦૨૧	૦૧.૦૮.૨૦૨૨
૧૦૪૮	૨૦૫૫/૨૦૨૨ & આઈએ નં ૦૭/૨૦૨૨	૦૬.૦૮.૨૦૨૨
૧૦૪૯	૧૯૫૧/૨૦૨૧	૧૦.૦૮.૨૦૨૨
૧૦૫૦	૧૯૫૦/૨૦૨૧	૧૦.૦૮.૨૦૨૨
૧૦૫૧	૨૧૩૪/૨૦૨૨	૧૨.૦૮.૨૦૨૨
૧૦૫૨	૨૧૨૬/૨૦૨૨	૨૨.૦૮.૨૦૨૨
૧૦૫૩	રિવ્યુ પિટિશન નં ૧૯૯૧/૨૦૨૧	૨૩.૦૮.૨૦૨૨
૧૦૫૪	૧૯૩૫/૨૦૨૧	૨૩.૦૮.૨૦૨૨
૧૦૫૫	૧૯૪૯/૨૦૨૧	૨૫.૦૮.૨૦૨૨
૧૦૫૬	૧૯૫૮/૨૦૨૧	૨૯.૦૮.૨૦૨૨
૧૦૫૭	૧૯૫૬/૨૦૨૧	૨૯.૦૮.૨૦૨૨
૧૦૫૮	૧૯૫૨/૨૦૨૧	૨૯.૦૮.૨૦૨૨
૧૦૫૯	૧૭૭૧/૨૦૧૮	૩૦.૦૮.૨૦૨૨
૧૦૬૦	૧૭૪૭/૨૦૧૮	૩૦.૦૮.૨૦૨૨
૧૦૬૧	૧૭૭૯/૨૦૧૯	૦૧.૦૯.૨૦૨૨
૧૦૬૨	૧૭૫૧/૨૦૧૮	૦૧.૦૯.૨૦૨૨
૧૦૬૩	૨૦૦૦/૨૦૨૧	૦૬.૦૯.૨૦૨૨
૧૦૬૪	૧૯૯૯/૨૦૨૧	૦૬.૦૯.૨૦૨૨
૧૦૬૫	૧૯૪૫/૨૦૨૧	૦૬.૦૯.૨૦૨૨
૧૦૬૬	૧૭૮૨/૨૦૧૯	૨૯.૦૯.૨૦૨૨
૧૦૬૭	૧૮૧૫/૨૦૧૯	૧૯.૧૦.૨૦૨૨
૧૦૬૮	સુઓ-મોટુ પિટિશન નં ૨૧૪૦/૨૦૨૨	૨૦.૧૦.૨૦૨૨

૧૦૬૯	૨૧૫૦/૨૦૨૨	૨૧.૧૦.૨૦૨૨
૧૦૭૦	૨૧૪૬/૨૦૨૨	૨૧.૧૦.૨૦૨૨
૧૦૭૧	૨૧૪૨/૨૦૨૨	૨૧.૧૦.૨૦૨૨
૧૦૭૨	૧૯૮૫/૨૦૨૧	૦૩.૧૧.૨૦૨૨
૧૦૭૩	૧૯૯૭/૨૦૨૦	૦૪.૧૧.૨૦૨૨
૧૦૭૪	૨૦૧૪/૨૦૨૧	૧૩.૧૨.૨૦૨૨
૧૦૭૫	૨૧૫૨/૨૦૨૨	૧૬.૧૨.૨૦૨૨
૧૦૭૬	૨૦૭૨/૨૦૨૨	૨૨.૧૨.૨૦૨૨
૧૦૭૭	૨૧૫૭/૨૦૨૨	૦૩.૦૧.૨૦૨૩
૧૦૭૮	૧૯૭૭/૨૦૨૧	૦૩.૦૧.૨૦૨૩
૧૦૭૯	૧૮૨૨/૨૦૧૯ સાથે આઈએ નં ૧૪/૨૦૧૯ & આઈએ નં ૦૩/૨૦૨૧	૦૩.૦૧.૨૦૨૩
૧૦૮૦	૧૫૧૧/૨૦૧૫	૦૫.૦૧.૨૦૨૩
૧૦૮૧	૧૫૨૬/૨૦૧૫	૦૫.૦૧.૨૦૨૩
૧૦૮૨	૧૬૫૭/૨૦૧૭	૦૫.૦૧.૨૦૨૩
૧૦૮૩	૨૧૨૭/૨૦૨૨	૧૭.૦૧.૨૦૨૩
૧૦૮૪	૧૭૯૫/૨૦૧૯	૧૭.૦૧.૨૦૨૩
૧૦૮૫	૧૭૯૬/૨૦૧૯	૧૭.૦૧.૨૦૨૩
૧૦૮૬	૧૭૯૭/૨૦૧૯	૧૭.૦૧.૨૦૨૩
૧૦૮૭	૧૭૯૮/૨૦૧૯	૧૭.૦૧.૨૦૨૩
૧૦૮૮	૧૭૯૯/૨૦૧૯	૧૭.૦૧.૨૦૨૩
૧૦૮૯	આઈએ નં ૧૯/૨૦૧૮ માં પિટિશન નં ૧૬૮૦/૨૦૧૭	૨૪.૦૧.૨૦૨૩
૧૦૯૦	આઈએ નં ૧૦/૨૦૧૮ માં અનરજીસ્ટર્ડ પિટિશન ઓફ ૨૦૧૮	૨૪.૦૧.૨૦૨૩
૧૦૯૧	૧૮૬૪/૨૦૨૦ & આઈએ નં ૦૨/૨૦૨૧	૦૪.૦૨.૨૦૨૩
૧૦૯૨	૨૧૮૩/૨૦૨૩	૧૭.૦૨.૨૦૨૩
૧૦૯૩	૧૭૬૯/૨૦૧૮	૨૦.૦૨.૨૦૨૩
૧૦૯૪	૨૦૧૫/૨૦૨૧	૦૧.૦૩.૨૦૨૩
૧૦૯૫	૨૧૪૫/૨૦૨૨ & આઈએ નં ૨૬/૨૦૨૨	૦૪.૦૩.૨૦૨૩

૧૦૯૬	૨૧૩૩/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૩
૧૦૯૭	૨૧૩૯/૨૦૨૨ & આઈએ નં ૦૧/૨૦૨૩	૦૭.૦૩.૨૦૨૩
૧૦૯૮	સુઓ મોટો પિટિશન નં ૨૧૭૧/૨૦૨૩	૦૭.૦૩.૨૦૨૩
૧૦૯૯	૨૧૯૫/૨૦૨૩	૧૬.૦૩.૨૦૨૩
૧૧૦૦	૨૧૨૮/૨૦૨૨	૧૭.૦૩.૨૦૨૩
૧૧૦૧	૧૮૬૬/૨૦૨૦	૧૮.૦૩.૨૦૨૩
૧૧૦૨	૨૦૯૩/૨૦૨૨	૨૧.૦૩.૨૦૨૩
૧૧૦૩	૧૬૧૮/૨૦૧૬	૨૩.૦૩.૨૦૨૩
૧૧૦૪	૨૧૮૯/૨૦૨૩	૨૪.૦૩.૨૦૨૩
૧૧૦૫	૧૭૬૫/૨૦૧૮	૦૧.૦૪.૨૦૨૩
૧૧૦૬	આઈએ નં ૨૭/૨૦૨૩ માં પિટિશન નં ૨૨૦૬/૨૦૨૩	૨૯.૦૪.૨૦૨૩
૧૧૦૭	૧૦૦૨/૨૦૧૦ & આઈએ નં ૧૫/૨૦૨૨ & આઈએ નં ૦૬/૨૦૨૩	૦૫.૦૫.૨૦૨૩
૧૧૦૮	૧૭૩૦/૨૦૧૮	૦૫.૦૫.૨૦૨૩
૧૧૦૯	રિવ્યુ પિટિશન નં ૧૭૦૪/૨૦૧૮	૦૫.૦૫.૨૦૨૩
૧૧૧૦	૨૨૦૪/૨૦૨૩	૧૯.૦૫.૨૦૨૩
૧૧૧૧	૨૨૦૭/૨૦૨૩	૩૧.૦૫.૨૦૨૩
૧૧૧૨	૧૮૬૬/૨૦૨૦ અને આઈએ નં ૦૧/ ૨૦૨૧	૧૮.૦૩.૨૦૨૨
૧૧૧૩	૨૧૬૨/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૧૪	૨૧૬૩/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૧૫	૨૧૬૪/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૧૬	૨૧૬૫/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૧૭	૨૧૬૬/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૧૮	૨૧૬૭/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૧૯	૨૧૬૮/૨૦૨૦	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૦	૨૧૬૯/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૧	૨૧૭૦/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૨	૨૧૭૭/૨૦૨૩	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૩	૨૧૭૮/૨૦૨૩	૩૧.૦૩.૨૦૨૩

૧૧૨૪	૨૧૭૯/૨૦૨૩	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૫	૨૧૮૦/૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૬	૨૧૮૧/૨૦૨૩	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૭	૨૧૮૪/૨૦૨૩	૩૧.૦૩.૨૦૨૩
૧૧૨૮	૧૭૪૧/૨૦૧૮	૧૫.૦૬.૨૦૨૩
૧૧૨૯	૧૮૦૧/૨૦૧૯	૧૫.૦૬.૨૦૨૩
૧૧૩૦	૧૬૦૧/૨૦૧૬	૧૦.૦૭.૨૦૨૩
૧૧૩૧	૧૪૨૦/૨૦૧૪ સાથે આઈએ	૧૦.૦૭.૨૦૨૩
૧૧૩૨	૧૯૪૮/૨૦૨૧	૧૭.૦૭.૨૦૨૩
૧૧૩૩	૨૦૧૩/૨૦૨૧	૧૯.૦૭.૨૦૨૩
૧૧૩૪	૨૨૨૪/૨૦૨૩	૩૧.૦૭.૨૦૨૩
૧૧૩૫	૨૨૨૭/૨૦૨૩	૩૧.૦૭.૨૦૨૩
૧૧૩૬	૨૨૧૭/૨૦૨૧	૩૧.૦૭.૨૦૨૩
૧૧૩૭	૨૨૨૬/૨૦૨૩	૦૩.૦૮.૨૦૨૩
૧૧૩૮	૧૮૧૭/૨૦૧૯ અને સાથે આઈએ	૦૩.૦૮.૨૦૨૩
૧૧૩૯	૧૭૩૮/૨૦૧૮	૧૦.૦૮.૨૦૨૩
૧૧૪૦	૧૭૩૯/૨૦૧૮	૦૩.૦૮.૨૦૨૩
૧૧૪૧	૧૭૪૯/૨૦૧૮	૧૦.૦૮.૨૦૨૩
૧૧૪૨	૨૨૪૨/૨૦૨૩	૦૩.૦૮.૨૦૨૩
૧૧૪૩	૨૨૫૦/૨૦૨૩	૧૦.૦૮.૨૦૨૩
૧૧૪૪	૧૮૨૦/૨૦૧૯	૦૩.૦૮.૨૦૨૩
૧૧૪૫	એપ્લિકેશન / પીટીશન નં. ૨૧૨૫/૨૦૨૨	૧૦.૦૮.૨૦૨૩
૧૧૪૬	૨૧૦૮/૨૦૨૨	૦૩.૦૮.૨૦૨૩
૧૧૪૭	૨૧૦૯/૨૦૨૨	૧૦.૦૮.૨૦૨૩
૧૧૪૮	૨૧૧૦/૨૦૨૨	૦૩.૦૮.૨૦૨૩
૧૧૪૯	૨૧૧૧/૨૦૨૨	૧૦.૦૮.૨૦૨૩
૧૧૫૦	૨૧૧૨/૨૦૨૨	૦૩.૦૮.૨૦૨૩
૧૧૫૧	૨૧૧૩/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૫૨	૨૧૧૪/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩

૧૧૫૩	૨૧૧૫/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૫૪	૨૧૧૬/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૫૫	૨૧૧૭/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૫૬	૨૧૧૮/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૫૭	૨૧૧૯/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૫૮	૨૧૨૦/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૫૯	૨૧૨૧/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૬૦	૨૧૨૨/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૬૧	૨૧૨૩/૨૦૨૨	૧૦.૧૦.૨૦૨૩
૧૧૬૨	૧૮૧૪/૨૦૧૯ અને આઈએ નં.૬/૨૦૨૦	૧૦.૧૦.૨૦૨૩
૧૧૬૩	૧૯૪૧/૨૦૨૧	૧૨.૧૦.૨૦૨૩
૧૧૬૪	૨૨૧૩/૨૦૨૩	૧૬.૧૦.૨૦૨૩
૧૧૬૫	સુઓ મોટો પીટીશન નં.૨૨૬૪/૨૦૨૩	૦૫.૧૨.૨૦૨૩
૧૧૬૬	૨૧૩૮/૨૦૨૨ અને આઈએ નં.૦૯/૨૦૨૩	૦૬.૧૨.૨૦૨૩
૧૧૬૭	૨૨૫૨/૨૦૨૩	૨૦.૧૨.૨૦૨૩
૧૧૬૮	૨૨૫૩/૨૦૨૩	૨૦.૧૨.૨૦૨૩
૧૧૬૯	૨૨૫૪/૨૦૨૩	૨૦.૧૨.૨૦૨૩
૧૧૭૦	૨૨૫૫/૨૦૨૩	૨૦.૧૨.૨૦૨૩
૧૧૭૧	૨૨૦૮/૨૦૨૩	૨૨.૧૨.૨૦૨૩
૧૧૭૨	૨૨૪૦/૨૦૨૩	૨૯.૧૨.૨૦૨૩
૧૧૭૩	૨૨૦૬/૨૦૨૩	૨૯.૧૨.૨૦૨૩
૧૧૭૪	૧૮૫૨/૨૦૨૦ અને આઈએ નં.૨૭/૨૦૨૧	૦૬.૦૨.૨૦૨૪
૧૧૭૫	૨૨૬૩/૨૦૨૪	૦૯.૦૨.૨૦૨૪
૧૧૭૬	૧૪૨૯/૨૦૧૪	૧૫.૦૨.૨૦૨૪
૧૧૭૭	૧૪૦૧/૨૦૧૪	૧૫.૦૨.૨૦૨૪
૧૧૭૮	૨૨૭૪/૨૦૨૩	૧૫.૦૨.૨૦૨૪
૧૧૭૯	૨૨૭૫/૨૦૨૩	૧૫.૦૨.૨૦૨૪
૧૧૮૦	૨૨૭૬/૨૦૨૩	૧૫.૦૨.૨૦૨૪
૧૧૮૧	૨૨૭૭/૨૦૨૩	૧૫.૦૨.૨૦૨૪

૧૧૮૨	૨૧૯૯/૨૦૨૪	૧૫.૦૨.૨૦૨૪
૧૧૮૩	૨૩૩૩/૨૦૨૪	૨૩.૦૨.૨૦૨૪
૧૧૮૪	૨૩૧૨/૨૦૨૪	૨૩.૦૨.૨૦૨૪
૧૧૮૫	૨૨૪૮/૨૦૨૩ અને આઈએ નં.૩૬/૨૦૨૩	૨૩.૦૨.૨૦૨૪
૧૧૮૬	૨૦૭૪/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૮૭	૨૦૭૫/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૮૮	૨૦૭૬/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૮૯	૨૦૭૭/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૦	૨૨૭૮/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૧	૨૨૭૯/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૨	૨૨૮૦/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૩	૨૨૮૧/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૪	૨૨૮૨/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૫	૨૨૮૩/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૬	૨૨૮૪/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૭	૨૨૮૫/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૮	૨૨૮૬/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૧૯૯	૨૨૮૭/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૦	૨૨૮૮/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૧	૨૨૮૯/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૨	૨૨૯૧/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૩	૨૨૯૨/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૪	૨૨૯૩/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૫	૨૨૯૪/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૬	૨૨૯૫/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૭	૨૨૯૬/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૮	૨૨૯૭/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૦૯	૨૨૯૮/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૦	૨૨૯૯/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪

૧૨૧૧	૨૩૦૦/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૨	૨૩૦૧/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૩	૨૩૦૨/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૪	૨૩૦૩/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૫	૨૩૦૪/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૬	૨૩૦૫/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૭	૨૩૦૬/૨૦૨૩	૦૬.૦૩.૨૦૨૪
૧૨૧૮	૨૩૩૯/૨૦૨૪	૧૪.૦૩.૨૦૨૪
૧૨૧૯	૨૩૩૭/૨૦૨૪	૨૭.૦૩.૨૦૨૪
૧૨૨૦	૨૨૬૮/૨૦૨૩	૨૭.૦૩.૨૦૨૪
૧૨૨૧	૨૩૩૬/૨૦૨૪	૨૭.૦૩.૨૦૨૪
૧૨૨૨	રીવ્યુ પીટીશન નં.૦૧/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૦૮/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૨૩	રીવ્યુ પીટીશન નં.૦૨/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૦૯/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૨૪	રીવ્યુ પીટીશન નં.૦૩/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૦/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૨૫	રીવ્યુ પીટીશન નં.૦૪/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૧/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૨૬	રીવ્યુ પીટીશન નં.૦૫/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૨/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૨૭	રીવ્યુ પીટીશન નં.૦૬/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૩/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૨૮	રીવ્યુ પીટીશન નં.૦૭/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૪/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૨૯	રીવ્યુ પીટીશન નં.૦૮/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૫/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૦	રીવ્યુ પીટીશન નં.૦૯/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૬/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪

૧૨૩૧	રીવ્યુ પીટીશન નં.૧૦/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૭/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૨	રીવ્યુ પીટીશન નં.૧૧/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૮/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૩	રીવ્યુ પીટીશન નં.૧૨/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૧૯/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૪	રીવ્યુ પીટીશન નં.૧૩/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૨૦/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૫	રીવ્યુ પીટીશન નં.૧૪/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૨૧/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૬	રીવ્યુ પીટીશન નં.૧૫/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૨૨/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૭	રીવ્યુ પીટીશન નં.૧૬/૨૦૨૩ માં પીટીશન નં.૨૧૨૩/૨૦૨૨	૦૬.૦૩.૨૦૨૪
૧૨૩૮	૨૩૩૯/૨૦૨૪	૧૪.૦૩.૨૦૨૪
૧૨૩૯	૨૩૩૭/૨૦૨૪	૨૭.૦૩.૨૦૨૪
૧૨૪૦	૨૨૬૮/૨૦૨૩	૨૮.૦૩.૨૦૨૪
૧૨૪૧	૨૩૩૬/૨૦૨૪	૨૮.૦૩.૨૦૨૪
૧૨૪૨	૨૧૩૦/૨૦૨૨	૧૭.૦૫.૨૦૨૪
૧૨૪૩	૧૬૭૫/૨૦૧૭	૧૭.૦૫.૨૦૨૪
૧૨૪૪	૧૯૬૦/૨૦૨૧	૨૪.૦૫.૨૦૨૪
૧૨૪૫	૨૨૨૧/૨૦૨૩	૨૭.૦૫.૨૦૨૪
૧૨૪૬	૧૪૫૬/૨૦૧૪ અને આઈએ. નં.૯/૨૦૧૪ અને ૧૩/૨૦૧૯	૨૯.૦૫.૨૦૨૪
૧૨૪૭	૧૪૮૦/૨૦૧૫	૩૧.૦૫.૨૦૨૪
૧૨૪૮	૨૩૧૫/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૪૯	૨૩૧૬/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૦	૨૩૧૭/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪

૧૨૫૧	૨૩૧૮/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૨	૨૩૧૯/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૩	૨૩૨૦/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૪	૨૩૨૧/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૫	૨૩૨૨/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૬	૨૩૨૩/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૭	૨૩૨૪/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૮	૨૩૨૫/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૫૯	૨૩૨૬/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૬૦	૨૩૨૭/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૬૧	૨૩૨૮/૨૦૨૪	૦૧.૦૬.૨૦૨૪
૧૨૬૨	૨૩૪૩/૨૦૨૪ અને આઈએ. નં.૧૩/૨૦૨૪	૧૦.૦૬.૨૦૨૪
૧૨૬૩	૨૩૪૪/૨૦૨૪	૧૦.૦૬.૨૦૨૪
૧૨૬૪	૨૦૩૯/૨૦૨૧	૧૨.૦૬.૨૦૨૪
૧૨૬૫	૨૦૭૧/૨૦૨૨	૧૨.૦૬.૨૦૨૪
૧૨૬૬	૨૨૩૨/૨૦૨૩	૧૨.૦૬.૨૦૨૪
૧૨૬૭	૨૨૩૩/૨૦૨૩	૧૨.૦૬.૨૦૨૪
૧૨૬૮	૨૨૩૪/૨૦૨૩	૧૨.૦૬.૨૦૨૪
૧૨૬૯	૨૨૩૫/૨૦૨૩	૧૨.૦૬.૨૦૨૪
૧૨૭૦	૨૨૩૬/૨૦૨૩	૧૨.૦૬.૨૦૨૪
૧૨૭૧	૨૧૮૫/૨૦૨૩	૧૩.૦૬.૨૦૨૪
૧૨૭૨	૨૩૪૫/૨૦૨૪	૧૪.૦૬.૨૦૨૪
૧૨૭૩	૨૩૪૬/૨૦૨૪	૧૪.૦૬.૨૦૨૪
૧૨૭૪	૨૨૧૮/૨૦૨૩ અને આઈએ નં.૧૮/૨૦૨૪	૨૪.૦૬.૨૦૨૪
૧૨૭૫	૨૧૯૦/૨૦૨૩	૨૫.૦૬.૨૦૨૪

૧૨૭૬	૨૨૧૧/૨૦૨૩	૨૫.૦૬.૨૦૨૪
૧૨૭૭	૨૩૪૭/૨૦૨૪	૨૫.૦૬.૨૦૨૪
૧૨૭૮	૧૭૮૮/૨૦૧૯	૨૮.૦૬.૨૦૨૪
૧૨૭૯	૧૭૮૯/૨૦૧૯	૨૮.૦૬.૨૦૨૪
૧૨૮૦	૨૩૩૪/૨૦૨૪	૦૨.૦૭.૨૦૨૪
૧૨૮૧	૨૩૬૧/૨૦૨૪	૦૩.૦૭.૨૦૨૪
૧૨૮૨	૨૧૭૬/૨૦૨૩	૦૪.૦૭.૨૦૨૪
૧૨૮૩	૨૨૭૯/૨૦૨૩	૦૬.૦૭.૨૦૨૪
૧૨૮૪	૨૩૬૩/૨૦૨૪	૩૦.૦૮.૨૦૨૪
૧૨૮૫	૨૨૧૦/૨૦૨૩	૩૧.૦૮.૨૦૨૪
૧૨૮૬	૨૩૪૮/૨૦૨૪	૦૨.૦૯.૨૦૨૪
૧૨૮૭	૨૩૬૦/૨૦૨૪	૦૨.૦૯.૨૦૨૪
૧૨૮૮	૨૩૬૬/૨૦૨૪	૦૩.૦૯.૨૦૨૪
૧૨૮૯	૧૮૮૯/૨૦૨૦ અને આઈ.એ નં.૩૧/૨૦૨૩	૦૪.૦૯.૨૦૨૪
૧૨૯૦	૨૨૫૧/૨૦૨૩	૦૪.૦૯.૨૦૨૪
૧૨૯૧	૨૧૩૧/૨૦૨૨ સાથે આઈ.એ. નં.૧૮/૨૦૨૨	૧૧.૦૯.૨૦૨૪
૧૨૯૨	૨૩૭૭/૨૦૨૪	૨૧.૦૯.૨૦૨૪
૧૨૯૩	૨૩૮૦/૨૦૨૪	૨૧.૦૯.૨૦૨૪
૧૨૯૪	૨૦૫૬/૨૦૨૨	૨૩.૦૯.૨૦૨૪
૧૨૯૫	૨૩૬૪/૨૦૨૪	૨૩.૦૯.૨૦૨૪
૧૨૯૬	૨૩૭૪/૨૦૨૪	૨૩.૦૯.૨૦૨૪
૧૨૯૭	૨૩૭૮/૨૦૨૪	૨૩.૦૯.૨૦૨૪
૧૨૯૮	૨૩૮૭/૨૦૨૪	૨૩.૦૯.૨૦૨૪
૧૨૯૯	૧૭૬૪/૨૦૧૮	૨૫.૦૯.૨૦૨૪
૧૩૦૦	૨૦૧૮/૨૦૨૧	૨૫.૦૯.૨૦૨૪

૧૩૦૧	૨૨૨૫/૨૦૨૩	૨૫.૦૯.૨૦૨૪
૧૩૦૨	૨૨૯૦/૨૦૨૩	૨૫.૦૯.૨૦૨૪
૧૩૦૩	૨૩૩૨/૨૦૨૪	૨૫.૦૯.૨૦૨૪
૧૩૦૪	૨૨૩૮/૨૦૨૩ સાથે આઈ.એ. નં.૯/૨૦૨૪	૨૫.૦૯.૨૦૨૪
૧૩૦૫	૨૩૮૪/૨૦૨૪	૩૦.૦૯.૨૦૨૪
૧૩૦૬	૨૩૮૬/૨૦૨૪	૩૦.૦૯.૨૦૨૪
૧૩૦૭	૨૩૯૦/૨૦૨૪	૩૦.૦૯.૨૦૨૪
૧૩૦૮	૨૩૫૫/૨૦૨૪	૨૯.૧૦.૨૦૨૪
૧૩૦૯	૨૨૮૯/૨૦૨૩	૦૩.૧૨.૨૦૨૪
૧૩૧૦	૨૩૫૬/૨૦૨૪	૦૬.૧૨.૨૦૨૪
૧૩૧૧	૨૩૩૧/૨૦૨૩	૦૯.૧૨.૨૦૨૪
૧૩૧૨	પીટીશન નં. ૧૪૮૯/૨૦૧૫ માં આઈ.એ. નં.૦૪/૨૦૧૬ માં ૧૪૮૯/૨૦૧૫ અને આઈ.એ. નં. ૧૫/૨૦૧૯	૧૭.૧૨.૨૦૨૪
૧૩૧૩	૧૮૮૩/૨૦૨૦ સાથે આઈ.એ.	૧૭.૧૨.૨૦૨૪
૧૩૧૪	૧૯૮૦/૨૦૨૧	૧૭.૧૨.૨૦૨૪
૧૩૧૫	૨૩૮૩/૨૦૨૪	૩૧.૧૨.૨૦૨૪
૧૩૧૬	૨૪૦૨/૨૦૨૫	૦૨.૦૧.૨૦૨૫
૧૩૧૭	પીટીશન નં. ૧૮૧૭/૨૦૧૯ માં રિવ્યુ પિટિશન નં. ૧૭/૨૦૨૩	૦૩.૦૧.૨૦૨૫
૧૩૧૮	૨૨૬૭/૨૦૨૩	૨૭.૦૧.૨૦૨૫
૧૩૧૯	૨૩૩૮/૨૦૨૪	૨૭.૦૧.૨૦૨૫
૧૩૨૦	૨૪૪૬/૨૦૨૫	૨૪.૦૨.૨૦૨૫
૧૩૨૧	૨૦૯૭/૨૦૨૨	૧૭.૦૩.૨૦૨૫
૧૩૨૨	૨૨૦૫/૨૦૨૩	૧૭.૦૩.૨૦૨૫
૧૩૨૩	૨૨૨૨/૨૦૨૩	૧૭.૦૩.૨૦૨૫

၅၃၃၄	၃၃၅၃/၃၀၃၃	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၅	၃၃၅၆/၃၀၃၃	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၆	၃၄၅၆/၃၀၃၄	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၇	၃၄၃၀/၃၀၃၄	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၈	၃၄၃၄/၃၀၃၄	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၉	၃၄၃၅/၃၀၃၄	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၀	၃၄၃၇/၃၀၃၄	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၁	၃၄၃၆/၃၀၃၄	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၂	၃၄၃၀/၃၀၃၄	၃၆.၀၃.၃၀၃၄
၅၃၃၃	၃၃၅၆/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၃၄	၃၃၇၀/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၃၅	၃၄၅၆/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၃၆	၃၄၃၅/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၃၇	၃၄၃၃/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၃၈	၃၄၃၄/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၃၉	၃၄၃၃/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၄၀	၃၄၃၅/၃၀၃၄	၃၅.၀၃.၃၀၃၄
၅၃၄၁	၃၃၇၅/၃၀၃၄	၀၃.၀၄.၃၀၃၄
၅၃၄၂	၃၃၆၆/၃၀၃၄	၀၄.၀၄.၃၀၃၄
၅၃၄၃	၃၃၆၆/၃၀၃၄	၀၄.၀၄.၃၀၃၄
၅၃၄၄	၃၄၀၇/၃၀၃၄	၀၅.၀၄.၃၀၃၄
၅၃၄၅	၃၄၀၆/၃၀၃၄	၀၆.၀၄.၃၀၃၄
၅၃၄၆	၃၄၄၀/၃၀၃၄	၃၃.၀၄.၃၀၃၄
၅၃၄၇	၃၃၄၇/၃၀၃၃	၀၅.၀၄.၃၀၃၄
၅၃၄၈	၃၄၄၆/၃၀၃၄	၀၅.၀၄.၃၀၃၄

૧૩૪૯	૨૪૬૪/૨૦૨૫	૦૬.૦૫.૨૦૨૫
૧૩૫૦	૨૨૨૦/૨૦૨૩	૦૯.૦૫.૨૦૨૫
૧૩૫૧	૨૪૦૩/૨૦૨૪	૦૯.૦૫.૨૦૨૫
૧૩૫૨	૧૮૬૯/૨૦૨૦	૧૨.૦૫.૨૦૨૫
૧૩૫૩	૧૮૭૦/૨૦૨૦	૧૨.૦૫.૨૦૨૫
૧૩૫૪	૧૮૭૧/૨૦૨૦	૧૨.૦૫.૨૦૨૫
૧૩૫૫	૨૧૯૪/૨૦૨૩	૨૩.૦૫.૨૦૨૫
૧૩૫૬	૧૯૨૯/૨૦૨૧	૨૬.૦૫.૨૦૨૫
૧૩૫૭	રિવ્યુ પીટીશન નં.૧૮૮૬/૨૦૨૦	૩૦.૦૫.૨૦૨૫
૧૩૫૮	સુઓ મોટુ પીટીશન નં.૨૪૮૫/૨૦૨૫	૩૦.૦૫.૨૦૨૫

Sr.No.	License Application	Date of Order
૧	LA/૧/૨૦૦૭	૦૭/૦૩/૨૦૧૦
૨	LA/૨/૨૦૦૮	૦૫/૦૫/૨૦૦૯
૩	LA/૩/૨૦૦૮	૧૭/૧૧/૨૦૦૯
૪	LA/૪/૨૦૦૮	૧૬/૧૨/૨૦૦૯
૫	LA/૫/૨૦૦૮	૧૭/૧૧/૨૦૦૯
૬	LA/૬/૨૦૦૮	૧૭/૦૪/૨૦૧૦
૭	LA/1 of ૨૦૧૨	૦૬/૦૩/૨૦૧૩
૮	LA/1 of ૨૦૧૮	૧૪/૦૮/૨૦૧૮

Sr.No.	Misc. Application	Date of Order
૧	૧/૨૦૦૯	૦૮/૦૫/૨૦૦૯
૨	૨/૨૦૦૯	૦૮/૦૫/૨૦૦૯
૩	૩/૨૦૦૯	૦૮/૦૫/૨૦૦૯
૪	૪/૨૦૦૯	૧૭/૦૩/૨૦૦૯
૫	૫/૨૦૦૯	૧૭/૦૩/૨૦૦૯
૬	૬/૨૦૦૯	૨૦/૦૪/૨૦૦૯

୭	୭/୨୦୦୯	୦୮/୦୪/୨୦୦୯
୮	୮/୨୦୦୯	୦୮/୦୪/୨୦୦୯
୯	୯/୨୦୦୯	୦୮/୦୪/୨୦୦୯
୧୦	୧୦/୨୦୦୯	୦୨/୦୯/୨୦୦୯
୧୧	୧୧/୨୦୦୯	୧୧/୧୧/୨୦୧୦
୧୨	୧୨/୨୦୧୦	୧୧/୧୧/୨୦୧୦
୧୩	୧୩/୨୦୧୦	୧୧/୧୧/୨୦୧୦
୧୪	୧୪/୨୦୧୦	୨୩/୧୨/୨୦୧୦
୧୫	୧୫/୨୦୧୨	୧୨/୦୩/୨୦୧୨
୧୬	୧/୨୦୧୩	୨୩/୧୨/୨୦୧୩
୧୭	୨/୨୦୧୪	୦୪/୦୩/୨୦୧୪
୧୮	୩/୨୦୧୭	୨୫/୦୭/୨୦୧୭
୧୯	୨/୨୦୧୯	୨୫/୦୯/୨୦୧୯
୨୦	୧/୨୦୨୦	୧୬/୦୩/୨୦୨୦
୨୧	୨/୨୦୨୦	୩୦/୦୪/୨୦୨୦
୨୨	୩/୨୦୨୦	୦୮/୦୪/୨୦୨୦
୨୩	୪/୨୦୨୦	୨୬/୦୪/୨୦୨୦
୨୪	୦୩/୨୦୨୨	୨୨/୦୯/୨୦୨୨
୨୫	୦୨/୨୦୨୩	୨୯/୦୩/୨୦୨୩
୨୬	୦୧/୨୦୨୩	୦୫/୦୪/୨୦୨୩

Sr.No.	Appeal No.	Date of Order
୧	୧/୨୦୦୩	୨୨/୦୨/୨୦୦୬
୨	୨/୨୦୦୩	୧୪/୧୨/୨୦୦୫
୩	୩/୨୦୦୩	୧୪/୧୨/୨୦୦୫
୪	୪/୨୦୦୩	୦୭/୦୩/୨୦୦୫
୫	୫/୨୦୦୩	୩୦/୦୯/୨୦୦୫
୬	୮/୨୦୦୩	୨୦/୧୦/୨୦୦୫
୭	୯/୨୦୦୩	୧୪/୦୩/୨୦୦୫

୯	୧୦/୨୦୦୩	୨୦/୧୨/୨୦୦୪
୧୦	୧୧/୨୦୦୩	୧୪/୦୩/୨୦୦୪
୧୧	୧୩/୨୦୦୪	୨୨/୦୩/୨୦୦୪
୧୨	୧୪/୨୦୦୪	୨୨/୦୩/୨୦୦୪
୧୩	୧୫/୨୦୦୪	୨୨/୦୩/୨୦୦୪
୧୪	୧୬/୨୦୦୪	୨୫/୦୭/୨୦୦୪
୧୫	୧୭/୨୦୦୪	୨୩/୦୩/୨୦୦୪
୧୬	୧୮/୨୦୦୪	୦୧/୦୧/୨୦୦୫
୧୭	୧୯/୨୦୦୪	୨୭/୦୫/୨୦୦୫
୧୮	୨୦/୨୦୦୪	୦୨/୦୮/୨୦୦୫
୧୯	୨୧/୨୦୦୪	୨୦/୧୨/୨୦୦୪
୨୦	୨୨/୨୦୦୪	୦୪/୦୫/୨୦୦୫
୨୧	୨୩/୨୦୦୪	୨୧/୦୪/୨୦୦୫
୨୨	୨୪/୨୦୦୪	୧୦/୧୦/୨୦୦୫
୨୩	୨୫/୨୦୦୪	୨୭/୦୫/୨୦୦୫
୨୪	୨୬/୨୦୦୪	୨୧/୦୪/୨୦୦୫
୨୫	୨୭/୨୦୦୪	୦୧/୦୧/୨୦୦୫
୨୬	୨୮/୨୦୦୪	୦୧/୦୧/୨୦୦୫
୨୭	୨୯/୨୦୦୪	୦୧/୦୧/୨୦୦୫
୨୮	୩୦/୨୦୦୪	୦୪/୧୦/୨୦୦୪
୨୯	୩୧/୨୦୦୪	୨୧/୦୭/୨୦୦୫
୩୦	୩୨/୨୦୦୪	୩୧/୦୪/୨୦୦୫
୩୧	୩୩/୨୦୦୪	୨୧/୦୫/୨୦୦୫
୩୨	୩୪/୨୦୦୪	୦୧/୦୧/୨୦୦୫
୩୩	୩୫/୨୦୦୪	୧୫/୦୨/୨୦୦୫
୩୪	୩୬/୨୦୦୪	୨୧/୦୫/୨୦୦୫
୩୫	୩୭/୨୦୦୪	୧୧/୦୮/୨୦୦୫
୩୬	୩୮/୨୦୦୪	୧୧/୧୧/୨୦୦୪
୩୭	୩୯/୨୦୦୪	୩୦/୦୪/୨୦୦୫

39	80/2004	04/05/2005
36	81/2004	26/04/2005
36	82/2004	31/04/2005
80	83/2004	30/04/2005
81	88/2004	30/04/2005
82	84/2004	02/06/2005
83	85/2004	02/06/2005
88	89/2004	01/03/2005
84	86/2004	01/03/2005
85	86/2004	20/05/2005
89	40/2004	31/09/2005
86	41/2004	11/09/2005
86	42/2004	04/09/2005
40	43/2004	31/09/2005
41	48/2004	25/05/2005
42	44/2004	31/09/2005
43	45/2004	09/06/2005
48	49/2005	26/09/2005
44	46/2005	28/11/2005
45	46/2005	19/11/2005
49	50/2005	12/03/2006
46	51/2006	25/03/2006
46	52/2006	16/11/2006
50	53/2006	08/12/2006
51	58/2006	30/08/2010

આયોગ દ્વારા પ્રસિધ્ધ કરેલ વિનિયમો/આદેશો

ક્રમ નં	વિનિયમ/આદેશનું નામ	જાહેરનામા નં	જાહેરનામા તારીખ
૧	ગુજરાત રાજ્ય માટે વિન્ડ ટર્બાઇન જનરેટરોના ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ અને અન્ય વાણિજ્યિક મુદ્દાઓ દ્વારા વીજળીની પ્રાપ્તિ માટે ટેરિફ ફ્રેમવર્ક/	૦૨/૨૦૨૦	૩૦/૦૪/૨૦૨૦
૨	ગુજરાત રાજ્ય માટે સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ અને અન્ય વાણિજ્યિક પ્રશ્નોના વિતરણ લાઇસન્સ દ્વારા અને અન્ય લોકો દ્વારા વીજ સંપાદન માટે ટેરિફ ફ્રેમવર્ક	૦૩/૨૦૨૦	૦૮/૦૫/૨૦૨૦
૩	સ્પર્ધાત્મક બિડિંગમાં ભાગ લેવા માટેની લાયકાતની શ્રેણીમાં મર્યાદાથી નીચે વિન્ડ પાવર પ્રોજેક્ટ્સમાંથી વીજળી પ્રાપ્તિ માટેના ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ માટે ટેરિફ નક્કી કરવા માટે/	૦૪/૨૦૨૦	૨૬/૦૫/૨૦૨૦
૪	ઓપન એક્સેસ ગ્રાહકો દ્વારા ૧ એપ્રિલ, ૨૦૨૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી ભરવાપાત્ર એડિશનલ સરચાર્જ	૧/૨૦૨૦	૧૬/૦૩/૨૦૨૦
૫	ઓપન એક્સેસ ગ્રાહકો દ્વારા ૧ ઓક્ટોબર, ૨૦૨૦ થી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી ભરવાપાત્ર એડિશનલ સરચાર્જ	૫/૨૦૨૦	૨૨/૦૭/૨૦૨૦
૬	ઓપન એક્સેસ ગ્રાહકો દ્વારા ૧ એપ્રિલ, ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦૧ સુધી ભરવાપાત્ર એડિશનલ સરચાર્જ	૧/૨૦૨૧	૧૩/૦૩/૨૦૨૦
૭	તા: ૨૦.૦૫.૨૦૨૦, ઓર્ડર નંબર ૩/૨૦૨૦ થી ગુજરાત રાજ્ય માટે સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ અને અન્ય વાણિજ્યિક પ્રશ્નોના વિતરણ લાઇસન્સ અને અન્ય દ્વારા વીજ ખરીદી માટે ટેરિફ માળખા માટે..	સુઓ-મોટો ઓર્ડર નં ૦૬/૨૦૨૦	૦૫/૦૮/૨૦૨૦
૮	વિતરણ લાઇસન્સ દ્વારા પાવરની પ્રાપ્તિ માટે પાવર-સોલર હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સ અને ગુજરાત રાજ્ય માટે અન્ય વ્યાપારી મુદ્દાઓ દ્વારા	૦૪/૨૦૨૧	૦૩/૦૪/૨૦૨૧

	પાવરની પ્રાપ્તિ માટે ટેરિફ ફેમવર્ક.		
૯	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા (નવીનીકરણપાત્ર સંશાધનોમાંથી વીજળી પ્રાપ્તિ) વિનિયમો-૨૦૨૨	૦૧/૨૦૨૨	૦૮/૦૪/૨૦૨૨
૧૦	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા (નેટ મીટરીંગ રૂફટોપ સોલાર પી. વી ગ્રિડ ઇન્ટરએક્ટિવ સિસ્ટમ) (ત્રીજો સુધારો) વિનિયમો-૨૦૨૨	૦૨/૨૦૨૨	૩૧/૦૫/૨૦૨૨
૧૧	એડીશનલ સરચાર્જ ઓપન એક્સેસ ઓર્ડર	૦૪/૨૦૨૧	૧૪/૦૯/૨૦૨૧
૧૨	એડીશનલ સરચાર્જ ઓપન એક્સેસ ઓર્ડર	૦૧/૨૦૨૨	૦૮/૦૩/૨૦૨૨
૧૩	એડીશનલ સરચાર્જ ઓપન એક્સેસ ઓર્ડર	૦૨/૨૦૨૩	૨૯/૦૩/૨૦૨૩
૧૪	નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ થી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીના નિયંત્રણ સમયગાળા માટે બાયોમાસ આધારિત પાવર પ્રોજેક્ટ્સ અને બગાસી આધારિત કો-જનરેશન પ્રોજેક્ટ્સમાંથી વિતરણ પરવાનાધારકો અને અન્યો દ્વારા વીજળીની પ્રાપ્તિ માટેના પ્રશુલ્કનું નિર્ધારણ.	૦૩/૨૦૨૨	૨૨/૦૬/૨૦૨૨
૧૫	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (ગ્રીન એનર્જી ઓપન એક્સેસ માટેના નિયમો અને શરતો) વિનિયમો, ૨૦૨૪	૦૮/૨૦૨૪	૨૦/૦૨/૨૦૨૪
૧૬	વિન્ડ સોલર હાઈબ્રીડ પ્રોજેક્ટ માંથી વિતરણ પરવાનો અને અન્ય લોકો દ્વારા પાવર/વીજળી ની પ્રાપ્તિ માટે ટેરિફ ફેમવર્ક, જો કોઈ હોય તો, ગુજરાત રાજ્ય માટે અન્ય વ્યાપારી મુદ્દાઓ વગેરે....	આદેશ નં. ૧/૨૦૨૪	૨૨/૦૨/૨૦૨૪
૧૭	ગુજરાત રાજ્યમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટથી એનર્જી પ્રોજેક્ટ્સ સુધીના વિતરણ પરવાનાઓ દ્વારા વીજળીની પ્રાપ્તિ માટે સામાન્ય ટેરિફ અને અન્ય નિયમો અને શરતોનું નિર્ધારણ કરવા અંગે.	આદેશ નં. ૨/૨૦૨૪	૨૨/૦૨/૨૦૨૪
૧૮	નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેની એવરેજ શુલ્ક	આદેશ નં.	૨૫/૦૩/૨૦૨૧

	પાવર પરચેઝની કોસ્ટ નિર્ધારણ નો આદેશ (એપીપીએલ)	૨/૨૦૨૧	
૧૯	નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટેની એવરેજ શુલ્ક પાવર પરચેઝની કોસ્ટ નિર્ધારણ નો આદેશ (એપીપીએલ)	આદેશ નં. ૩/૨૦૨૧	૩૧/૦૩/૦૨૧
૨૦	નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ માટેની એવરેજ શુલ્ક પાવર પરચેઝની કોસ્ટ નિર્ધારણ નો આદેશ (એપીપીએલ)	આદેશ નં. ૪/૨૦૨૨	૧૮/૧૦/૨૦૨૨
૨૧	નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ માટેની એવરેજ શુલ્ક પાવર પરચેઝની કોસ્ટ નિર્ધારણ નો આદેશ (એપીપીએલ)	આદેશ નં. ૧/૨૦૨૩	૦૫/૦૫/૨૦૨૩
૨૨	એડીશનલ સરચાર્જ ઓપન એક્સેસ ઓર્ડર	૦૩/૨૦૨૩	૩૦/૦૯/૨૦૨૩
૨૩	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને ઓમ્બડસમેન) (પ્રથમ સુધારા) વિનિયમો, ૨૦૨૩	૦૨/૨૦૨૪	૨૫/૦૧/૨૦૨૪
૨૪	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (જામીન અનામત) (તૃતીય સુધારા) વિનિયમો, ૨૦૨૩	૦૩/૨૦૨૪	૨૫/૦૧/૨૦૨૪
૨૫	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (પુરવઠો પૂરો પાડવા પેટે કરેલ ખર્ચ અને પ્રકીર્ણ ખર્ચ વસૂલ કરવા પરવાનેદારને સત્તા) (તૃતીય સુધારા) વિનિયમો, ૨૦૨૩	૦૪/૨૦૨૪	૨૫/૦૧/૨૦૨૪
૨૬	એડીશનલ સરચાર્જ ઓપન એક્સેસ ઓર્ડર	૦૩/૨૦૨૪	૦૮/૦૪/૨૦૨૪
૨૭	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (વીજ પુરવઠા સંહિતા અને આનુસંગિક બાબતો) (તૃતીય સુધારા) વિનિયમો, ૨૦૨૩	૦૧/૨૦૨૩	૨૫/૦૭/૨૦૨૪
૨૮	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (વિતરણ પરવાનેદારની કામગીરીના ધોરણો) વિનિયમો, ૨૦૨૩	૦૨/૨૦૨૩	૨૫/૦૭/૨૦૨૪
૨૯	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(વીજ પુરવઠા અને	૦૧/૨૦૨૪	૨૫/૦૭/૨૦૨૪

	સંલગ્ન બાબતો) (ત્રીજો સુધારો) વિનિયમ, ૨૦૨૩ (કોરીઝેન્ડમ-ઈન-નોટીફિકેશન નં.૦૧/૨૦૨૩)		
૩૦	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો, ૨૦૨૪	જાહેરનામા નં.૧૨/૨૦૨૪	૦૬/૦૮/૨૦૨૪
૩૧	નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ એવરેજ શુલ્ક પાવર પરચેઝ કોસ્ટ (APPC)	૦૪/૨૦૨૪	૨૮/૦૮/૨૦૨૪
૩૨	ગુજરાત રાજ્ય માટે પવન ઊર્જા પ્રોજેક્ટ્સમાંથી વિતરણ લાઈસન્સધારકો અને અન્ય લોકો દ્વારા વીજળી પ્રાપ્તિ માટે ટેરિફ ફેમવર્ક.	આદેશ નં. ૦૫/૨૦૨૪	૩૧/૦૮/૨૦૨૪
૩૩	ગુજરાત રાજ્ય માટે સૌર ઊર્જા પ્રોજેક્ટ્સમાંથી વિતરણ લાઈસન્સધારકો અને અન્ય લોકો દ્વારા વીજળી પ્રાપ્તિ માટે ટેરિફ ફેમવર્ક.	આદેશ નં. ૦૬/૨૦૨૪	૩૧/૦૮/૨૦૨૪
૩૪	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (નેટ મીટરીંગ રૂફટોપ સોલર પીવી ગ્રીડ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ્સ) (ચોથો સુધારો) વિનિયમો, ૨૦૨૪	જાહેરનામા નં.૧૩/૨૦૨૪	૦૬/૦૮/૨૦૨૪
૩૫	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (વીજ પુરવઠા સંહિતા અને સંબંધિત બાબતો) (ચોથો સુધારો) વિનિયમો, ૨૦૨૪	૧૪/૨૦૨૪	૨૩/૦૮/૨૦૨૪
૩૬	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (પુરવઠો પૂરો પાડવા પેટે કરેલ ખર્ચ અને પ્રકીર્ણ ખર્ચ વસૂલ કરવા પરવાનેદારને સત્તા) (ચોથો સુધારો) વિનિયમો, ૨૦૨૪	૧૫/૨૦૨૪	૨૩/૦૮/૨૦૨૪
૩૭	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (હરિત ઊર્જા ખુલ્લા પ્રવેશ માટેના વિનિયમો અને શરતો) (પ્રથમ સુધારો) વિનિયમો, ૨૦૨૪	જાહેરનામા નં.૧૬/૨૦૨૪	૨૩/૦૮/૨૦૨૪
૩૮	એડીશનલ સરચાર્જ ઓપન એક્સેસ ઓર્ડર	૦૭/૨૦૨૪	૨૪/૦૮/૨૦૨૪
૩૯	એડીશનલ સરચાર્જ ઓપન એક્સેસ ઓર્ડર	૦૧/૨૦૨૫	૧૭/૦૩/૨૦૨૫
૪૦	ગુજરાત રાજ્ય માટે બાયોમાસ આધારિત પાવર પ્રોજેક્ટ્સ અને બગાસે આધારિત કો-જનરેશન	આદેશ નં. ૦૨/૨૦૨૫	૨૧/૦૩/૨૦૨૫

	પ્રોજેક્ટ્સમાંથી વિતરણ લાઈસન્સધારકો અને અન્ય લોકો દ્વારા વીજળીની ખરીદી માટે ટેરિફનું નિર્ધારણ		
૪૧	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (હરિત ઊર્જા ખુલ્લા પ્રવેશ માટેના વિનિયમો અને શરતો) (બીજો સુધારો) વિનિયમો, ૨૦૨૫	જાહેરનામા નં.૦૬/૨૦૨૫	૨૮/૦૩/૨૦૨૫

નિયમ સંગ્રહ-ક

આયોગ અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોના વર્ગોનું પત્રક :

આયોગના દસ્તાવેજો જેવા કે, જાહેરનામા, હુકમો/જજમેન્ટ અહેવાલ, નિયામક શ્રી (ટેરિફ, વહીવટ અને હિસાબ), લીગલ એડવાઇઝરશ્રી અને સંયુક્ત નિયામકશ્રી (ટેકનિકલ), પાસેથી અથવા તેઓના તાબા હેઠળના અધિકારીઓ પાસેથી નિયત કાર્યપદ્ધતિ અનુસરીને મેળવી શકાય છે. આયોગની વેબસાઇટ www.gercin.org ઉપર પણ દસ્તાવેજો ઉપલબ્ધ છે.

નિયમ સંગ્રહ-૭

નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગતો:

૭.૧ રાજ્ય સલાહકાર સમિતિ :

વીજળી અધિનિયમ ૨૦૦૩ની કલમ-૮૭ ઉર્જા ક્ષેત્રમાં વાણિજ્યિક, ઉદ્યોગ, પરિવહન, કૃષિ, શ્રમ, ગ્રાહકો, બિન-સરકારી સંગઠનોના અને શૈક્ષણિક તથા સંશોધન સંસ્થાઓનાં હિત રજૂ કરવા ૨૧ કરતા વધુ નહિ તેવા સભ્યોની રાજ્ય સલાહકાર સમિતિ સ્થાપવા આયોગને સત્તા આપે છે. ગુજરાત વિદ્યુત આયોગે આ સંદર્ભમાં સલાહકાર સમિતિની રચના કરેલ છે.

સલાહકાર સમિતિના ઉદ્દેશો નીચેની બાબતો અંગે આયોગને સલાહ આપવાની છે/

૧ મુખ્ય નીતિ-વિષયક પ્રશ્નો

૨ પરવાનેદાર દ્વારા આપવામાં આવતી સેવાની ગુણવત્તા, સાતત્ય અને મર્યાદા સંબંધી બાબત

૩ લાયસન્સદારોના લાયસન્સની શરતો અને જરૂરિયાતોનું પાલન

૪ ગ્રાહક હિત સુરક્ષા અને

૫ ઉર્જા પુરવઠો અને યુટીલીટીઓના કામગીરીના એકંદર ધોરણો

અનુ નં	વિષય/મુદ્દો	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે?	જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા
૧	રાજ્ય સલાહકાર કમિટિ પરિશિષ્ટ-૨ રાજ્ય સંકલિત સમિતિ પરિશિષ્ટ-૩	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? હા	સમાજના જુદા જુદા વિદ્યુતના ઉપભોક્તા વર્ગ જેવા કે ખેડૂત વેપારી, વપરશ્સ્કાર વગેરે વર્ગના પ્રતિનિધિનો આવી કમિટિમાં સમાવેશ કરવામાં આવે છે.(ચાદી સામેલ છે)

સ્ટેટ એડવાઇઝરી કમિટિ (પરિશિષ્ટ-૨)

અનુ નં	સભ્યનું નામ	સરનામું
૧	ચેરમેન શ્રી જીહઆરસી	છઠ્ઠો માળ, ગીફ્ટ-૧, રોડ-૫ સી, ઝોન-૫, ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૩૫૫
૨	મેમ્બર શ્રી જીહઆરસી	છઠ્ઠો માળ, ગીફ્ટ-૧, રોડ-૫ સી, ઝોન-૫, ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૩૫૫
૩	મેમ્બર શ્રી, જીહઆરસી	છઠ્ઠો માળ, ગીફ્ટ-૧, રોડ-૫ સી, ઝોન-૫, ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૩૫૫
૪	સેક્રેટરી શ્રી જીહઆરસી	છઠ્ઠો માળ, ગીફ્ટ-૧, રોડ-૫ સી, ઝોન-૫, ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૩૫૫
૫	અગ્રસચિવશ્રી	ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, બ્લોક નં- ૫, પાંચમે માળ, સચિવાલય, ગાંધીનગર
૬	સિનિયર ઓફિસર	મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (એમએનઆરઇ) ન્યુ દિલ્હી
૭	ચેરમેન	એનર્જી કમિટી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ
૮	ડાયરેક્ટર	કંફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ – ગુજરાત, વેસ્ટર્ન રિજિયોન, સીઆઇઆઇ, ગુજરાત સ્ટેટ ઓફિસ, અમદાવાદ
૯	પ્રેસિડન્ટ	ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગર
૧૦	ચેરપર્સન	ઇલેક્ટ્રીકલ એન્ડ એનર્જી કમીટી, ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, વડોદરા
૧૧	ચિફ ઇલેક્ટ્રીકલ એન્જીનિયર	મેટ્રો-લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લી/ અમદાવાદ
૧૨	પ્રતિનિધિ	ભારતીય કિસાન સંઘ, ગુજરાત, ગાંધીનગર
૧૩	પ્રતિનિધિ	ખેડૂત સમાજ, ગુજરાત, અમદાવાદ
૧૪	પ્રેસિડન્ટ	ગાંધીનગર શહેર વસાહત મહામંડલ, ગાંધીનગર
૧૫	પ્રતિનિધિ	સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થાલતેજ, અમદાવાદ
૧૬	પ્રતિનિધિ	ઇલેક્ટ્રીકલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસીએશન, વડોદરા
૧૭	પ્રતિનિધિ	ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, ન્યુ દિલ્હી
૧૮	પ્રતિનિધિ	ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ
૧૯	પ્રતિનિધિ	ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, પાલજ, ગાંધીનગર
૨૦	શ્રી બી આર જોશી	અમદાવાદ

૭.૨ રાજ્ય સંકલન સમિતિ : (પરિશિષ્ટ-૩)

વીજળી અધિનિયમ ૨૦૦૩ની કલમ-૧૬૬ની પેટા કલમ-૪ હેઠળ રાજ્ય સરકાર, રાજ્ય આયોગના અધ્યક્ષ અને તેના સભ્યો તે રાજ્યમાં પાવર પધ્ધતિના સરળ અને સંકલિત વિકાસ માટે રાજ્યમાં ઇલેક્ટ્રીસીટીના જનરેશન, ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં રોકાયેલ જનરેટીંગ કંપનીઓ, ટ્રાન્સમીશન લાઇસન્સદાર અને ડિસ્ટ્રીબ્યુશન લાઇસન્સદારના પ્રતિનિધિના બનતા સંકલન ફોરમની રચના કરશે. રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે રાજ્ય સંકલન ફોરમની રચના કરેલ છે.

રાજ્ય સંકલન સમિતિના સભ્યોની યાદી :

અનુ.નં	રાજ્યની વિગત	રાજ્ય સંકલન ફોરમનો હોદ્દો
૧	ચેરમેન, ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન	ચેરમેન
૨	ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના મેમ્બરશ્રીઓ	મેમ્બર્સ
૩	નીચેની કંપનીઓના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટરશ્રી - ઉત્તર ગુજરાત વીજ કંપની લી - મધ્ય ગુજરાત વીજ કંપની લી - દક્ષિણ ગુજરાત વીજ કંપની લી - પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી	મેમ્બર્સ
૪	- નીચેની કંપનીઓના મેનેજીંગ ડીરેક્ટરશ્રી - ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લી - ગુજરાત એર્નજી ટ્રાન્સમીશન લી - ટોરેન્ટ પાવર લી (અમદાવાદ) - ટોરેન્ટ પાવર લી (સુરત) - ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લી - ગુજરાત સ્ટેટ એર્નજી જનરેશન લી - સીએલપી ઇન્ડિયા પ્રાઇવેટ લી - જ્યુબીલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. - મુદ્રા પોર્ટ એન્ડ એસઇઝેડ યુટિલીટીઝ લી. - ટોરન્ટ પાવર લી (દહેજ) - અદાણી પાવર લી - એસ્સાર પાવર લી - વાઇસ ચેરમેન, દિનદયાલ પોર્ટ ઓથોરિટી (દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ) - મુખ્ય ઇજનેર, સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર - ચીફ ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટર , ગુજરાત રાજ્ય - ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી	મેમ્બર્સ
૫	ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નાયબ સચિવ કક્ષાથી નીચેના ન હોય તેવા સધિકારી	મેમ્બર
૬	સેક્રેટરી, ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન	મેમ્બર સેક્રેટરી

૭.૩ ગ્રાહક મંડળોની સામેલગીરી :

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (કારોબારનું સંચાલન) વિનિયમો, ૨૦૦૪ના કલમ ૧૨ અને ૧૩ ને આધિન આયોગે ગ્રાહક મંડળોની પ્રતિનિધિત્વ માટેની વ્યવસ્થાની જોગવાઈ છે.

૧૨ (૧) આયોગ સમક્ષની કોઈ કાર્યવાહીમાં ગ્રાહકોના કોઈ મંડળને અથવા અન્ય સંસ્થાપિત સંસ્થાઓ અથવા કોઈ જૂથને નિખાલસપણે ભાગ લેવા દેશે.

(૨) કાર્યવાહી સમયસર પૂરી કરવા માટે આયોગ ઉપર જણાવેલ મંડળોજૂથોને/એકબીજા સાથે જોડાવા જણાવશે, જેથી કરીને તેઓ એકત્રિત અને સહિયારા સોગંદનામાં, રજૂઆતો અને નિવેદન કરી શકશે.

૧૩ (૧) આયોગ તેમને યોગ્ય લાગે તેવા કોઈ અધિકારી કે બીજી કોઈ વ્યક્તિને તેની સમક્ષની કાર્યવાહીમાં ગ્રાહકોના હિતનું પ્રતિનિધિત્વ કરવા અધિકૃત કરવા.

(૨) વળી, આયોગે ગ્રાહકોના હિતનું પ્રતિનિધિત્વ કરવા નીમેલા અધિકારી અથવા વ્યક્તિને, આયોગને યોગ્ય જણાય તે પ્રમાણે કાર્યવાહીમાં એવા પક્ષકારો દ્વારા ફી, ખર્ચ અને કિંમત ચૂકવવા જણાવશે.

નિયમ સંગ્રહ-૮

આયોગના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

૮.૧ તપાસ અધિકારી (ઓમ્બુડસમેન) અમદાવાદ અને રાજકોટ :

૨૦૦૩ના વીજળી અધિનિયમની કલમ-૪૨ની પેટા કલમ(૬) સાથે વાંચતા કલમ ૧૮૧ (૨) (આર) અને (એસ) હેઠળ આપેલી સત્તાની રૂએ અને આ અંગે તેમને સક્ષમ બનાવતી તમામ સત્તાઓની રૂએ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ગુજરાત રાજ્યમાં તપાસ અધિકારીની નિમણૂક અને તેમનાં કાર્યો માટેની જોગવાઈ કરતાં તા.૦૭ એપ્રિલ ૨૦૧૧ના ગુજરાત રાજપત્રમાં(અસાધારણ) અંગ્રેજીમાં પ્રસિધ્ધ કર્યા છે. જેનો ગુજરાતી અનુવાદ પણ સર્વે લોકોની જાણ સારૂ પ્રસિધ્ધ કર્યા છે.

આ વિનિયમોના આધારે તપાસ અધિકારીની નિમણૂક, મુદત, અધિકારક્ષેત્ર અને તેની કાર્યવાહીઓની જોગવાઈઓ દર્શાવાઈ છે.

ઓમ્બુડસમેન તપાસતંત્રની કચેરી સરનામું :-

અમદાવાદ	રાજકોટ
વિદ્યુત લોકપાલશ્રી ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે, CMTS બિલ્ડીંગ, ટેલિફોન એક્સચેન્જ, બિમાનગર, જીવનધામ રોડ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ફોન નં:૦૭૯-૨૬૩૦૨૬૮૯	વિદ્યુત લોકપાલશ્રી “જીલ્લા સેવા સદન-૩” ત્રીજો માળ, બ્લોક નં-૧, સરકારી પ્રેસ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન નં:૦૨૮૧-૨૯૯૪૧૨૫

આ સંસ્થા એપેલેટ ઓથોરીટી છે. તે તા:૨૫-૦૮-૨૦૦૪થી અમલમાં આવેલ છે. ગ્રાહક ફોરમની સામે વીજળીની બાબતોને લગતી ફરિયાદની અપીલ વગેરે દાખલ કરીને સુનાવણી કરીને તથા તપાસ કરીને યોગ્ય નિકાલ કરે છે.

સંસ્થાના વડા

શ્રી પી એ વાઘેલા વિદ્યુત લોકપાલ, અમદાવાદના સંસ્થાના વડા છે.

શ્રી એસ એચ ઉપાધ્યાય વિદ્યુત લોકપાલ, રાજકોટના સંસ્થાના વડા છે.

ઓમ્બુડસમેનની કચેરીમાં સંબંધિત બાબતોની કેસની સુનાવણી કરી સંબંધિત કાયદાની જોગવાઈ હેઠળ કાયદાનુસાર હુકમ બહાર પાડવાના થાય છે અને તે હુકમની નકલ માગવાથી ફી ભરીને જાહેર જનતાને ઉપલબ્ધ બની શકે છે. આ સુનાવણીની કાર્યવાહી જાહેર છે.

૮.૨ ગ્રાહકોની ફરિયાદોના (ગ્રીવન્સ) નિરાકરણ માટે ફોરમની સ્થાપના :

૨૦૦૩ના વીજળી અધિનિયમની કલમ-૪૨ની પેટા કલમ (૫) સાથે વાંચતા કલમ ૧૮૧ (૨) (આર) અને (એસ) હેઠળ સુપરત કરેલી સત્તાની રૂએ અને આ અંગે તેને સક્ષમ બનાવતી તમામ સત્તાઓની રૂએ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને લોકપાલ(વિનિયમો-૨૦૧૧, તારીખ ૭ એપ્રિલ-૨૦૧૧ના ગુજરાત રાજપત્ર (અસાધારણમાં) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ વિનિયમોને આધારે દરેક વિતરણ પરવાનેદારે ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ફોરમની રચના કરવાની હોય છે. આ વિનિયમોમાં ફોરમમાં આયોગ દ્વારા એક સ્વતંત્ર સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ વિનિયમોમાં ફોરમનું અધિકારક્ષેત્ર, તેના સમક્ષ રજૂઆત, ફરિયાદ નિવારણની કાર્ય પદ્ધતિ વગેરેની જોગવાઈઓ દર્શાવાઈ છે. ફોરમના નિર્ણય/હુકમથી ગ્રાહકોને સંતોષ ના થાય તો ગ્રાહક, વિનિયમોમાં દર્શાવેલ સમયમર્યાદામાં- લોકપાલ સમક્ષ રજૂઆત કરી શકે છે. આ વિનિયમની જોગવાઈ પ્રમાણે રાજ્યના વિવિધ વિતરણ પરવાનેદારોએ ૮(આઠ) ફોરમોની રચના કરેલ છે. જેની વિગત નીચે આપેલ છે.

વિતરણ પરવાનેદારે તેમન અધિકારક્ષેત્રમાં રચેલી ફોરમની કચેરીઓની વિગતો

કન્ઝયુમર ગ્રીવન્સ રીડ્રેસલ ફોરમ

કંપનીનું નામ	સરનામું
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સુરત ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ, રજીસ્ટર્ડ એન્ડ કોર્પોરેટ ઓફિસ, નાના વરાછા રોડ, કાપોદ્રા ચાર રસ્તા, સુરત ૩૯૫૦૦૬ ફોન (૦૨૬૧)-૨૮૦૪૨૩૮ ફેક્સ:૦૨૬૧-૨૫૭૨૬૩૬ Email : ecgerc.dgvcl@gebmail.com
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ વલસાડ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ, અધીક્ષક ઇજનેર, (ઓ એન્ડ એમ) ની કચેરી, ડીજીવીસીએલ વર્તુળ કચેરી, બેચર રોડ, પાવર હાઉસ કંપાઉન્ડ, દશેરા ટેકરી, વલસાડ - ૩૯૬૦૦૧. ફોન (૦૨૬૩૨)-૨૪૧૦૩૪ Email : cgrfvalsad@gebmail.com
મધ્ય ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ વડોદરા કોર્પોરેટ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ, સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસ કોર્સ, વડોદરા - ૩૯૦ ૦૦૭

	ફોન (૦૨૬૫)-૨૩૩૦૬૩૫ Email : serc.mgvcl@gebmail.com
મધ્ય ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ બરોડા O&M સર્કલ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ, બરોડા O&M સર્કલ, ગોત્રી રોડ, વડોદરા - ૩૯૦ ૦૨૧. ફોન (૦૨૬૫)-૫૫૩૧૧૦૨/૦૩ Email : barodaom@gebmail.com
મધ્ય ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ બરોડા સિટી સર્કલ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ, બરોડા સિટી સર્કલ, નવલખી કમ્પાઉન્ડ વડોદરા. ફોન (૦૨૬૫)-૨૪૨૬૧૨૧, ૨૪૩૬૧૩૩ Email : barodacity@gebmail.com
મધ્ય ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ આનંદ O&M સર્કલ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ, આનંદ સર્કલ, લાંભવેલ રોડ, આનંદ. ફોન (૦૨૬૯૨)-૨૪૭૩૬૬ Email : anandom@gebmail.com
મધ્ય ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ નડિયાદ O&M સર્કલ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ, નડિયાદ સર્કલ, ત્રીજો માળ, મહાનગરપાલિકા ભવન, સ્ટેશન રોડ, નડિયાદ. ફોન (૦૨૬૮)-૨૫૬૨૨૦૪ Email : senadiad.mgvcl@gebmail.com
મધ્ય ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ગોધરા O&M સર્કલ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ, ગોધરા સર્કલ, ઓલ્ડ પાવર હોઉસ, ભૂરાવા, ગોધરા. ફોન (૦૨૬૭૨)-૨૫૭૩૧૦૫, ૨૪૩૬૧૩૩ Email : godharaom.mgvcl@gebmail.com

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રાજકોટ	સંયોજક, સી.જી.આર.એફ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, રજીસ્ટર્ડ એન્ડ કોર્પોરેટ ઓફિસ, નાના માવા રોડ, લક્ષ્મીનગર, રાજકોટ - ૩૬૦૦૦૪ ફોન (૦૨૮૨)-૨૩૮૦૪૨૫/૨૩૮૦૪૨૭, ફેક્સ: (૦૨૮૨)-૨૩૮૦૪૨૮ Email : forum.pgvccl@gebmil.com
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ભાવનગર	સંયોજક, સી.જી.આર.એફ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, ચાવડી ગેટ, ભાવનગર - ૩૬૪૦૦૨ ફોન (૦૨૭૮)-૨૫૨૧૭૬૦/૬૧/૬૨, ફેક્સ : ૦૨૭૮-૨૫૨૧૭૬૩ Email : forumbhavanagar.pgvccl@gebmil.com
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ભૂજ	સંયોજક, સી.જી.આર.એફ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, ઝોનલ ઓફિસ, પાવર હાઉસ કમ્પાઉન્ડ, હોસ્પિટલ રોડ, ભૂજ - (કચ્છ) ૩૭૦ ૦૦૧. ફોન (૦૨૮૩૨)-૨૫૮૦૩૨/૨૫૩૫૫૦/૨૫૫૩૭૭, ફેક્સ : ૦૨૮૩૨-૨૨૫૦૪૮ Email : forumbhuj.pgvccl@gebmil.com
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ જૂનાગઢ	સંયોજક, સી.જી.આર.એફ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, સર્કલ ઓફિસ, આઝાદ ચોક, એમ.જી રોડ, જૂનાગઢ - ૩૬૨ ૦૦૧ ફોન (૦૨૮૫)-૨૬૨૨૧૬૭/૨૬૫૭૮૭૭ ફેક્સ : ૦૨૮૫-૨૬૫૭૮૭૭ Email : forumjunagadh.pgvccl@gebmil.com
ઉત્તર ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ મહેસાણા કોર્પોરેટ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ, કોર્પોરેટ ઓફિસ, વિસનગર રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧. ફોન (૦૨૭૬૨)-૨૨૨૦૮૦/૮૧ Email : cgrf@ugvccl.com
ઉત્તર ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ,

મહેસાણા સર્કલ ફોરમ	કોર્પોરેટ ઓફિસ, વિસનગર રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧. ફોન (૦૨૭૬૨)-૨૨૨૪૨૪ Email : mahesana.cgrf@ugvcl.com
ઉત્તર ગુજરાત વીજ કંપની લી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સાબરમતી સર્કલ ફોરમ	સંયોજક, સી.જી.આર.એફ. ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ, ટોરેન્ટ પાવર હાઉસ પાસે, એઇસી રેલવે કોસિંગ, સર્કલ ઓફિસ, સાબરમતી, અમદાવાદ - ૩૮૦ ૦૦૫. ફોન (૦૭૯)-૨૭૫૦૦૯૮૧, ૨૭૫૦૦૨૧૪ Email : sabarmati.cgrf@ugvcl.com

નિયમ સંગ્રહ-૯ :

અધિકારીઓ અને કર્મચારીઓની માહિતીપુસ્તિકા-

નં	નામ અને હોદ્દો	ફોન નં (ઓફીસ)	મોબાઇલ / ઇ-મેઇલ
૧	શ્રી અનિલ મુકિમ, અધ્યક્ષ	૨૩૬૦૨૦૦૧	૯૯૭૮૪૦૫૯૦૪ chairman@gercin.org
૨	શ્રી મેહુલ એમ ગાંધી, સભ્ય	૨૩૬૦૨૦૦૩	૯૯૭૮૪૧૮૯૯૮ member@gercin.org
૩	શ્રી એસ આર પાન્ડે, સભ્ય	૨૩૬૦૨૦૦૫	૯૪૨૭૦૦૬૧૮૮ member.t@gercin.org
૪	શ્રી રંજીથકુમાર જે., આઈએએસ સેક્રેટરી	૨૩૬૦૨૦૧૬ ૨૩૬૦૨૦૧૭	૯૦૯૯૯૮૮૮૯૮ secretary@gercin.org
૫	શ્રી પી. એ. વાઘેલા વિદ્યુત લોકપાલ, અમદાવાદ	૦૭૯-૨૬૩૦૮૫૯૦	૯૫૧૨૪૩૦૮૦૩ eleombahm@gercin.org
૬	શ્રી એસ. એચ. ઉપાધ્યાય વિદ્યુત લોકપાલ, રાજકોટ	૦૨૮૧૨૯૯૪૧૨૫	૯૯૨૫૨૧૦૨૩૭ eleombajt@gercin.org
૭	શ્રી ડી. આર. પરમાર ડાયરેક્ટર (ટેરિફ, વહીવટ અને હિસાબ)	૨૩૬૦૨૦૨૨	૯૪૨૭૦૦૫૮૪૮ drparmar@gercin.org
૮	શ્રી એસ ટી અનડા, સંયુક્ત નિયામક (ટેક-૧)	૨૩૬૦૨૦૨૩	૯૫૫૮૮૧૭૯૨૯ s.anada@gercin.org
૯	શ્રીમતી સાક્ષી આર ખેસવાની, સંયુક્ત સચિવ, ઈ/ચા. હિસાબી અધિકારી	૦૭૯-૨૩૬૦૨૦૨૮	૯૯૨૫૨૧૩૬૧૬ sakshi@gercin.org
૧૦	શ્રી એ યુ અધ્વર્યુ, નાયબ નિયામક (ટેરીફ),	૨૩૬૦૨૦૨૭	૯૮૯૮૨૯૦૮૬૦ adhvaryu@gercin.org
૧૧	શ્રી બી. જે. શાહ, નાયબ નિયામક (લિગલ)	૨૬૩૦૨૬૮૯	૯૯૨૫૨૦૮૩૭૯ So.ombudsman@gercin.org
૧૨	શ્રી વી.ટી. પટેલ, નાયબ નિયામક (ટેક)	૨૩૬૦૨૦૨૪	૯૯૨૫૨૦૮૨૧૭ vtpatel@gercin.org
૧૩	શ્રી યોગેશ એસ ઘેડિયા, સ્ટાફ ઓફિસર, રાજકોટ	૮૯૮૦૦૩૧૬૪૭	sorjtomb@gercin.org
૧૪	શ્રી જીજ્ઞેશ સી રાયચુરા સ્ટાફ ઓફિસર, અમદાવાદ	૦૭૯-૨૬૩૦૮૫૯૦	૯૬૬૨૦૫૪૦૯૨ so.ombudsman@gercin.org
૧૫	શ્રી જીજ્ઞેશ મકવાણા, આઇટી મેનેજર	૨૩૬૦૨૦૫૧	૯૬૦૧૨૬૦૩૪૬ itmanager@gercin.org
૧૬	શ્રી અભિષેક એસ મકવાણા, આસીટન્ટ ડાયરેક્ટર (ટેક)	૨૩૬૦૨૦૩૧	૯૪૦૮૬૦૫૫૯૪ abhishekmakwana@gercin.org
૧૭	શ્રી સંતોષકુમાર અસીપુ, આસીટન્ટ ડાયરેક્ટર (ટેરિફ)	૨૩૬૦૨૦૩૯	૯૭૨૪૫૮૨૪૩૫ santosh@gercin.org
૧૮	શ્રી વસીમ અખ્તર અંસારી – આસીટન્ટ ડાયરેક્ટર (લીગલ)	૨૩૬૦૨૦૩૪	૮૦૦૦૧૯૫૦૮૫ ૮૯૮૦૮૫૭૮૫૦ wasim@gercin.org

૧૯	શ્રી કેતન થાનકી આસીટન્ટ ડાયરેક્ટર	૨૩૬૦૨૦૩૬	૯૯૧૩૦૧૮૭૨૪ kmthanki@gercin.org
૨૦	શ્રી ઉમેશ એ ગોર એકઝીક્યુટીવ	૨૩૬૦૨૦૪૧	૮૨૩૮૦૪૧૬૦૩ umeshgor@gercin.org
૨૧	શ્રી બી જે ઠાકર એકઝીક્યુટીવ (વહીવટ)	૨૩૬૦૨૦૪૩	૯૯૭૮૯૭૦૫૩૫ bjthakar@gercin.org
૨૨	શ્રી વરુણ વી ગુપ્તા એકઝીક્યુટીવ (લીગલ)	૨૩૬૦૨૦૩૮	૯૯૦૯૦૧૦૩૩૧ varun@gercin.org
૨૩	શ્રી રોમાનઅલી રજ્જાહુસૈન મુસા, એકઝીક્યુટીવ (આરએ/સીએ)	૨૩૬૦૨૦૩૭	૭૬૦૦૯૦૪૦૮૧ roman@gercin.org
૨૪	શ્રી દુષ્યંતકુમાર મુકેશકુમાર ત્રિવેદી, એકઝીક્યુટીવ (હિસાબ)	૨૩૬૦૨૦૪૫	૯૯૦૯૯૮૭૦૮૩ dushyant@gercin.org
૨૫	શ્રી ભાવેશ એસ. કુશવાહા, એકઝીક્યુટીવ (ટેરિફ)	૨૩૬૦૨૦૪૭	૮૨૬૪૬૧૭૯૦૯ bhavesh@gercin.Org
૨૬	શ્રી પી એસ મિસ્ત્રી પીએ ટુ સેક્રેટરી	૨૩૬૦૨૦૧૭	૯૪૨૯૦૧૯૦૪૨ pa.secretary@gercin.org
૨૭	શ્રીમતી હેતલ થાનકી રિષેપ્શનિષ્ટ-કમ-ક્લાર્ક	૨૩૬૦૨૦૦૦	૯૫૫૮૮૧૩૫૬૭ joshi.hetal@gercin.org
૨૮	શ્રી એમ. યુ. દવે જૂની-આસીટન્ટ	૨૩૬૦૨૦૦૦	૯૭૨૬૯૪૯૬૬૫ gerc@gercin.org
૨૯	શ્રી પાર્થ હેમંતલાલ આશિયાની જૂની-આસીટન્ટ	૨૩૬૦૨૦૦૦	૮૮૬૬૫૫૫૫૦૮ gerc@gercin.org
૩૦	શ્રી કે. એસ. શાહ જૂની-આસીસટન્ટ	૨૩૬૦૨૦૪૪	૯૯૨૫૬૫૮૯૫૯ gerc@gercin.org
૩૧	શ્રી કે જી રાજપૂત ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૩૬૦૨૦૦૦	--
૩૨	શ્રી જે એલ ચોહાણ ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૩૬૦૨૦૦૦	--
૩૩	શ્રી પી કે પંચાલ ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૩૬૦૨૦૦૦	--
૩૪	શ્રી વી ડી પરમાર ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૩૬૦૨૦૦૦	--
૩૫	શ્રી આર એમ મકવાણા ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૩૬૦૨૦૦૦	--
૩૬	શ્રી આઇ જે ચાવડા પ્યુન, હાલ વિદ્યુત લોકપાલ કચેરી, અમદાવાદ	૨૩૬૦૨૦૦૦	--
૩૭	શ્રી એન જે ગોરખા, પ્યુન	૨૩૬૦૨૦૦૦	--
૩૮	શ્રી ડી એચ વસીટા, પ્યુન	૨૩૬૦૨૦૦૦	--

નિયમ સંગ્રહ-૧૦ :

વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું

અનુ	નામ/હોદ્દો	પગારધોરણ	માસિક મહેનતાણું રૂ તા: ૩૧-૦૫-૨૦૨૫
૧	શ્રી અનિલ મુકીમ, અધ્યક્ષ	રૂ.૨૨૫૦૦૦ ફિક્સ + ભથ્થા	૨૫૧૮૯૧.૦૦
૨	શ્રી મેહુલ એમ ગાંધી, સભ્ય	૧૮૨૨૦૦-૨૨૪૧૦૦ રૂપિયા મૂળ પગાર/ભથ્થા	૯૧૬૮૯.૦૦
૩	શ્રી એસ આર પાન્ડે, સભ્ય	૧૮૨૨૦૦-૨૨૪૧૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૨૨૭૨૫૦.૦૦
૪	શ્રી રંજીથકુમાર IAS સચિવ	૧૪૪૨૦૦-૨૧૮૨૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	Nil
૫	શ્રી પી. એ. વાઘેલા વિદ્યુત લોકપાલ, અમદાવાદ	ફિક્સ પગાર રૂ.૬૦૦૦૦/-	૫૯૮૦૦.૦૦
૬	શ્રી એસ. એચ. ઉપાધ્યાય વિદ્યુત લોકપાલ, રાજકોટ	ફિક્સ પગાર રૂ.૬૦૦૦૦/-	૫૯૮૦૦.૦૦
૭	શ્રી ડી આર પરમાર ડાયરેક્ટર	૧૩૧૧૦૦-૨૧૬૬૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૩૨૮૩૫૫.૦૦
૮	શ્રી એસ ટી અનડા સંયુક્ત નિયામક (ટેક-૧)	૧૨૩૧૦૦-૨૧૫૮૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૧૯૯૨૬૨.૦૦
૯	શ્રીમતી સાક્ષી આર. ખેસકવાની સંયુક્ત સચિવ, ઈ/યા. હિસાબી અધિકારી	૧૧૦૧૦૦-૧૮૭૭૦૦ (યુટીલીટી સ્કેલ)	૧૫૩૩૧૦.૦૦
૧૦	શ્રી એ યુ અધ્વર્યુ નાયબ નિયામક (ટેરીફ)	૭૮૮૦૦-૨૦૯૨૦૦ રૂપિયા મૂળ પગાર/ભથ્થા	૧૩૬૯૧૧.૦૦
૧૧	શ્રી બી. જે. શાહ નાયબ નિયામક (લિગલ)	૭૨૧૦૦-૧૧૯૪૦૦ (યુટીલીટી સ્કેલ)	૧૭૯૮૩૦.૦૦
૧૨	શ્રી વી. ટી. પટેલ, નાયબ નિયામક (ટેકનિકલ)	૭૨૧૦૦-૧૧૯૪૦૦ (યુટીલીટી સ્કેલ)	૧૪૮૦૨૫.૦૦
૧૩	શ્રી યોગેશ એસ. ઘેડિયા સ્ટાફ ઓફિસર, વિદ્યુત લોકપાલ કચેરી, રાજકોટ	૭૨૧૦૦-૧૧૯૪૦૦ (યુટીલીટી સ્કેલ)	૧૩૬૩૯૧.૦૦
૧૪	શ્રી જે. સી. રાયચુરા સ્ટાફ ઓફિસર, વિદ્યુત લોકપાલ કચેરી, અમદાવાદ	૭૨૧૦૦-૧૧૯૪૦૦ (યુટીલીટી સ્કેલ)	૧૨૧૮૨૪.૦૦
૧૫	શ્રી જીજ્ઞેશ મકવાણા આઈટી મેનેજર	૫૬૧૦૦-૧૭૭૫૦૦ રૂપિયા મૂળ પગાર/ભથ્થા	૧૧૫૮૦૫.૦૦
૧૬	શ્રી અભિષેક મકવાણા આસીસ્ટન્ટ ડાયરેક્ટર (ટેક)	૫૬૧૦૦-૧૭૭૫૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૧૧૫૮૦૫.૦૦
૧૭	શ્રી સંતોષકુમાર અસીપુ આસીસ્ટન્ટ ડાયરેક્ટર	૫૬૧૦૦-૧૭૭૫૦૦ રૂપિયા મૂળ પગાર/ભથ્થા	૧૦૭૯૨૮.૦૦
૧૮	શ્રી વસીમ અખ્તર અંસારી આસીસ્ટન્ટ ડાયરેક્ટર (લીગલ)	૫૬૧૦૦-૧૭૭૫૦૦ રૂપિયા મૂળ પગાર/ભથ્થા	૧૧૦૧૮૮.૦૦

૧૯	શ્રી કેતન થાનકી આસીસ્ટન્ટ ડાયરેક્ટર	૫૬૧૦૦-૧૭૭૫૦૦ રૂપિયા મૂળ પગાર/ભથ્થા	૯૪૮૪૫.૦૦
૨૦	શ્રી ઉમેશ એ ગોર એક્ઝીક્યુટીવ	૪૫૪૦૦-૧૦૧૨૦૦ (ચુટીલીટી સ્કેલ)	૮૭૯૮૭.૦૦
૨૧	શ્રી રોમાનઅલી રજ્જાહુસૈન મુસા, એક્ઝીક્યુટીવ (આરએ/સીએ)	૪૫૪૦૦-૧૦૧૨૦૦ (ચુટીલીટી સ્કેલ)	૮૪૫૬૨.૦૦
૨૨	શ્રી ભાવેશ એસ. કુશવાહા, એક્ઝીક્યુટીવ (ટેરિફ)	૪૫૪૦૦-૧૦૧૨૦૦ (ચુટીલીટી સ્કેલ)	૭૮૫૦૬.૦૦
૨૩	શ્રી વરુણ વી ગુપ્તા એક્ઝીક્યુટીવ (લીગલ)	૩૯૯૦૦-૧૨૬૬૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૮૦૩૦૦.૦૦
૨૪	શ્રી દુષ્યંતકુમાર મુકેશકુમાર ત્રિવેદી, એક્ઝીક્યુટીવ (હિસાબ)	૩૫૭૦૦-૮૨૧૦૦ (ચુટીલીટી સ્કેલ)	૬૮૧૦૬.૦૦
૨૬	શ્રી પી એસ મિસ્ત્રી પી એ ટુ સેક્રેટરી	૩૫૭૦૦-૮૨૧૦૦ (ચુટીલીટી સ્કેલ)	૭૩૦૦૮.૦૦
૨૭	શ્રીમતી હેતલ થાનકી રિશેષ્ઝાનિષ્ટ-કમ-કલાર્ક	૨૯૧૦૦-૫૭૮૦૦ (ચુટીલીટી સ્કેલ)	૫૩૪૦૪.૦૦
૨૮	શ્રી કે જી રાજપૂત ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૫૫૦૦-૮૧૧૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૫૦૬૦૬.૦૦
૨૯	શ્રી પી કે પંચાલ ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૫૫૦૦-૮૧૧૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૪૯૮૬૨.૦૦
૩૦	શ્રી વી ડી પરમાર ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૫૫૦૦-૮૧૧૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૪૩૪૭૫.૦૦
૩૧	શ્રી બી જે ઠાકર એક્ઝીક્યુટીવ (વહીવટ)	૨૫૦૦૦-૫૫૮૦૦ (ચુટીલીટી સ્કેલ)	૬૧૬૮૩.૦૦
૩૨	શ્રી એમ. યુ. દવે જૂની.આસીટન્ટ	૨૫૦૦૦-૫૫૮૦૦ (ચુટીલીટી સ્કેલ)	૪૪૯૭૨.૦૦
૩૩	શ્રી પાર્થ હેમંતલાલ આશિયાની જૂની.આસીટન્ટ	૨૫૦૦૦-૫૫૮૦૦ (ચુટીલીટી સ્કેલ)	૪૮૨૯૫.૦૦
૩૪	શ્રી કાર્તિક એસ શાહ જૂની.આસીટન્ટ	૨૫૦૦૦-૫૫૮૦૦ (ચુટીલીટી સ્કેલ)	૩૮૮૧૦.૦૦
૩૫	શ્રી આર એમ મકવાણા ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૧૭૦૦-૬૯૧૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૫૦૩૧૭.૦૦
૩૬	શ્રી જે એલ ચૌહાણ ડ્રાઇવર-કમ-એટેન્ડન્ટ	૨૧૭૦૦-૬૯૧૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૬૪૮૫૫.૦૦
૩૭	શ્રી આઇ જે ચાવડા, પ્યુન	૧૫૭૦૦-૫૦૦૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૫૩૮૬૧.૦૦
૩૮	શ્રી ડી એચ વસીટા, પ્યુન	૧૫૦૦૦-૪૭૬૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૫૭૦૫૫.૦૦
૩૯	શ્રી એન જે ગોરખા, પ્યુન	૧૫૭૦૦-૫૦૦૦૦ રૂપિયા મૂળ પગાર / ભથ્થા	૪૩૨૯૧.૦૦

નિયમ સંગ્રહ-૧૧

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને ચુકવેલા નાણાં પરના અહેવાલોની વિગતો, દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર :-

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ૨૦૨૫-૨૬ ના અંદાજ પત્રની વિગતો

(૧) આવકની વિગતો :

અનુ નં	વિગત	રકમ રૂ/(હજારમાં)
૧	ફી	૪૦૭૮૬૫.૦૦
૨	વ્યાજની આવક	૩૦૦૧૦૧.૦૦
૩	લોન રીકવરી તથા અન્ય આવક	૧૭૦.૦૦
	કુલ આવક	૭૦૮૧૩૬.૦૦

(૨) ખર્ચની વિગતો :

અનુ નં	વિગત	રકમ રૂ/(હજારમાં)
૧	પગાર ઓફિસ વેલ્ફેર અને મેડીકલ ખર્ચ /ભથ્થા	૬૨૬૮૬.૦૦
૨	વહીવટી ખર્ચ	૨૨૪૬૮.૦૦
૩	ભાડું ટેક્ષ વિગેરે	૧૪૭૫.૦૦
૪	પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ્યુઅલ સર્વિસીસ	૩૨૫૮૮.૦૦
૫	નિવૃત્તિ લાભો (Leave salary + ગ્રેજ્યુઈટી)	૮૪૧૩.૦૦
૬	રીપેર - મેઈન્ટેનન્સ	૮૮૨૫.૦૦
	કુલ ખર્ચ	૧૩૬૪૫૫.૦૦

નિયમ સંગ્રહ—૧૨

સહાયકી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને લાભાર્થીઓની વિગતો

આયોગ દ્વારા આવી કોઇ જાતની યોજના અમલમાં મૂકવામાં આવતી નથી.

જેથી માહિતી શૂન્ય છે.

નિયમ સંગ્રહ-૧૩

આયોગે આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિઓ મેળવનારની વિગતો :

અનુ નં	પરવાનેદારનું નામ	અધિકૃતિની વિગત	અધિકૃતિ મેળવવાનું કારણ
1.	દક્ષિણ ગુજરાત વીજ કંપની લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
2.	મધ્ય ગુજરાત વીજ કંપની લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
3.	પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
4.	ઉત્તર ગુજરાત વીજ કંપની લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
5.	ટોરેન્ટ પાવર વીજ કંપની લી અમદાવાદ	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
6.	ટોરેન્ટ પાવર વીજ કંપની લી સુરત	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
7.	ટોરેન્ટ પાવર વીજ કંપની લી દહેજ	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
8.	ટોરેન્ટ પાવર વીજ કંપની લી ધોલેરા	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
9.	ટોરેન્ટ પાવર વીજ કંપની લી માંડલ બેચરાજી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
10.	એસ્પેનપાર્ક ઇન્ફ્રા વડોદરા પ્રા લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
11.	દિનદયાલ પોર્ટ ઓથોરિટી (દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ/કંડલા પોર્ટ ટ્રસ્ટ)	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
12.	ગિફ્ટ પાવર કંપની લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
13.	જયુબીલન્ટ ઇન્ફ્રા લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
14.	એમપીએસઇઝેડ યુટીલીટીસ લી	વિજળી વિતરણનું લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
15.	ગુજરાત ઊર્જા પ્રવહન નિગમ લી (જેટકો)	વીજળી પ્રવાહનનું લાઇસન્સ	વીજળી પ્રવાહન નિધારીત ક્ષેત્ર- ગુજરાત રાજ્ય
16.	ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી	ટ્રેડીંગ લાઇસન્સ	વિજળી વિતરણ નિધારીત ક્ષેત્રમાં
17.	ગ્લોબલ એનર્જી પ્રા લી	ટ્રેડીંગ લાઇસન્સ	ગુજરાત રાજ્ય

- કેન્દ્ર સરકારના જાહેરનામા દ્વારા સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન (SEZ)ને તેના વિસ્તારમાં વિજ વિતરણ માટે ડીમ લાઇસન્સી ગણવામાં આવશે.

નિયમ સંગ્રહ-૧૪

વિજાણરૂપે ઉપલબ્ધ માહિતી:

આયાગે બહાર પાડેલ અગત્યના હુકમો, વિનિયમો (નોટીફિકેશન્સ) તથા હુકમોનો સંગ્રહ આયોગની વેબ સાઇટ-

www.gercin.org પરથી જાહેર જનતાની જાણકારી માટે ઉપલબ્ધ છે.

નિયમ સંગ્રહ-૧૫

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાચનકક્ષાના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :

આયોગની કચેરીમાં જાહેર જનતાના ઉપયોગ માટે મર્યાદિત પ્રમાણમાં ગ્રંથાલયની સેવા ઉપલબ્ધ છે. ઉપરાંત નોટિસ બોર્ડ ઉપર અગત્યના હુકમો સમયાંતરે નાગરિકો માટે મૂકવામાં આવે છે. વિનિયમો તથા હુકમ સંગ્રહ જાહેર જનતાને આયોગે નક્કી કરેલ ફી લઈને પૂરા પાડવામાં આવે છે. વળી આ વિનિયમો અને હુકમનો સંગ્રહ આયોગની વેબસાઇટ

www.gercin.org ઉપર પણ જાહેર જનતાની જાણ સારૂ મૂકેલ છે.

નિયમ સંગ્રહ-૧૬

જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદ્દો અને બીજી વિગતો:

આયોગના માહિતી અધિકારીઓ મદદનીશ માહિતી અધિકારીઓ અને વિભાગીય કાયદાકીય (એપેલેટ) સત્તાધિકારી વિશેની સંપર્ક માહિતી નીચેના નમૂનામાં આપો.

સરકારી તંત્રનું નામ : ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

વિભાગીય એપેલેટ સત્તાધિકારી:

અનુ નં	નામ	શ્રી ડી આર પરમાર
૧	હોદ્દો	નિયામક (ટેરિફ, વહીવટ/હિસાબ)
૨	ફોન	૯૧-૭૯-૨૩૬૦૨૦૦૦
૩	ફેક્સ	૯૧-૭૯-૨૩૬૦૨૦૫૪-૨૩૬૦૨૦૫૫
૪	ઇમેઇલ-	gerc@gercin.org
૫	સરનામું	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ છઠ્ઠો માળ, ગીફ્ટ-૧, રોડ- ૫ સી, ઓન-૫, ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૫૦

જાહેર માહિતી અધિકારી :

નં	નામ	શ્રીમતી સાક્ષી ખેસકવાની	શ્રી જે. સી. રાયચુરા	શ્રી યોગેશ શાન્તિલાલ ઘેડિયા
૧	હોદ્દો	સંયુક્ત સચિવ, ઈ/ચા. હિસાબી અધિકારી	સ્ટાફ ઓફિસર	સ્ટાફ ઓફિસર
૨	ફોન	૯૧-૭૯-૨૩૬૦૨૦૦૦	૦૭૯-૨૩૬૦૨૬૮૯	૦૨૮૧-૨૯૯૪૧૨૫
૩	ફેક્સ	૯૧-૭૯-૨૩૬૦૨૦૫૪-૨૩૬૦૨૦૫૫	-	-
૪	ઇમેઇલ-	gerc@gercin.org	eleombahm@gercin.org	eleombrit@gercin.org
૫	સરનામું	ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ છઠ્ઠો માળ, ગીફ્ટ-૫, રોડ-૫ સી, ઓન-૫, ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૫૦	વિદ્યુત લોકપાલ શ્રી ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે, CMTS બિલ્ડીંગ, ટેલિફોન એક્સચેન્જ, બિમાનગર, જીવનધામ રોડ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫	વિદ્યુત લોકપાલ શ્રી ની કચેરી ત્રીજો માળ, બ્લોક નં-૧, જીલ્લા સેવા સદન-૩ સરકારી પ્રેસ રોડ, રાજકોટ ૩૬૦૦૨૧

નિયમ સંગ્રહ-૧૭

અન્ય ઉપયોગી માહિતી :

લોકો દ્વારા પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો :-

(૧) માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ-૨૦૦૫ ક્યારથી અમલમાં આવે છે?

માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ-૨૦૦૫, ૧૨ મી ઓક્ટોબર, ૨૦૦૫ (૧૫ મી જૂન-૨૦૦૫ના રોજ તેના ઘડતરથી ૧૨૦ મા દિવસેથી અમલમાં આવે છે.

(૨) "માહિતી" એટલે શું ?

માહિતી એટલે દફતર, દસ્તાવેજો, યાદીઓ, ઇ/મેઇલ, મંતવ્યો, સલાહો, પ્રેસ રીલિઝ, પરિપત્રો, હુકમો, લોગબુક્સ, કરાર, અહેવાલો, કાગળો, નમૂનાઓ, મોડેલ, કોઇપણ ઇલેક્ટ્રોનીક્સ રૂપમાં ડેટા સામગ્રી અને અત્યારે અમલમાં હોય તેવા કોઇપણ કાયદા અન્વયે કોઇ જાહેર સત્તાધિકારી દ્વારા મેળવવામાં આવનાર કોઇપણ ખાનગી સંસ્થાને લગતી માહિતી.

(૩) માહિતીનો અધિકાર એટલે શું ?

માહિતીના અધિકારમાં નીચેનાનો સમાવેશ થાય છે:-

- (૧) કાર્યો, દસ્તાવેજો, દફતરોનું નિરીક્ષણ કરવું.
- (૨) દસ્તાવેજો અથવા દફતરોની નોંધ કરવી, ઉતારા અથવા પ્રમાણિત નકલો.
- (૩) સામગ્રીના પ્રમાણિત નમૂના લેવા.
- (૪) પ્રિન્ટ આઉટ, ડિસ્કેટ ફ્લોપી, ટેપ, વિડીયો કેસેટ અથવા કોઇપણ અન્ય ઇલેક્ટ્રોનિક રીતે અથવા પ્રિન્ટ આઉટથી માહિતી મેળવવી.

(૪) માહિતી અધિકાર બાબતના અધિનિયમમાંથી કઇ બાબતોને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે?

નીચેની બાબતોને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે :-

- (૧) એવી માહિતી કે જાહેર કરવાથી ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વ્યૂહાત્મક વૈજ્ઞાનિક કે આર્થિક હિતો, વિદેશી રાજ્યો સાથેના સંબંધોને પ્રતિકૂળ અસર પહોંચતી હોય અથવા તો તે ગુનાખોરીને ઉત્તેજન આપતી હોય.

- (૨) એવી માહિતી કે જેને કાયદાની કોઇપણ અદાલતે ન્યાયઆયોગ પ્રસિધ્ધ કરવાની સ્પષ્ટપણે મનાઇ ફરમાવી હોય અથવા તો જે માહિતી જાહેર કરવાથી અદાલતની અવજ્ઞા થતી હોય.
- (૩) એવી માહિતી કે જે જાહેર કરવાથી સંસદ કે રાજ્ય વિધાનસભા વિશેષાધિકારનો ભંગ થતો હોય.
- (૪) સક્ષમ અધિકારીને ખાતરી થાય કે, વિશાળ જાહેર હિતમાં આવી માહિતી પ્રગટ કરવી જરૂરી છે. તે સિવાય વાણિજ્યિક ગોપનીયતા, ધંધાકીય રહસ્યો અથવા બૌદ્ધિક સંપદાનો સમાવેશ કરતી માહિતી, જે જાહેર થવાથી ત્રાહિત પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકશાન થઈ શકે તેમ હોય તેવી કોઇ માહિતી,
- (૫) વ્યક્તિને તેના વિશ્વાસ આધારિત સંબંધને કારણે મળેલી માહિતી સિવાય કે, સક્ષમ અધિકારીને એવી ખાતરી થાય કે આવી માહિતી જાહેર કરવી એ વિશાળ જન હિતના સમર્થનમાં છે.
- (૬) વિદેશની સરકાર પાસેથી મળેલી ગુપ્ત માહિતી.
- (૭) એવી માહિતી કે જે જાહેર કરવાથી કોઇ વ્યક્તિની જિંદગી કે શારીરિક સલામતી સામે જોખમ ઉભું થતું હોય અથવા તો માહિતીનું પ્રાપ્તિસ્થાન જાણી શકાય તેમ હોય અથવા તો કાયદાના અમલ કે સલામતીના હેતુ માટે આપવામાં આવેલ ખાનગી સહાય અંગેની વિગતો જાણી શકાતી હોય,
- (૮) એવી માહિતી કે જે જાહેર કરવાથી ગુનેગારોની તપાસ, ધરપકડ કે તેની સામે કામ ચલાવવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો થતો હોય.
- (૯) મંત્રીમંડળ, સચિવો અને અન્ય અધિકારીઓ વચ્ચે થયેલ વિચારવિમર્શ- અંગેના રેકર્ડ સહિતના કેબીનેટના કાગળો.
- (૧૦) વ્યક્તિગત બાબતો સાથે સંબંધિત માહિતી કે જેની જાહેરાતને કોઇપણ સાર્વજનિક પ્રવૃત્તિ કે લોકહિત સાથે સંબંધ ન હોય, અથવા તો જે માહિતી પ્રગટ કરવાથી વ્યક્તિના અંગત જીવન પર અનધિકૃત હુમલો થતાં હોય.

(૫) જાહેર સત્તામંડળ (Public authority) એટલે શું?

જાહેર સત્તામંડળ એટલે :

- (ક) બંધારણ દ્વારા કે તે અન્વયે
 - (ખ) સંસદ દ્વારા ઘડવામાં આવેલ/ અન્ય કોઇ પણ કાયદા દ્વારા
 - (ગ) રાજ્ય વિધાનસભા દ્વારા ઘડવામાં આવેલ / અન્ય કોઇપણ કાયદા દ્વારા
 - (ઘ) સમુચિત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાથી અથવા કરવામાં આવેલ હુકમથી,
- સ્થાપેલ અથવા રચાયેલ કોઇ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજ્યની સંસ્થા અને તેમાં સમુચિત સરકારે પૂરાં પાડેલા ફંડથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે,
- (૧) માલિકીના નિયંત્રિત અથવા મોટા પાયે ધિરાણ મેળવેલ મંડળ,
 - (૨) મોટા પાયે ધિરાણ મેળવતાં બિન-સરકારી સંગઠનનો પણ સમાવેશ થાય છે.

(૬) કઈ સંસ્થાઓને માહિતી અધિકાર બાબતના અધિકાર બાબતની જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવેલ છે?

માહિતીના અધિકાર બાબતના અધિનિયમની બીજી અનુસૂચિમાં નિર્દિષ્ટ કેન્દ્રીય બાતમી અને સલામતી સંસ્થાઓ જેવી કે બાતમી કાર્યાલય, સંશોધન અને અન્વેષણ શાખા, મહેસૂલ બાતમી નિયામકની કચેરી, કેન્દ્રીય આર્થિક બાતમી કાર્યાલય, અમલબજાવણી- નિયામકશ્રીની કચેરી, માદક દ્રવ્ય નિયંત્રણ કાર્યાલય, ઉડ્ડયન સંશોધન કેન્દ્ર, ખાસ સીમા સુરક્ષા દળ, સરહદ સુરક્ષા દળ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, ઇન્ડો તિબેટ સરહદ પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ, રાષ્ટ્રીય સલામતી રક્ષક, આસામ રાઇફલ્સ, ખાસ સેવા કાર્યાલય, ખાસ શાખા (છૂપી પોલીસ ખાતુ) આંદામાન અને નિકોબાર, ગુન્હો શોધક શાખા, છૂપી પોલીસ ખાતુ, ગુન્હા શોધક શાખા, દાદરા અને નગર હવેલી તથા ખાસ શાખા, લક્ષદ્વીપ પોલીસ, રાજ્ય સરકારો દ્વારા જાહેરનામા મારફત નિર્દિષ્ટ સંસ્થાઓને પણ બાકાત રાખવામાં આવશે. તેમ છતાં આ નિષેધ અબાધિત નથી અને ભ્રષ્ટાચાર તેમજ માનવ અધિકારની અવગણનાના આક્ષેપોને લગતી માહિતી પૂરી પાડાવી એ આ સંસ્થાઓની ફરજ છે. વધુમાં માનવ અધિકારની અવગણનાના આક્ષેપોને લગતી ફક્ત કેન્દ્ર કે રાજ્ય માહિતી આયોગની મંજૂરી લઈને જ યથાયોગ્ય આપી શકશે.

(૭) જાહેર માહિતી અધિકારીઓ કોણ છે?

સરકારી માહિતી અધિકારીઓ એ જાહેર સત્તા તંત્રો દ્વારા તમામ વહીવટી એકમો અથવા તેના નિયંત્રણ હેઠળની કચેરીઓમાં નિયુક્ત કરવામાં આવતા અધિકારીઓ છે જેઓને આ અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે વિનંતી કરતા નાગરિકોને માહિતી પૂરી પાડવાની હોય છે. કોઇપણ અધિકારી તેની અથવા તેણીની યોગ્ય ફરજો બજાવવા માટે સરકારી માહિતી અધિકારી દ્વારા જે સહાય માગવામાં આવે તેવી તમામ સહાય આપશે અને આ અધિનિયમની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ આવા અન્ય અધિકારીને સરકારી માહિતી અધિકારી તરીકે ગણવામાં આવશે.

(૮) સરકારી માહિતી અધિકારીની ફરજો શું છે?

- માહિતી મેળવવા માગતી વ્યક્તિઓ પાસેથી મળતી વિનંતીઓ અંગે સરકારી માહિતી અધિકારીય કાર્યવાહી કરશે અને જ્યાં લેખિતમાં વિનંતી કરી શકાય તેમ ન હોય ત્યાં તે અન્ય રૂપે વ્યક્તિને યોગ્ય મદદ કરવી.
- જો માંગવામાં આવેલ માહિતી રોકી રાખવામાં આવતી હોય અથવા તેનું વિષય વસ્તુ અન્ય જાહેર સત્તાધિકારીની કામગીરી સાથે ધનિષ્ઠ રીતે સંકળાયેલું હોય તો, સરકારી માહિતી અધિકારીએ તે બાબત અન્ય જાહેર સત્તાધિકારીને પાંચ દિવસમાં તે બાબત તબદીલ કરવી અને અરજદારને તે અંગેની તાત્કાલિક જાણ કરવી.
- સરકારી માહિતી અધિકારી, તેની/તેણીની ફરજો યોગ્ય રીતે બજાવવા માટે અન્ય કોઇપણ અધિકારીની મદદ માંગી શકે.

- માહિતી મળ્યેથી, સરકારી માહિતી અધિકારીએ શક્ય તેટલી ઝડપે અને કોઇપણ સંજોગોમાં વિનંતી મળ્યાના 30 દિવસમાં, તે નિયત કરવામાં આવે તેટલી ફીની ચુકવણી કર્યેથી માહિતી પુરી પાડવી અથવા તો કલમ-8 અથવા કલમ-9 માં નિર્દિષ્ટ કર્યા મુજબના કોઇપણ કારણસર તે વિનંતીને નામંજૂર કરવી.
- જ્યારે માંગવામાં આવેલી માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્યને અસર કરતી હોય ત્યારે વિનંતી મળ્યાના 48 કલાકમાં જ તે પૂરૂ પાડવી.
- જો સરકારી માહિતી અધિકારી નિયત સમયગાળામાં વિનંતી અંગે નિર્ણય કરવામાં નિષ્ફળ જાય તો, તેમણે વિનંતીનો અસ્વીકાર કર્યો છે તેમ માનવામાં આવશે.
- જ્યાં વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય ત્યાં, સરકારી માહિતી અધિકારીએ વિનંતી કરનારને નીચે મુજબની જાણ કરવી.
- (1) આવા અસ્વીકાર માટેના કારણો, (2) આવા અસ્વીકાર સામે જેટલા સમયગાળામાં અપીલ કરી શકાય તે સમયગાળો અને (3) અપીલ અધિકારીની વિગતો.
- સરકારી માહિતી અધિકારીએ જે પ્રકારની માહિતી માંગવામાં આવી હોય એ પ્રકારની માહિતી આપવી, સિવાય કે તે જાહેર સત્તામંડળના નાણા-સાધનોને અયોગ્ય દિશામાં વાળતી હોય અથવા તો વિવાદી રેકર્ડની સલામતી કે જાળવણી માટે હાનિકારક હોય.
- જો આંશિક માહિતી આપવાની મંજૂરી આપવામાં આવી હોય તો, સરકારી માહિતી અધિકારીએ અરજદારને નીચે મુજબની જાણ કરવી નોટીસ આપવી:-
- (ક) માહિતી જેમાં સમાવિષ્ટ છે એવા રેકર્ડ કે જેને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેને અલગ કર્યા પછી માગણી કરેલ રેકર્ડનો ફક્ત તેટલો ભાગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
- (ખ) જેના પર નિર્ણયો આધારિત હતા તે અંગેની બાબતનો ઉલ્લેખ કરીને કોઇપણ હકીકત આધારિત મહત્વના પૂરુષ અંગેના કોઇપણ તારણો સહિત નિર્ણય માટેના કારણો;
- (ગ) નિર્ણય કરનાર વ્યક્તિનું નામ અને હોદ્દો;
- (ઘ) તેણે/ તેણીએ ગણતરી કરેલ ફીની વિગતો અને અરજદારે જમા કરવી જરૂરી ફીની રકમ, અને
- (ચ) માહિતીનો જે ભાગ જાહેર ન કરવાનો હોય તે અંગેના નિર્ણયની સમીક્ષા, વસૂલ કરવામાં આવેલ ફીની રકમ અથવા જે પ્રકારે માહિતી પૂરી પાડવામાં આવી હોય તે બાબતમાં તેનાતેણીના/ અધિકારો.
- જો માંગવામાં આવેલ માહિતી ત્રીજા પક્ષકાર દ્વારા પૂરી પાડવામાં આવી હોય અથવા તો ત્રીજા પક્ષકાર દ્વારા તેને ખાનગી માહિતી તરીકે ગણવામાં આવી હોય તો, સરકારી માહિતી અધિકારી માગણી મળ્યાના પાંચ દિવસમાં તે ત્રીજા પક્ષકારને લેખિત નોટીસ આપી શકશે અને તેની રજૂઆતને વિચારણામાં લેશે.
- આવી નોટીસ મળ્યાની તારીખથી 10 દિવસમાં સરકારી અધિકારી સમક્ષ રજૂઆત કરવાની ત્રીજા પક્ષકારને તક આપવાની રહેશે.

(૯) માહિતી મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?

- (૧) જે બાબત માટે માહિતી મેળવવાની હોય તેની વિગતો દર્શાવતી અરજી સરકારી માહિતી અધિકારીને લેખિતમાં અથવા વિજાણું માધ્યમો દ્વારા ગુજરાતીમાં, અંગ્રેજીમાં અથવા હિન્દીમાં કરવી.
- (૨) કઇ બાબત અંગે માહિતી મેળવવાની છે તે અંગેના કારણો દર્શાવવાની જરૂર નથી.
- (૩) નિયત કરવામાં આવે તેટલી ફી ચૂકવો, ગરીબી રેખા હેઠળની કક્ષામાં આવતા લોકો પાસેથી કોઇ જ ફી લેવાની નથી.
- (૪) સરકારી માહિતી અધિકારી નિયત કરેલી સમય મર્યાદાનું પાલન ન કરી શકે તો અરજદારને માહિતી વિના મુલ્યે પૂરી પાડવી.

(૧૦) માહિતી મેળવવા માટેની સમય મર્યાદા કેટલી છે?

- (૧) અરજી મળ્યાની તારીખથી ૩૦ દિવસ સુધીમાં.
- (૨) વ્યક્તિની જીંદગી અને સ્વતંત્રતાને અસરકર્તા હોય તે સંજોગોમાં માહિતી મેળવવા માટે ૪૮ કલાક.
- (૩) જો અરજી મદદનીશ સરકારી માહિતી અધિકારીને માહિતી માટે આપી હોય તો જવાબ આપવાના ઉપરોક્ત સમયગાળામાં ૫-દિવસનો સમય વધારવામાં આવશે.
- (૪) જો આમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલ હશે તો સમય મર્યાદા ૪૦ દિવસ સુધીની રહેશે.
- (૫) નિયત સમય મર્યાદામાં માહિતી આપવામાં નિષ્ફળ જવું એનો અર્થ માહિતી આપવાનો અસ્વીકાર કરવામાં આવે છે તેમ માનવામાં આવશે.

(૧૧) ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની કચેરી ક્યાં આવેલી છે?

સરનામું : ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ
છત્રો માળ, ગીફ્ટ-૧, રોડ-૫ સી, ઝોન-૫,
ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૫૦
ફોન નં- ૦૭૯-૨૩૬૦૨૦૦૦
ફેક્સ નં- ૦૭૯-૨૩૬૦૨૦૫૪ – ૦૭૯-૨૩૬૦૨૦૫૫
વેબસાઇટ : www.gercin.org
સમય : સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક
